



Karl Marx, Friedrich Engels, Vladimir Lenin, Joseph Stalin, Enver Hoxha
5 Classics of Marxism

Comintern (Stalinist-Hoxhaists)

<http://ciml.250x.com>



GEORGIA

Georgian Section
www.joseph-stalin.net

SHMG Press – 2012

Karl Marx Press of the Georgian section of
Comintern (SH) – Stalinist-Hoxhaists Movement of Georgia


વૈજ્ઞાનિક સમાજવાદ શ્રેષ્ઠી

માર્કસ અને એંગોલ્સ

કોમ્પુનિસ્ટ
પાર્ટીનું
જહેરનામું

વैज्ञानिक समाजवाद श्रोतु

કોમ્યુનિસ્ટ
પાર્ટીનું
જહેરનામું



Karl Marx



J. Eugene

હુનિયાના કામદારો, એક થાઓ!

કાર્લ માર્ક્સ
અને
ક્રેડિટ અંગેલ્સ

કોમ્યુનિસ્ટ
પાર્ટીનું
જહેરનામું

પરિથિષ્ઠ
ક્રેડિટ અંગેલ્સ
સામ્યવાદના સિદ્ધાંતો



પ્રગતિ પ્રકાશન
મોસ્કો

પ્રકાશકોના બે શબ્દો

‘કોમ્યુનિસ્ટ પાર્ટીના જહેરનામા’નો આ ગુજરાતી અનુવાદ ૧૮૮૮માં સેમ્યુએલ મૂરે ૧૮૪૮ની મૂળ જર્મન વાચનામાંથી કરેલા અને ફ્રેડરિક એંગેલ્સે સંપાદિત કરેલા અંગ્રેજ અનુવાદમાંથી કરવામાં આવ્યો છે.

આ આવૃત્તિમાં એંગેલ્સે ૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિ માટે અને ૧૮૮૦ની જર્મન આવૃત્તિ માટે લખેલી નોંધો તેમ જ વિવિધ આવૃત્તિઓની લેખકોની પ્રસ્તાવનાઓ સામેલ કરવામાં આવી છે. પરિશિષ્ટ રૂપે એંગેલ્સની કૃતિ ‘સામ્યવાદના સિદ્ધાંતો’ આપવામાં આવી છે.

© ગુજરાતી અનુવાદ, પ્રગતિ પ્રકાશન, ૧૯૭૪

અનુક્રમણિકા

૧૮૭૨ની જર્મન આવૃત્તિની પ્રસ્તાવના	૬
૧૮૮૨ની રશીયન આવૃત્તિની પ્રસ્તાવના	૧૧
૧૮૮૩ની જર્મન આવૃત્તિની પ્રસ્તાવના	૧૩
૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિની પ્રસ્તાવના	૧૫
૧૮૯૦ની જર્મન આવૃત્તિની પ્રસ્તાવના	૨૧
૧૮૯૨ની પોલીશ આવૃત્તિની પ્રસ્તાવના	૨૮
૧૮૯૩ની ઈટાલિયન આવૃત્તિની પ્રસ્તાવના	૩૦

કોમ્પ્યુનિસ્ટ પાર્ટીનું જાહેરનામું

૧. મૂડીદાર અને સર્વહારાઓ	૩૬
૨. સર્વહારાઓ અને કોમ્પ્યુનિસ્ટો	૫૧
૩. સમાજવાદી અને સામ્યવાદી સાહિત્ય	૬૨
 ૧. પ્રત્યાઘાતી સમાજવાદ	 ૬૨
ક. સામંતી સમાજવાદ	૬૨
ખ. નિર્મન - મૂડીવાદી સમાજવાદ	૬૪
ગ. જર્મન અથવા "ખરો" સમાજવાદ	૬૫
 ૨. ઇન્ડિયુસ્ટ, અથવા મૂડીવાદી, સમાજવાદ	 ૬૮

૩. ટીકાતમક - તરંગી સમાજવાદ અને સામ્યવાદ	૭૦
૪. વિવિધ વર્તમાન વિરોધી પાર્ટીઓના સંબંધમાં કોમ્યુનિસ્ટોનું ધોરણુ	૭૪

પરિશાષ

ફ્રેડરિક એંગેલ્સ . સામ્યવાદના સિદ્ધાંતો	૭૮
ટિન્પાણીઓ	૧૦૧

“નૂતન વિશ્વ દૃષ્ટિકોણની, સામાજિક શ્રવનના કેત્રને પણ આવરી લેતા સુસંગત ભૌતિકવાદની, વિકાસના અત્યંત સર્વાંગી અને ગહન સિદ્ધાંત રૂપે દ્રુતવાદની, વર્ગસંધર્ઘના તથા નવતર સામ્યવાદી સમાજનું સર્જન કરનારા સર્વહારા વર્ગની વિશ્વ-ઔતિહાસિક કાંતિકારી ભૂમિકાના સિદ્ધાંતની, પ્રતિભામય રૂપે અને તેજસ્વી રૂપરેખા આ કૃતિમાં રજૂ કરવામાં આવી છે.”

લેનિન

‘કોમ્પુનિસ્ટ લીગે’, એ વખતે પ્રવર્તમાન સંઝેગોમાં બેશક ગુજર જ હોઈ શકે એવા આંતરરાષ્ટ્રીય કામદાર મંડળે, આ શબ્દોના લેખકોને, ૧૯૪૭ના નવોબરમાં લંડનમાં ભરાયેલી કોંગ્રેસમાં, પાર્ટીનો વિગતવાર સૈલ્વાંતિક અને અમલી કાર્યક્રમ ઘડી કાઢવાની કામગીરી સોંપી હતી. અહીંથાં પ્રસ્તુત ‘જહેરનામા’ની રચના એવી રીતે થઈ હતી. તેની હસ્તપ્રત ફેબ્રુઆરી કાંતિથી¹ થોડાંક અઠવાડિયાં પહેલાં, મુદ્રણ માટે, લંડન મોકલવામાં આવી હતી. તેનું સૌપ્રથમ પ્રકાશન જર્મન ભાષામાં થયું ત્યાર પછી જર્નની, ઈંગ્લેંડ, અને અમેરિકામાં તેની ઓછામાં ઓછી બાર જુદી જુદી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. અંગ્રેજી ભાષામાં તેનું પહેલું પ્રકાશન ૧૮૫૦માં લંડનના «Red Republican»માં થયું હતું. તેનો અનુવાદ મિસ હેલન મેકફર્લેને કર્યો હતો. ૧૮૭૧માં ઓછામાં ઓછા ત્રણ જુદા જુદા અંગ્રેજ અનુવાદો અમેરિકામાં પ્રકાશિત થયા હતા. ફેંચ ભાષામાં પ્રથમ પ્રકાશન ૧૮૪૮ના જૂન વિખ્લવથી થોડાક વખત પહેલાં પેરિસમાં² થયું હતું, અને ફરી વાર તાજેતરમાં ન્યૂયોર્કના «Le Socialiste»માં થયું હતું. નવો ફેંચ અનુવાદ હાલ તૈયાર થઈ રહ્યો છે. જર્મન ભાષામાં પ્રથમ પ્રકાશન પછી થોડાક વખતે લંડનમાં પોલીશ ભાષામાં પ્રકાશન થયું હતું. રશ્યનન અનુવાદ સાતમા દાયકામાં નિર્નિવામાં પ્રકાશિત થયો હતો. સૌપ્રથમ પ્રકાશન પછી થોડાક વખતે ડેનિશ ભાષામાં પણ તેનું પ્રકાશન થયું હતું.

ગત પચીસ વરસો દરમિયાન પરિસ્થિતિમાં ભલે ગમે એટલું પરિવર્તન થયું હોય તોપણ, ‘જહેરનામા’માં નિર્દ્દિપિત કરવામાં આવેલા સામાન્ય સિલ્વાંતો, સમગ્ર રૂપે, આને પણ હંમેશા જેટલા જ ખરા છે. ક્યાંક ક્યાંક કોઈ વિગત સુધ્યારી શકાય ખરો. ખુદ ‘જહેરનામા’માં જણાવવામાં આવ્યું છે તેમ, સિલ્વાંતોના વાસ્તવિક અમલનો આધાર, દરેક ઠેકાણે અને હંમેશાં, તત્કાલીન પ્રવર્તમાન ઐતિહાસિક પરિસ્થિતિ ઉપર જ રહેશે. એટલે, બીજ વિભાગના અંતમાં રજૂ કરવામાં આવેલાં કાંતિકારી કદમો પર કોઈ ખાસ ભાર નથી મુકવામાં આવ્યો.

એ ફકરો આને ધાર્યો દૃષ્ટિઓ સાવ જુદા શબ્દોમાં લખવામાં આવ્યો હોત. છેલ્લાં પચીસ વરસો દરમિયાન આધુનિક ઉદ્યોગો ભરેલી પ્રચંડ ફાળોને અને તેની સાથે સાથે પાર્ટી તરફથી કામદાર વર્ગના બહેતર તથા વિસ્તૃત સંગઠનને ધ્યાનમાં લેતાં, પહેલાં ફેબ્રુઆરી કાંતિ દરમિયાન અને તેનાથીએ વધારે પ્રમાણમાં ત્યાર પછી પેરિસ કોમ્પ્યુન³ દરમિયાન—સર્વહારા વર્ગ પહેલી જ વાર જેમાં પૂરા બે મહિના રાજકીય સત્તા પોતાના કબજામાં રાખી હતી એ પેરિસ કોમ્પ્યુન દરમિયાન—હાંસલ કરવામાં આવેલા અમલી અનુભવને ધ્યાનમાં લેતાં, આ કાર્યક્રમની કેટલીક વિગતો કાલગ્રસ્ત બની ગઈ છે. કોમ્પ્યુનથી એક બાબત વિશેષ રૂપે સાભિત થઈ ગઈ કે “કામદાર વર્ગ તૈયાર રાજ્યતંત્રને સીધું કબજે કરી લઈને તેનો ઉપયોગ પોતાના હેતુઓ માટે ન કરી શકે.” (જુઓ—«The Civil War in France; Address of the General Council of the International Working Men's Association», London, Truelove, 1871, p. 15, જ્યાં આ મુદ્દાની વધુ છણાવટ કરવામાં આવી છે.) વધુમાં—આપોઆપ દેખાઈ આવે છે કે સમાજવાદી સાહિત્યનું વિવેચન અપૂર્ણ છે કારણ કે તે માત્ર ૧૮૪૭ સુધીનું જ છે. એ ઉપરાંત, વિવિધ વિરોધી પાર્ટીઓ જેઠે કોમ્પ્યુનિસ્ટોના સંબંધો અંગેનાં મંતવ્યો (ચોથો વિભાગ) સિદ્ધાંતની દૃષ્ટિઓ આને પણ ખરાં હોવા છતાં વાસ્તવમાં કાલગ્રસ્ત થઈ ગયેલાં છે કારણ કે રાજકીય પરિસ્થિતિ તદ્દન પલટાઈ ગઈ છે. અને તેમાં ઉલ્લેખિત પાર્ટીઓમાંથી મોટા ભાગની પાર્ટીઓને ઈતિહાસે જગતમાં નાણ કરી નાખી છે.

પરંતુ ‘જાહેરનામું’ તો હવે ઐતિહાસિક દસ્તાવેજ બની ગયું છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર અમને નથી રહ્યો. ૧૮૪૭થી વર્તમાન સમય સુધીના ગાળાને આવરી લેતું આમુખ કદાચ આ પછીની આવૃત્તિમાં સામેલ કરવામાં આવે. આ પુનર્મુદ્રણ એટલું આપુધાર્ય થયું છે કે તેને માટે અમને વખત જ નથી મળ્યો.

લાંડન, ૨૪મી જૂન, ૧૮૭૨

કાર્લ માર્ક્સ, ફ્રેડરિક અંગોલ્સ

*Das Kommunistische Manifest.
Neue Ausgabe mit einem Vorwort
der Verfasser* નામે પુસ્તકમાં
પ્રકાશિત, વિયાઝિગ, ૧૮૭૨

૧૮૮૨ની રશિયન આવૃત્તિની પ્રસ્તાવના

‘કોમ્યુનિસ્ટ પાર્ટીના જહેરનામા’ની પ્રથમ રશિયન આવૃત્તિ સાતમા દાયકાના^૫ આરંભમાં ‘કોલોકેલ’ના^૬ મુદ્રણ કાર્યાલ્યે પ્રકાશિત કરી હતી. તેનો અનુવાદ બાકુનિને કર્યો હતો. એ વખતે પશ્ચિમને તેમાં (‘જહેરનામા’ની રશિયન આવૃત્તિમાં) કેવળ સાહિત્યિક અજાયબી જ નજરે પડી હતી. આને એવો ખ્યાલ અશક્ય છે.

‘જહેરનામા’નો છેલ્લો વિભાગ—જુદા જુદા દેશોમાં વિવિધ વિરોધી પાર્ટીઓના સંબંધમાં કોમ્યુનિસ્ટોના ધોચણ અંગેનો વિભાગ—તદ્દન સ્પષ્ટ બતાવે છે કે એ વખતે (૧૮૪૭ના ડિસોબરમાં) સર્વહારા આંદોલનનું ક્ષેત્ર કેટલું સીમિત હતું. તેમાં રશિયા અને અમેરિકાનો ઉલ્લેખ જ નથી. એ જમાનો એવો હતો કે જ્યારે રશિયા સમગ્ર યુરોપીય પ્રત્યાધાતની આખરી પ્રચંડ તાકાત બની રહ્યું હતું, અને અમેરિકા યુરોપના વધારાના સર્વહારા પરિબળોને અમેરિકામાં વસવાટની છૂટ આપીને પોતાની આંદર સમાવી રહ્યું હતું. બન્ને દેશો યુરોપને કાચો માલ અને સાથે સાથે તેની ઔદ્યોગિક પેદાશો માટે બજારો પૂરાં પાડતા હતા. એટલે એ વખતે એક યા બીજી રીતે બન્ને દેશો પ્રવર્ત્નમાન યુરોપીય વ્યવસ્થાના આધારસ્તંભ હતા.

આને કેટલો બધો ફેર પડી ગયો છે! યુરોપથી આવીને વસેલા માણસોને કારણે જ ઉત્તાર અમેરિકા એવા પ્રચંડ પાયા પર જેતીવાડીનું ઉત્પાદન કરવા સુસજજ બન્યું કે તેની હરીકાઈ યુરોપમાં મોટી અને નાની જમીન-મિલકતના પાયા હચમચાવી રહી છે. વળી એ જ કારણે અમેરિકા પોતાની ઔદ્યોગિક સાધનસંપત્તિનો ઉપયોગ એટલી સ્કૂર્ટિથી તથા એવડા પાયા પર કરી શક્યું કે પશ્ચિમ યુરોપની અને આસ કરીને તો હાલ સુધી કાયમ રહેલો ઈંગ્લેઝની ઔદ્યોગિક ઈજારદારી થોડા વખતમાં જ ખતમ થઈ જવાની. આ બન્ને સંજોગો ખુદ અમેરિકામાં જ કાંતિકારી પ્રતિક્ષિયા કરી રહ્યા છે. જેડૂતોની નાની અને મધ્યમ જમીનમાલિકી, આખી રાજકીય સંઘટનાની આધારશિલા, વિશાળ

એતરોની હરીકાઈનો ભોગ બની રહી છે; તેની સાથે સાથે, ઔદ્યોગિક વિસ્તારોમાં પહેલી જ વાર વ્યાપક સર્વહારા વર્ગનો તેમ જ મુડીનાં કલ્પનાતીત કેદ્દીકરણોનો વિકાસ થઈ રહ્યો છે.

અને હવે રશિયા! ૧૮૮૮-૪૮ની કાંતિ દરમિયાન કેવળ યુરોપના રાજઓને જ નહિ પરંતુ યુરોપના મૂડીદારને પણ, જગ્રત થઈ રહેલા સર્વહારા વર્ગથી મુક્તિનો એકમાત્ર માર્ગ, રશિયન દ્ખલગીરીના રૂપમાં મળ્યો. જારને યુરોપીય પ્રત્યાઘાતનો મુખ્યી ધોષિત કરવામાં આવ્યો. આજે તે ગાતરચિનામાં⁶ કાંતિનો યુષ્ટકેદી છે, અને યુરોપની કાંતિકારી પ્રવૃત્તિમાં રશિયાએ મોખરાનું સ્થાન લઈ લીધું છે.

આધુનિક મૂડીવાદી મિલકતના અનિવાર્ય રૂપે જણુંબી રહેલા વિસર્જનની ધોષણા ‘કોમ્પ્યુનિસ્ટ જહેરનામા’ની મુખ્ય નેમ હતી. પરંતુ રશિયામાં ઝડપથી વિકસી રહેલી મૂડીવાદી ઠગબાજ તથા વિકાસની દિશામાં કદમ માંડી રહેલી મૂડીવાદી જમીન-મિલકતની સાથે સાથે આપણું જેવા મળે છે કે જમીનના અરથાથી વધારે હિસ્સા ઉપર કિસાનોની સામુદ્દાયિક માલિકી છે. હવે સવાલ આવો છે — રશિયન ઓબ્ષ્યોના* કે ને ખૂબ કમાઝેર બની ગયેલ છે પરંતુ તોએ જમીનની આદિમ સામુદ્દાયિક માલિકીનું રૂપ છે તે સીધું સામ્યવાદી સામુદ્દાયિક માલિકીના ઉચ્ચતર રૂપમાં પવટાઈ શકશે ખરું? કે પછી, એથી ઊલટું, પશ્ચિમમાં વિસર્જનની ને પ્રક્રિયા ઐતિહાસિક ઉત્કાંતિ બની છે એવી જ પ્રક્રિયા તેને પહેલાં પાર કરવી જ પડશે?

તેનો આજે એકમાત્ર શક્ય જવાબ આવો છે — જે રશિયન કાંતિ પશ્ચિમમાં સર્વહારા કાંતિ માટે સંકેત બની જાય, જેથી બન્ને પરસ્પર પૂરક બની રહે, તો રશિયામાં વર્તમાન સમયે જમીનની સામુદ્દાયિક માલિકી છે તે સામ્યવાદી વિકાસના આરંભબિંદુની કામગીરી બજાવી શકે.

દાંડન, ૨૧મી જાન્યુઆરી, ૧૮૮૨

કાર્લ માર્ક્સ, ફ્રેડરિક અંગેલ્સ

* ઓબ્ષ્યોના — રશિયન ગ્રામસમાજ

ખેદની વાત છે કે આ આવૃત્તિની પ્રસ્તાવના ઉપર મારે એકલાએ જ હસ્તાક્ષર કરવાના છે. યુરોપ અને અમેરિકાનો સમગ્ર કામદાર વર્ગ જેનો અન્ય કોઈ માનવી કરતાં વધારે ઝાણી છે એ માર્ક્સ હાઇજેટ કબ્રસ્તાનમાં ચિરનિદ્રામાં પોઢી ગયા છે, અને એમની કબર ઉપર ધાસના ફણગા પણ ફૂટવા લાગ્યા છે. એમના અવસાન પછી તો ‘જહેરનામા’માં સુધારા કે વધારા કરવાનો કશો વિચાર ભાગે જ કરી શકાય. હું તો નીચેની બાબત અહીંથાં ફરી વાર સ્પષ્ટ રૂપે જણાવવાનું હવે વધારે જરૂરી ગણું છું:

‘જહેરનામા’માં ઓતપ્રોત પાયાનો ખયાલ—કે આર્થિક ઉત્પાદન અને તેમાંથી જ આવશ્યક રૂપે ઉદ્ભવ પામનું પ્રત્યેક ઐતિહાસિક યુગનું સમાજતંત્ર, એ યુગના રાજકીય તથા બૌધ્ધિક ઈતિહાસનો પાયો બની રહે છે; તેના પરિણામે (જમીનની પ્રારંભિક સામુદ્ધાર્યિક માલિકીના વિસર્જન પછી) સમગ્ર ઈતિહાસ વર્ગસંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે, શોખિતો અને શોખકો વર્ચેના, સામાજિક વિકાસને જુદે જુદે તબક્કે વર્ચસ્વ ધરાવતા અને તાબેદારી વેઠતા વર્ગો વર્ચેના, સંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે; પરંતુ એ સંધર્ણ હવે એવી કષાએ પહોંચી ગયો છે કે શોખિત અને પીડિત વર્ગ (સર્વહારા વર્ગ) માટે, તેનું શોખણ તથા પીડન કરનારા વર્ગથી (મૂરીદાર વર્ગથી) મુક્તિ હાંસલ કરવાનું હવે, સાથોસાથ સમગ્ર સમાજને શોખણ, પીડન તથા વર્ગસંઘર્ષથી મુક્ત કર્યા વગર, શક્ય નથી—આ પાયાનો ખયાલ કેવળ અને એકલા માર્ક્સનો જ છે.*

* “અંગ્રેજ અનુવાદની પ્રસ્તાવનામાં મેં લખેલું કે જીવવિજ્ઞાનની બાબતમાં ડાર્વિનના સિદ્ધાંતે” જેવી કામગીરી બજાવી હતી એવી જ કામગીરી મારા અભિપ્રાયમાં ઈતિહાસની બાબતમાં બજાવવાનું ભવિષ્ય ધરાવતા આ વિધાન નજીક અમે બન્ને ૧૮૪૫ પહેલાં કેટલાંક વરસોથી ધીરે ધીરે પહોંચી રહ્યા હતા. મેં એ દિશામાં સ્વતંત્ર રીતે કેટલી પ્રગતિ કરી હતી તે ‘ઈંગ્લેઝમાં કામદાર

આ વાત હું ઘણો વાર જગ્યાવી ચૂક્યો છું, પરંતુ ચોક્કસ રૂપે હવે તો જરૂરી બની ગયું છે કે તેને ‘જહેરનામા’ની જોડાંજેડ પણ રજૂ કરવામાં આવે.

દંડન, ૨૮મી જન, ૧૯૮૩

એફ. અંગેલ્સ

«Das Kommunistische Manifest»

નામે પુસ્તકમાં પ્રકાશિત,
હોટિંગન, ઝુરિક

વર્ગની સ્થિતિ’ નામે મારી કૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ હું ૧૮૪૫ની વસંત દરમિયાન માર્ક્સને બ્રસેલ્સમાં ફરી વાર મળ્યો ત્યારે એમણે આ વિવાન ઘડીને તૈયાર કરી નાખ્યું હતું, અને તેને લગભગ મારી અહીંની રજૂઆત જેટલા જ સ્પષ્ટ શબ્દોમાં મારી સમક્ષ નિરૂપિત કર્યું હતું.” (૧૯૯૦ની જર્નન આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

‘જહેરનામા’નું પ્રકાશન ‘કોમ્યુનિસ્ટ લીગ’ના — પહેલાં માત્ર જર્મન પરંતુ આગળ જતાં આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ અને તળ યુરોપખંડની ૧૮૪૮ પહેલાંની રાજકીય પરિસ્થિતિમાં અનિવાર્ય રૂપે ગુપ્ત સંસ્થાના — કાર્યક્રમ તરીકે થયું હતું. ૧૮૪૭ના નવોબરમાં લંડનમાં ભરાયેલી લીગની કોંગ્રેસમાં માર્ક્સ અને એંગેલ્સને પાટીનો સંપૂર્ણ સૈદ્ધાંતિક તથા અમલી કાર્યક્રમ પ્રકાશન માટે તૈયાર કરવાની કામગીરી સોચવામાં આવી હતી. ૧૮૪૮ના જન્યુઆરીમાં જર્મન ભાષામાં ઘડવામાં આવેલા કાર્યક્રમની વાચના પ્રકાશન માટે રફ્મી ફેબ્રુઆરીની ફ્રેંચ કાંતિથી^૪ થોડાંક અઠવાડિયાં પહેલાં લંડન મોકલવામાં આવી હતી. ફ્રેંચ અનુવાદનું પ્રકાશન ૧૮૪૮ના જૂનના વિભલવથી થોડાક વખત પહેલાં પેરિસમાં થયું હતું. મિસ હેલન મેકફલેને કરેલો પ્રથમ અંગ્રેજ અનુવાદ ૧૮૫૦માં લંડનમાં જ્યોર્જ જુલિયન હાઈના «Red Republican»માં પ્રકાશિત થયો હતો. તેનિશ તથા પોલીશ આવૃત્તિઓ પણ પ્રકાશિત થઈ હતી.

૧૮૪૮ના જૂનના પેરિસ વિભલવના — સર્વહારા વર્ગ અને મૂડીવાદી વર્ગ વચ્ચેની મહાન લડાઈના — પરાણ્યે યુરોપીય કામદાર વર્ગની સામાજિક તથા રાજકીય આકંક્ષાઓને થોડા વખત પૂરતી પૃષ્ઠભૂમિમાં ધકેલી દીધો. ત્યાર પછી વર્ષસ્વ માટેનો સંધર્ષ ફેબ્રુઆરી કાંતિ પૂર્વેના સમયની નેમ જ મિલકનદાર વર્ગના વિવિધ વિભાગો વચ્ચે ચાલતો રહ્યો, કામદાર વર્ગ રાજકીય રાહત માટે ઘડવાની હાલતમાં અને મધ્યમ વર્ગીય રેઝિક્લોની (આમૂલ પરિવર્તનવાદીઓની) ઉગ્ર પાંખની સ્થિતિમાં આવી ગયો હતો. સ્વતંત્ર સર્વહારા આંદોલનોએ જ્યાં જ્યાં ચેતનની નિશાનીઓ બતાવવાનું ચાલુ રાખ્યું ત્યાં ત્યાં તેઓને નિર્દ્દય રીતે કચડી નાખવામાં આવ્યાં. એ રીતે પ્રશિયન પોલીસે ‘કોમ્યુનિસ્ટ લીગ’ની એ વખતે કલોનમાં સ્થિત કેદ્દીય સમિતિનો પત્તો મેળવી લીધો. સભ્યોને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા અને અઢાર મહિનાના કારાવાસ પછી ૧૮૫૨ના ઓક્ટોબરમાં તેમની ઉપર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ પ્રખ્યાત “કલોન કોમ્યુનિસ્ટ

મુક્કદમો” ચોથી ઓક્કોબરથી બારમી નવેંબર સુધી ચાલ્યો. સાત કેદીઓને કિલ્લામાં કારાવાસની ત્રણ વરસથી લઈને છ વરસ સુધીની જુદી જુદી સજાઓ ફ્ટકારવામાં આવી. ફેસલા પછી તરત જ બાકીના સભ્યોએ લીગનું વિસર્જન કરી નાખ્યું. ‘જહેરનામા’નું ભવિષ્ય તો એ સમયથી જાણે વિસ્મૃતિમાં અટવાઈ જવાનું હોય એમ લાગતું હતું.

યુરોપીય કામદાર વર્ગ શાસક વર્ગોની ઉપર નવો હુમલો કરવા માટે પૂરતી તાકાત પાછી હાંસલ કરી લીધી ત્યારે ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’નો ઉદ્ય થયો. પરંતુ યુરોપ અને અમેરિકાના સમગ્ર જોશીવા સર્વખારા વર્ગને એક જ સંગઠનમાં સાંકળી બેવાના ધ્યેય સારુ સ્થાપવામાં આવેલું એ મંડળ, ‘જહેરનામા’માં નિર્દિષ્ટ સિદ્ધાંતોની ઘોષણા તત્કાળ ન કરી શક્યું. ઈંગ્લેઝનાં ટ્રેડ યુનિયનોને, ફ્રાંસ, બેલિન્યમ, ઈટાલી તથા સ્પેનમાં પ્રધોના⁹ અનુયાયીઓને, અને જર્મનીમાં લાસાલપંથીઓને¹⁰ સ્વીકાર્ય બને એટલા પૂરતો બહોળો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સંગઠને અપનાવવાનો હતો. તમામ પક્ષોને પૂરો સંતોષ આપે એવો કાર્યક્રમ માફસે ઘડી આપ્યો. તેમને વિશ્વાસ હતો કે સમન્વિત કદમ તથા પરસ્પર ચર્ચાવિચારણાના પરિણામે કામદાર વર્ગનો બૌલ્દિક વિકાસ ચોક્કસ રૂપે થશે જ. મૂડીની સામેના સંધર્ઘની ખુદ ઘટનાઓ તથા ચડતીપડતીઓ, વિજયો કરતાંથે વધારે તો પરાજયો, કામદારોનાં મનમાં તેમની વિવિધ માનીતી તરકીબોના અપૂરતાપણાની પ્રતીતિ કરાયા વગર તેમ જ કામદાર વર્ગની મુક્તિ અંગેના ખરા સંજેંગોની વધારે પરિપૂર્ણ સમજાપુનો માર્ગ મોકળો કર્યા વગર રહે જ નહિ. અને માફસની ધારણા ખરી હતી. ૧૮૭૪માં આંતરરાષ્ટ્રીય સંગઠન નૂઠી ગયું ત્યારે કામદારો ૧૮૬૪ના કામદારો કરતાં તદ્દન નિરાણા ઈન્સાનો હતા. ફ્રાંસમાં પ્રધોંપંથ તથા જર્મનીમાં લાસાલપંથ ખતમ થઈ રહ્યા હતા. રૂઢિયુસ્ત અંગ્રેજ ટ્રેડ યુનિયનોમાંથી મોટા ભાગનાંએ આંતરરાષ્ટ્રીય સંગઠન જોડેના સંબંધો લાંબા વખત પહેલાં તોડી નાખ્યા હતા, પરંતુ તેઓ પણ ધીરે ધીરે આગળ વધતા એવે તબક્કે પહોંચી ગયા હતા કે ગયે વરસે સ્વાન્સીમાં તેમનો પ્રમુખ તેમના વતી આવા શર્દી કહી શક્યો — “તળ યુરોપઅંડના સમાજવાદથી હવે

* અમારી સમક્ષ લાસાલ વ્યક્તિગત રીતે પોતાને હંમેશાં માફસનો શિષ્ય ગણાવતો હતો અને તે મુજબ ‘જહેરનામા’નું ધોરણ માનતો હતો. પરંતુ ૧૮૬૨-૬૪ દરમિયાન જહેર આંદોલનમાં તે રાજ્યનું ધીરાણ ધરાવતાં સરકારી કારખાનાંની માંગથી આગળ ન ગયો. (અંગેલ્સની નોંધ.)

અમે ગ્રાસ નથી પામતા.” હકીકતમાં, ‘જહેરનામા’ના સિલ્વાંતોએ સધળા દેશોના કામદાર ઈન્સાનોની અંદર સારો એઠે પ્રગતિ સાધી હતી.

એ રીતે ખુદ ‘જહેરનામું’ ફરી મોખરે આવ્યું. ૧૮૫૦ પછી સિવટ્ટબ્લેંડ, ઈંગ્લેંડ, અને અમેરિકામાં જર્મન વાચનાનું પુનર્મુદ્રણ કેટલીય વાર થયું હતું. ૧૮૭૨માં ન્યૂયૉર્કમાં તેનો અંગ્રેજ અનુવાદ થયો હતો અને ત્યાં «Woodhull and Claflin's Weekly»માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ અંગ્રેજ વાચનાનું ફ્રેંચ ભાષાંતર ન્યૂયૉર્કમાં «Le Socialiste»માં પ્રકાશિત થયું હતું. ત્યાર પછી વધુ બે લગભગ સાવ વિકૃત અંગ્રેજ અનુવાદો અમેરિકામાં છપાયા છે, અને તેમાંનો એક ઈંગ્લેંડમાં ફરી છાપવામાં આવ્યો છે. બાકુનિને કરેલો પ્રથમ રશિયન અનુવાદ લગભગ ૧૮૬૬માં જનિવામાં હેર્ડના ‘કોલોકોલ’ કાર્યાલયે પ્રકાશિત કર્યો હતો, અને પરાકમી વેરા ઝૂલિયે* કરેલો બીજો રશિયન અનુવાદ પણ જનિવામાં ૧૮૮૨માં પ્રકાશિત થયો હતો. નવી ડેનિશ આવૃત્તિ ૧૮૮૫માં કોપનહેગનમાં «Socialdemokratisk Bibliothek»માં પ્રગટ થઈ હતી, અને નવો ફ્રેંચ અનુવાદ ૧૮૮૫માં પેરિસમાં «Le Socialiste»માં પ્રકાશિત થયો હતો. એ ફ્રેંચ વાચનાનું સ્પેનિશ ભાષાંતર તૈયાર કરીને ૧૮૮૬માં મેડ્રિડમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જર્મન ભાષાનાં પુનર્મુદ્રણો તો ગણ્યાય એમ જ નથી, બધાં મળીને ઓછામાં ઓછાં બાર તો થયાં જ છે. આર્મનિયન ભાષામાં અનુવાદ કેટલાક મહિના પહેલાં કોન્સ્ટટીનોપલમાં છપાવાનો હતો તે પ્રકાશિત થયો જ નહિ. તેનું કારણ મને એવું જણાવવામાં આવ્યું છે કે માર્ક્સનું નામ ધરાવતું પુસ્તક પ્રકાશિત કરવામાં પ્રકાશકને બીક લાગી, અને અનુવાદકે તેને પોતાની કૃતિ ગણ્યાવવાનો ઈનકર કર્યો. બીજી ભાષાઓમાં વધુ અનુવાદો વિશે મેં સાંભળ્યું છે ખરું, પણ મેં એ જોયા નથી. એ રીતે, ‘જહેરનામા’ના ઈતિહાસમાં આધુનિક કામદાર વર્ગીય આંદોલનનો ઈતિહાસ મહંદશે પ્રતિબિંબિત થાય છે. વર્તમાન સમયે સમગ્ર સમાજવાદી સાહિત્યમાં તે નિઃશાંક અધિકતમ વ્યાપક તથા અધિકતમ આંતરરાષ્ટ્રીય પ્રકાશન પામેલી કૃતિ છે, સાઈબિરિયાથી કેલિફ્રોન્યા સુધીના લાખો કામદાર ઈન્સાનોએ સ્વીકારેલો સર્વસામાન્ય કાર્યક્રમ છે.

* આગળ જતાં ૧૮૮૪માં એંગેલ્સે ખુદ, «Internationales aus dem Volksstaat» (૧૮૭૧-૭૫)માં પ્રકાશિત ‘રશિયામાં સામાજિક સંબંધો’ નામે લેખના બર્લિનમાં પ્રગટ થયેલા અનુક્થનમાં, ઉચિત નિર્દેશ કર્યો હતો કે એ અનુવાદ હકીકતમાં જી.વી. ખેખાનોવે કર્યો હતો.—સં.

તેમ છતાં તે જ્યારે લખવામાં આવ્યું ત્યારે અમે તેને સમાજવાદી જહેરનામું કહી શકીએ એમ નહોતા. ૧૮૪૭માં સમાજવાદીઓ કહેવાથી બે પ્રકારના માણસો સમજવામાં આવતા હતા. એક તો વિવિધ તરંગી વિચારધારાઓના અનુયાયીઓ — ઈંગ્લેઝમાં ઓવેનપંથીઓ¹¹, ફ્રાંસમાં કૂરિયેપંથીઓ¹². એ બન્ને ક્યારની ખાલી સંપ્રદાય જેવી હાલતમાં પહોંચી ગઈ હતી અને ધીરે ધીરે ખતમ થઈ રહી હતી. બીજી પ્રકારના માણસો હતા પચરંગી સામાજિક ઉટવેંડો અને તેઓ મૂડી તથા નફને મુદ્દા જેખમમાં મૂક્યા વગર તરેહવાર થાગડથીગડ અન્જમાવીને ભાતભાતની સામાજિક તકલીફો દૂર કરી દેવાના દાવા કરતા હતા. બન્ને પ્રકારના માણસો કામદાર વર્ગીય આંદોલનની બહાર હતા અને “સુશ્રિકિત” વર્ગનું સમર્થન મેળવવાની વધારે આશા રાખતા હતા. કામદાર વર્ગનો જે કંઈ હિસ્સો પ્રતીતિ પામી ચૂક્યો હતો કે ખાલી રાજકીય કાંતિઓ અપૂરતી છે, અને સંપૂર્ણ સામાજિક પરિવર્તનની આવશ્યકતાની ધોષણા કરી ચૂક્યો હતો, એ હિસ્સો પોતાને એ વખતે સામ્યવાદી કહેવડાવતો હતો. એ સામ્યવાદ અણંઘડ, બેઢંગો, અને નિર્ભેણ સહજબુદ્ધિથી પ્રેરિત હતો. પરંતુ તેમ છતાં તે મૂળભૂત મુદ્દાને સ્પર્શિતો હતો, અને ફ્રાંસમાં કાબેનો તથા જર્મનીમાં વાઈટલિંગનો¹³ તરંગી સામ્યવાદ ઉત્પન્ન કરવા પૂરતી તાકાત કામદાર વર્ગમાં ધરાવતો હતો. એ રીતે, ૧૮૪૭માં સમાજવાદનું આંદોલન મધ્યમ વર્ગીય હતું અને સામ્યવાદનું આંદોલન કામદાર વર્ગીય હતું. ઓછામાં ઓછું તળ પુરોપખાંડમાં તો સમાજવાદ “પ્રતિષ્ઠિત” હતો, પણ સામ્યવાદ એથી તદ્દન ઊંબટો હતો. અને અમે શરૂઆતથી જ એવો ખયાલ ધરાવતા હતા કે “કામદાર વર્ગની મુક્તિ ખુદ કામદાર વર્ગનું જ કૃત્ય હોય જોઈએ”, એટલે અમારે બેમાંથી કયું નામ અપનાવવું એ બાબતમાં શંકાને સ્થાન જ નહોતું. વળી, ત્યાર પછી અમે તેને કદી તજ્યું નથી.

‘જહેરનામું’ અમારી સહિયારી કૃતિ છે એટલે હું એમ જણાવવાની મારી ફરજ ગાણ્યું છું કે તેનું કેદ્દુવર્તી મૂળભૂત વિધાન માર્ક્સનું છે. એ વિધાન આવ્યું છે — પ્રત્યેક ઐતિહાસિક યુગમાં, આર્થિક ઉત્પાદન તથા વિનિમયની પ્રવર્તમાન રીત અને આવશ્યક રૂપે તેમાંથી જ ઉદ્ભબ પામતી સામાજિક સંઘટના એક આધાર બની રહે છે, અને એ યુગનો રાજકીય તથા બૌદ્ધિક ઈતિહાસ તેની ઉર રચાય છે તથા માત્ર તેમાંથી જ સમજી શકાય છે; એટલે માનવજાતિનો સમગ્ર ઈતિહાસ (જર્મનીમાં સામુદ્દરિક માલિકી ધરાવતા આદિમ ટોળી-સમાજના વિસર્જન પછી) વર્ગસંધર્થોનો ઈતિહાસ રહ્યો છે, શોખિત અને શોષક, શાસક

અને પીડિત વર્ગો વચ્ચેની રસાકસીઓનો ઈતિહાસ રહ્યો છે; આ વર્ગસંઘર્ષોનો ઈતિહાસ ઉત્કાંતિઓની હારમાણ રચે છે જેમાં વર્તમાન સમયે એવો તબક્કો આવી ગયો છે કે શોખિત અને પીડિત વર્ગ—સર્વહારા વર્ગ—માટે શોષક અને શાસક વર્ગના—મૂડીદાર વર્ગના—વર્યસ્વથી મુજિત સાધવાનું, સાથોસાથ અને કાયમ સારુ સમગ્ર સમાજને શોષણ, પીડન, વર્ગભેદ, તથા વર્ગસંઘર્ષથી મુજલ કર્યા વગર, શક્ય નથી.

જીવિજ્ઞાનની બાબતમાં ડાર્વિનના સિદ્ધાંત¹⁴ જેવી કામગીરી બજાવી હતી એવી જ કામગીરી મારા અભિપ્રાયમાં ઈતિહાસની બાબતમાં બજાવવાનું ભવિષ્ય ધરાવતા આ વિધાન નજીક અમે બનને ૧૮૪૫ પહેલાં કેટલાંક વરસોથી ધીરે ધીરે પહોંચી રહ્યા હતા. મેં એ દિશામાં સ્વતંત્ર રીતે કેટલી પ્રગતિ કરી હતી તે ‘ઈંગ્લેઝમાં કામદાર વર્ગની સ્થિતિ’* નામે મારી કૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ હું ૧૮૪૫ની વસંત દરમિયાન માર્ક્સને બ્રસેલ્સમાં ફરી વાર મળ્યો જ્યારે એમણે આ વિધાન ધડીને તૈયાર કરી નાખ્યું હતું, અને તેને લગભગ મારી અહીંની રજૂઆત જેટલા જ સ્પષ્ટ શબ્દોમાં મારી સમક્ષ નિરૂપિત કર્યું હતું.

૧૮૭૨ની જર્મન આવૃત્તિની અમારી સહિયારી પ્રસ્તાવનામાંથી હું નીચેના શબ્દો ટાંકીશ:

“ગત પચીસ વરસો દરમિયાન પરિસ્થિતિમાં ભલે ગમે એટલું પરિવર્તન થયું હોય તોપણ, ‘જાહેરનામા’માં નિરૂપિત કરવામાં આવેલા સામાન્ય સિદ્ધાંતો, સમગ્ર રૂપે, આને પણ હંમેશ જેટલા જ ખરા છે. ક્યાંક ક્યાંક કોઈ વિગત સુધારી શકાય ખરી. ખુદ ‘જાહેરનામા’માં જાણવવામાં આવ્યું છે તેમ, સિદ્ધાંતોના વાસ્તવિક અમલનો આધાર, દરેક ઠેકાણો અને હંમેશાં, તત્કાલીન પ્રવર્તમાન ઐતિહાસિક પરિસ્થિતિ ઉપર જ રહેશે. એટલે બીજા વિભાગના અંતમાં રજૂ કરવામાં આવેલાં કાંતિકારી કદમો પર કોઈ ખાસ ભાર નથી મૂકવામાં આવ્યો. એ ફકરો આને ધારી ફૂલિએ સાથ જુદા શબ્દોમાં લખવામાં આવ્યો હોત. છેલ્લાં પચીસ વરસો દરમિયાન આધુનિક ઉદ્યોગે ભરેલી પ્રચંડ ફણોને અને તેની સાથે સાથે પાર્ટી તરફથી કામદાર વર્ગના બહેતર તથા વિસ્તૃત સંગઠનને ધ્યાનમાં લેતાં, પહેલાં ફેબ્રુઆરી કાંતિ દરમિયાન અને તેનાથીયે વધારે પ્રમાણમાં ત્યાર પછી

* «The Condition of the Working Class in England in 1844». By Frederick Engels. Translated by Florence K. Wishnewetzky. New York, Lovell—London, W. Reeves, 1888. (અંગેલ્સની નોંધ.)

પેરિસ કોમ્યુન¹⁵ દરમિયાન — સર્વહારા વર્ગો પહેલી જ વાર જેમાં પૂરા બે મહિના રાજકીય સત્તા પોતાના કબજમાં રાખી હતી એ પેરિસ કોમ્યુન દરમિયાન — હાંસલ કરવામાં આવેલા અમલી અનુભવને ધ્યાનમાં લેતાં, આ કાર્યક્રમની કેટલીક વિગતો કાલગ્રસ્ત બની ગઈ છે. કોમ્યુનથી એક બાબત વિશેષ રૂપે સાબિત થઈ ગઈ કે “કામદાર વર્ગ તૈયાર રાજ્યતંત્રને સીધું કબજે લઈને તેનો ઉપયોગ પોતાના હેતુઓ માટે ન કરી શકે.” (જુઓ — «The Civil War in France; Address of the General Council of the International Working Men's Association», London, Truelove, 1871, p. 15, જ્યાં આ મુદ્દાની વધુ છણાવટ કરવામાં આવી છે.) વધુમાં — આપોઆપ દેખાઈ આવે છે કે સમાજવાદી સાહિત્યનું વિવેચન અપૂર્ણ છે કારણ કે તે માત્ર ૧૮૪૭ સુધીનું જ છે. એ ઉપરાંત, વિવિધ વિરોધી પાર્ટીઓ જેડે કોમ્યુનિસ્ટોના સંબંધો અંગેનાં મંતવ્યો (ચોથો વિભાગ) સિધાંતની દૃષ્ટિઓ આજે પણ ખરાં હોવા છિતાં, વાસ્તવમાં કાલગ્રસ્ત થઈ ગયેલાં છે કારણ કે રાજકીય પરિસ્થિતિ તદ્દન પલટાઈ ગઈ છે. અને તેમાં ઉલ્લેખિત પાર્ટીઓમાંથી મોટા ભાગની પાર્ટીઓને ઐતિહાસે જગતમાં નાણ કરી નાખી છે.

“પરંતુ ‘જહેરનાનું’ તો હવે ઐતિહાસિક દસ્તાવેજ બની ગયું છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર અમને નથી રહ્યો.”

આ અનુવાદ, માર્કસની કૃતિ ‘મૂડી’ના મોટા ભાગનો અનુવાદ કરનારા મિસ્ટર સેમ્યુઅલ મૂરનો છે. અમે બન્નેએ સાથે મળીને તેને જોઈ ગયા છીએ, અને ઐતિહાસિક નિર્દેશોના ખુલાસાની થોડીક નોંધો મેં ઉમેરી છે.

લાંડન, ૩૦મી જાન્યુઆરી, ૧૯૯૮

ફ્રેડરિક એંગેલ્સ

Karl Marx and Frederick Engels,
«Manifesto of the Communist party»
નામે પુસ્તકમાં પ્રકાશિત, લાંડન, ૧૯૯૮

ઉપરોક્ત શબ્દો લખવામાં આવેલા* ત્યાર પછી ‘જહેરનામા’ની નવી જર્મન આવૃત્તિ ફરી આવશ્યક બની છે, અને ‘જહેરનામા’ની બાબતમાં પાણ ઘણું બન્યું છે કેની નોંધ અહીંથાં લેવી ઘટે.

વેરા ઝસ્ટુલિયે કરેલો બીજો રશિયન અનુવાદ ૧૮૮૨માં જિનિવામાં પ્રકાશિત થયો હતો. એ આવૃત્તિની પ્રસ્તાવના માફર્સે અને મેં લખી હતી. દુલ્ભાંગે મૂળ જર્મન હસ્તપ્રત ગેરવલ્લે પડી ગઈ છે, એટલે મારે પાછું રશિયનમાંથી ભાષાંતર કરવું પડે છે, અને એથી વાચના કોઈ રીતે બહેતર તો નહિ જ બને **. તે આ મુજબ છે:

“‘કોમ્પ્યુનિસ્ટ પાર્ટીના જહેરનામા’ની પ્રથમ રશિયન આવૃત્તા સાતમા દાયકાના આરંભમાં ‘કોલોકોલ’ના મુદ્રણ કાર્યાલયે પ્રકાશિત કરી હતી. તેનો અનુવાદ બાકૂનિને કર્યો હતો. એ વખતે પશ્ચિમને તેમાં (‘જહેરનામા’ની રશિયન આવૃત્તિમાં) કેવળ સાહિત્યિક અજાયબી જ નજરે પડી હતી. આજે એવો ખયાલ અશક્ય છે. ‘જહેરનામા’નો છેલ્લો વિભાગ—જુદા જુદા દેશોમાં વિવિધ વિરોધી પાર્ટીઓના સંબંધમાં કોમ્પ્યુનિસ્ટોના ધોરણ અંગેનો વિભાગ—તદ્દન સ્પષ્ટ બતાવે છે કે એ વખતે (૧૮૪૭ના ડિસોબરમાં) સર્વહારા આંદોલનનું ક્ષેત્ર કેટલું સીમિત હતું. તેમાં રશિયા અને અમેરિકાનો ઉત્ખેખ જ નથી. એ

* અહીંથાં એંગેલ્સનો નિર્દેશ ૧૮૮૭ની જર્મન આવૃત્તિની પ્રસ્તાવના પ્રત્યે છે. — સં.

** ‘જહેરનામા’ની રશિયન આવૃત્તિની માફર્સે અને એંગેલ્સની પ્રસ્તાવનાની ગેરવલ્લે પડી ગયેલી મૂળ જર્મન હસ્તપ્રત મળી ગઈ છે અને મોસ્કોના માફર્સેવાદ-લેનિનવાદ મહાવિદ્યાલયના પુરાલેખ સંગ્રહમાં રાખવામાં આવી છે. એ મૂળ જર્મન વાચનાના અંગેજ ભાષાંતરમાંથી આ ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે. — સં.

જમાનો એવો હતો કે જ્યારે રશિયા સમગ્ર યુરોપીય પ્રત્યાધાતની આખરી પ્રચંડ તાકાત બની રહ્યું હતું, અને અમેરિકા યુરોપના વધારાના સર્વહારા પરિબળોને અમેરિકામાં વસવાટની છૂટ આપીને પોતાની અંદર સમાવી રહ્યું હતું. બન્ને દેશો યુરોપને કાચો માલ અને સાથે સાથે તેની ઔદ્યોગિક પેદાશો માટે બજારો પૂરાં પાડતા હતા. એટલે એ વખતે એક યા બીજી રીતે બન્ને દેશો પ્રવર્તમાન યુરોપીય વ્યવસ્થાના આધારસ્તંભ હતા.

“આજે કેટલો બધો ફેર પડી ગયો છે! યુરોપથી આવીને વસેલા માણસોને કારણે જ ઉત્તાર અમેરિકા એવા પ્રચંડ પાયા પર જેતીવાડીનું ઉત્પાદન કરવા સુસજજ બન્યું કે તેની હરીકાઈ યુરોપમાં મોટી અને નાની જમીન-મિલકતના પાયા હચમચાવી રહી છે. વળી એ જ કારણે અમેરિકા પોતાની ઔદ્યોગિક સાધનસંપત્તિનો ઉપયોગ એટલી સ્કુર્નિથી તથા એવડા પાયા પર કરી શક્યું કે પશ્ચિમ યુરોપની અને ખાસ કરીને તો હાલ સુધી કાયમ રહેલી ઈંગ્લેઝની ઔદ્યોગિક ઈજારદારી થોડા વખતમાં જ ખતમ થઈ જવાની. આ બન્ને સંઝેગો ખુદ અમેરિકામાં જ કાંતિકારી પ્રક્રિયા કરી રહ્યા છે. જેડૂતોની નાની અને મધ્યમ જમીનમાલિકી, આખી રાજકીય સંઘટનાની આધારશિલા, વિશાળ જેતરોની હરીકાઈનો ભોગ બની રહી છે; તેની સાથે સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં પહેલી જ વાર વ્યાપક સર્વહારા વર્ગનો તેમ જ મૂડીનાં કલ્પનાતીત કેંદ્રીકરણોનો વિકાસ થઈ રહ્યો છે.

“અને હવે રશિયા! ૧૮૪૮-૪૯ની કાંતિ દરમિયાન કેવળ યુરોપના રાજાઓને જ નહિ પરંતુ યુરોપના મૂડીદારને પણ, જગત થઈ રહેલા સર્વહારા વર્ગથી મુક્તિનો એકમાત્ર માર્ગ, રશિયન દખલગીરોના રૂપમાં મળ્યો. જારને યુરોપીય પ્રત્યાધાતનો મુખ્યી ધોષિત કરવામાં આવ્યો. આજે તે ગાત્રચિનામાં કાંતિનો યુદ્ધકેદી છે, અને યુરોપની કાંતિકારી પ્રવૃત્તિમાં રશિયાએ મોખરાનું સ્થાન લઈ લીધું છે.

“આધુનિક મૂડીવાદી મિલકતના અનિવાર્ય રૂપે અણુંબી રહેલા વિસર્જનની ધોષણા ‘કોમ્યુનિસ્ટ જહેરનામા’ની મુખ્ય નેમ હતી. પરંતુ રશિયામાં જરૂરથી વિકસો રહેલી મૂડીવાદી ઠગબાજી તથા વિકાસની દિશામાં કદમ માંડી રહેલી મૂડીવાદી જમીન-મિલકતની સાથે સાથે આપણને જેવા મળે છે કે જમીનના અરધાથી વધારે હિસ્સા ઉપર કિસાનોની સામુદ્દરિયક માલિકી છે.

“હવે સવાલ આવો છે—રશિયન ઓબ્ષ્યોના કે જે ખૂબ કમાઝેર બની ગયેલ છે પરંતુ તોએ જમીનની આદિમ સામુદ્દાયિક માલિકીનું રૂપ છે તે સીધું સામ્યવાદી સામુદ્દાયિક માલિકીના ઉચ્ચતર રૂપમાં પલટાઈ શકશે ખરું? કે પછી એથી ઉલ્લંઘન, પશ્ચિમમાં વિસર્જનની જે પ્રક્રિયા એતિહાસિક ઉત્કાંતિ બની છે એવી જ પ્રક્રિયા તેને પહેલાં પાર કરવી જ પડશે?

“તેનો આજે એકમાત્ર શક્ય જવાબ આવો છે—જે રશિયન કાંતિ પશ્ચિમમાં સર્વહારા કાંતિ માટે સંકેત બની જાય, જેથી બન્ને પરસ્પર પૂરક બની રહે, તો રશિયામાં વર્તમાન સમયે જમીનની સામુદ્દાયિક માલિકી છે તે સામ્યવાદી વિકાસના આરંભબિંદુની કામગીરી બજાવી શકે.

કાર્લ માર્ક્સ, ફ્રેડરિક અંગોલ્સ
લંડન, ૨૧મી જાન્યુઆરી, ૧૮૮૨”

લગભગ એ જ સમયે નવો પોલીશ અનુવાદ નિનિવામાં પ્રકાશિત થયો— ‘કોમ્યુનિસ્ટ જહેરનામું’ (*Manifest Komunistyczny*).

વધુમાં, નવો ડેનિશ અનુવાદ ૧૮૮૫માં કોપનહેનમાં *Socialdemokratisk Bibliothek* માં પ્રકાશિત થયો છે. દુર્ભાગ્યે એ અનુવાદ સંપૂર્ણ નથી. અમુક આવશ્યક ફક્રા છોડી દેવામાં આવ્યા છે. લાગે છે કે અનુવાદકને તેના અનુવાદમાં મુશ્કેલી પડી હોય. વળી ક્યાંક ક્યાંક બેપરવાઈની નિશાનીઓ વરતાય છે જે વિશેષ રૂપે અણગમો ઉપજાવતી આગળ તરી આવે છે, કારણ કે અનુવાદ ઉપરથી લાગે છે કે અનુવાદકે જરાક વધારે મહેનત કરી હોત તો સરસ કામ થઈ શક્યું હોત.

નવો ફ્રેંચ અનુવાદ ૧૮૮૫માં પોરિસમાં *Le Socialiste*માં પ્રકાશિત થયો. અત્યાર સુધીમાં તે ઉત્તમ છે.

એ ફ્રેંચ અનુવાદના આધારે તૈયાર કરવામાં આવેલો સ્પેનિશ અનુવાદ એ જ વરસ દરમિયાન પહેલાં મેદ્ઝિનના *El Socialista*માં પ્રકાશિત થયો અને પછી પુસ્તિકાના રૂપમાં પ્રગટ કરવામાં આવ્યો—*«Manifesto del Partido Comunista» por Carlos Marx y F. Engels, Madrid, Administración de «El Socialista», Hernán Cortés 8.*

એક નવાઈ જેવી વાતનો ઉલ્લેખ પણ કરી દઉં કે ૧૮૮૭માં આરોનિયન અનુવાદની હસ્તપ્રત કોન્સ્ટંટ્ટીનોપલના એક પ્રકાશકને આપવામાં આવી હતી.

પરંતુ એ ભલો આદમી માર્કર્સનું નામ ધરાવતું કંઈ પ્રકાશિત કરવાની હિંમત ન દાખવી શક્યો. તેણે સૂચન કર્યું કે અનુવાદક પોતાનું જ નામ બેખ્ક તરીકે આપે, પણ અનુવાદકે ઈનકાર કર્યો.

એક પછી એક વધારે કે ઓછાં ગલત અમેરિકી અનુવાદો ઈંગ્લેઝમાં ફરી ફરીને પુનર્મુદ્રિત થયા બાદ, આખરે ૧૮૮૮માં અધિકૃત અનુવાદ પ્રકાશિત થયો. એ અનુવાદ મારા મિત્ર સેમ્યુઅલ મૂરે કર્યો હતો. તેને પ્રેસમાં મોકલતાં પહેલાં અમે બન્નેએ સાથે મળીને ફરી વાર જેઈ લીધો હતો. તેનું નામ આ મુજબ હતું: ‘કોમ્યુનિસ્ટ પાર્ટીનું જહેરનામું’, બેખડો કાર્લ માર્કસ અને ફ્રેડરિક એંગેલ્સ. અધિકૃત અંગ્રેજ અનુવાદ, સંપાદન અને ટિપ્પણીઓ—ફ્રેડરિક એંગેલ્સ, ૧૮૮૮. લંડન, વિલિયમ રીજી, ૧૮૫ ફ્લીટ સ્ટ્રીટ, ઈ. સી. એ આવૃત્તિની કેટલીક નોંધો મેં આ આવૃત્તિમાં સામેલ કરી છે.

‘જહેરનામા’ને પોતાનો આગવો ઈતિહાસ રખ્યો છે. તેનું પ્રકાશન થયું ત્યારે વૈજ્ઞાનિક સમાજવાદના એ વખતે હજુ સંખ્યાબંધ ક્રોઈ રીતે ન ગણાય એવા અગ્રાહીઓએ તેને ઉત્સાહથી આવકાર્ય (આ હકીકત પ્રથમ પ્રસ્તાવનામાં ઉલ્લેખિત અનુવાદોથી સાબિત થાય છે). પરંતુ ૧૮૪૮ના જૂનમાં¹⁸ પેરિસના કામદારોના પરાજયથી શરૂ થયેલા પ્રત્યાધાતે તેને થોડા વખતમાં જ પૃષ્ઠભૂમિમાં ધકેલી દીધું, અને છેલ્વે ૧૮૫૨ના નવોબરમાં¹⁹ કલોનના કોમ્યુનિસ્ટોને થયેલી સજાથી તે “કાયદેસર” બહિષ્કૃત થઈ ગયું. ફેબ્રુઆરી કાંતિથી શરૂ થયેલું કામદારોનું આંદોલન જહેર જીવનમાંથી અદૃશ્ય થઈ ગયું એટલે ‘જહેરનામા’ પણ પૃષ્ઠભૂમિમાં ચાલ્યું ગયું.

યુરોપના કામદાર વર્ગ શાસક વર્ગોની સત્તા ઉપર નવો હલ્લો કરવા માટે પૂરતી તાકાત પાછી એકઠી કરી લીધી ત્યારે ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’ અસ્તિત્વમાં આવ્યું. તેનું લક્ષ્ય યુરોપ અને અમેરિકાના સમગ્ર જેશીલા કામદાર વર્ગને એક જ વિશાળ સેનાના રૂપમાં સાંકળી લેવાનું હતું. એટલે તે ‘જહેરનામા’માં નિર્દ્દિપિત સિદ્ધાંતોથી શરૂઆત ન કરી શક્યું. તેને એવો કાર્યક્રમ અપનાવવો પડે એમ હતો કે જે અંગ્રેજ ટ્રેડ યુનિયનો અને ફ્રેન્ચ, બેલિયન, ઈટાલિયન, તથા સ્પેનિશ પુધોપંથીઓ તેમ જ જર્મન લાસાલપંથીઓ *

* અમારી સમક્ષ લાસાલ વ્યક્તિગત રીતે પોતાને હંમેશાં માર્કર્સનો “શિષ્ય” ગણાવતો હતો અને તે મુજબ ‘જહેરનામા’નું ધોરણ માનતો હતો. પરંતુ તેના

માટે દરવાજ બંધ ન કરી દે. એ કાર્યક્રમ — ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’ના નિયમોનો¹⁸ પ્રાસ્તાવિક ભાગ — માઝ્સે ઉસ્તાદીથી ઘડી કાઢ્યો અને બાકુનિન તથા અરાજકતાવાદીઓને પણ એ વાત માનવી પડી. ‘જહેરનામા’માં રજૂ કરવામાં આવેલા વિચારોના અંતિમ વિજય માટે માઝ્સે, સંયુક્ત પ્રવૃત્તિ તથા ચર્ચાઓમાંથી કામદાર વર્ગના આવશ્યક રૂપે પરિણમનારા બૌદ્ધિક વિકાસ ઉપર જ — કેવળ અને એકમાત્ર તેની ઉપર જ — આધાર રાખ્યો હતો. મૂડી સામેના સંઘર્ષમાં ઘટનાઓ અને ચડતીપડતી, સફળતાઓ કરતાં વધારે તો પરાજ્યો, લડવૈયાઓની સમક્ષ તેમના સર્વ સ્થળકાળને આવરી બેતા અચૂક ઈલાજેની આજ લગીની ઊણપ છતી કરી દીધા વગર રહેશે જ નહિ, અને તેમના માનસોને કામદારોની મુક્તિ માટેના ખરા સંઝેગોની સર્વાંગી સમજાશું અંગે વધુ ગ્રહણશીલ બનાવ્યા વગર રહેશે જ નહિ. અને માર્ક્સની ધારણા ખરી હતી. ૧૮૭૪માં ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’ના વિસર્જનના સમયે કામદાર વર્ગ, ૧૮૬૪માં મંડળની સ્થાપનાના સમયના કામદાર વર્ગથી તદ્દન નિરાળો હતો. લેટિન દેશોમાં* પ્રુધોપંથ તથા જર્મનીમાં વિશિષ્ટ લાસાલપંથ ખતમ થઈ રહ્યા હતા, અને એ વખતનાં કટૂર રઢિયુસ્ત અંગ્રેજ ટ્રેડ યુનિયનો પણ ધીરે ધીરે એવે તબક્કે પહોંચ્યો રહ્યા હતાં કે ૧૮૭૭માં તેઓની સ્વાજન્સી કોંગ્રેસનો અધ્યક્ષ તેઓના વતી આ શબ્દો કહી શક્યો : “તળ યુરોપખંડના સમાજવાદથી હવે અમે ત્રાસ નથી પામતા.” તેમ છતાં ૧૮૮૭ સુધીમાં તળ યુરોપખંડનો સમાજવાદ લગભગ પૂર્ણ રૂપમાં, ‘જહેરનામા’ની અંદર ઘોષિત કરવામાં આવેલો સિદ્ધાંત હતો. એ રીતે, ‘જહેરનામા’ના ઈતિહાસમાં ૧૮૪૮ પછીના આધુનિક કામદાર વર્ગીય આંદોલનનો ઈતિહાસ અમુક અંશે પ્રતિબિંબિત થાય છે. વર્તમાન સમયે સમગ્ર સમાજવાદી સાહિત્યમાં તે નિઃશંક અધિકતમ વ્યાપક પ્રસાર તથા અધિકતમ આંતરરાષ્ટ્રીય પ્રકાશન પામેલી કૃતિ છે, સાઈબરિયાથી કેલિફ્રોર્નિયા સુધીના તમામ દેશોના લાખો કામદારોનો સર્વસામાન્ય કાર્યક્રમ છે.

અમુક અનુયાયીઓના સંબંધમાં બાબત તદ્દન જુદી હતી. રાજ્યનાં ધિરાણોનો ટેકો ધરાવતાં ઉત્પાદક સહકારી મંડળોની તેની માંગથી એ અનુયાયીઓ આગળ ન ગયા, અને આખા કામદાર વર્ગને તેમજે રાજ્યની મદદના સમર્થકી તથા આપમદદના સમર્થકીમાં વિભાજિત કરી નાખ્યો. (અંગેલ્સની નોંધ.)

* દક્ષિણ યુરોપના દેશોમાં.—સં.

તેમ છતાં તેનું પ્રકારણ થયું ત્યારે અમે તેને સમાજવાદી જહેરનામું કહી શકીએ એમ નહોતા. ૧૮૪૭માં બે પ્રકારના માણસોને સમાજવાદીઓ ગણવામાં આવતા હતા. એક તરફ વિવિધ તરંગો વિચારધારાઓના અનુયાયીઓ હતા, તેમાં ઈંગ્લેઝના ઓવેનપંથીઓ તથા ફ્રાંસના ફૂરિયેપંથીઓ નોંધપાત્ર હતા, એ બન્ને ક્યારના ખાલી સંપ્રદાયો જેવી હાબતમાં આવી ગયેલા હતા અને ધીરે ધીરે ખતમ થઈ રહ્યા હતા. બીજી તરફ પચરંગી સામાજિક ઉંટવૈદો હતા, તેઓ મૂડી તથા નફને મુદ્દલ હાનિ પહોંચાડ્યા વગર પોતાના સર્વ સ્થળકાળને આવરી લેતા તરેહવાર અચૂક ઈલાજે અજમાવીને તથા ભાતભાતનું થાગડથીગડ કરીને સામાજિક ગેરવ્યતિનને ખતમ કરી નાખવાના ઈરાદા સેવતા હતા. બન્ને પ્રકારના માણસો કામદાર આંદોલનની બહાર હતા અને “સુશિક્ષિત” વર્ગનું સમર્થન મેળવવાની વધારે આશા રાખતા હતા. પરંતુ કામદાર વર્ગનો જે હિસ્સો પ્રતીતિ પામી ચૂક્યો હતો કે ખાલી રાજકીય કાંતિ અપૂરતી છે, અને સમાજની મૂળગામી પુનર્ધટનાની માંગ ઉઠાવતો હતો, તે પોતાને એ વખતે સામ્યવાદી કહેવડાવતો હતો. એ સામ્યવાદ બેંદ્રો, માત્ર સહજબુદ્ધિથી પ્રેરિત, અને ઘણું વાર થોડોઘણું અણાધડ સામ્યવાદ હતો. તેમ છતાં તે તરંગી સામ્યવાદની બે વિચારધારાઓને — ફ્રાંસમાં કાબેનો “ઇકારિયન” સામ્યવાદ અને જર્મનીમાં વાઈટલિંગનો¹⁹ સામ્યવાદ — અસ્થિત્વમાં આણવા પૂરતો તાકાતવાન તો હતો જ. ૧૮૪૭માં સમાજવાદનું આંદોલન મૂડીવાદી અને સામ્યવાદનું આંદોલન કામદાર વર્ગીય હતું. ઓછામાં ઓછું તળ પુરોપંડિતું તો સમાજવાદ સારી પેઠે પ્રતિષ્ઠિત હતો, પણ સામ્યવાદ એથી તદ્દન ઊલટો હતો. અને અમે છેક એ સમય જેટલા વહેલા તદ્દન નિશ્ચિત રૂપે અભિપ્રાય ધરાવતા હતા કે “કામદાર વર્ગની મુક્તિ ખુદ કામદાર વર્ગનું જ કૃત્ય હોવું જોઈએ”, એટલે અમારે બેમાંથી કૃત્યું નામ અપનાવવું એ બાબતમાં મુદ્દલ અચકાલું પડ્યું નહોતું. વળી તેને તજ દેવાનો ખયાલ અમારાં મનમાં ત્યાર પછી કદી આવ્યો નથી.

“દુનિયાના કામદારો, એક થાઓ!” પરંતુ બેતાળીસ વરસ પહેલાં, સર્વહારા વર્ગ પોતાની આગવી માંગો ઉઠાવતો જ્યારે આગળ આવ્યો હતો એ પ્રથમ પેરિસ કાંતિની પૂર્વવિળાએ, અમે આ શબ્દો જગતને ઉદ્દીને ધોષિત કર્યા ત્યારે બહુ ઓછા અવાજેએ તેનો પડધો પાડ્યો હતો. પરંતુ ૧૮૬૪ના સર્વાભરની ૨૮મી તારીખે મોટા ભાગના પશ્ચિમ પુરોપીય દેશોના સર્વહારાઓએ, ગૌરવમય યાદ મૂડી ગયેલા ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’માં એકસંપી સાધી. એ ખરું કે ખુદ ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’ માત્ર નવ જ વરસ હયાત રહ્યું. પરંતુ

સધણા દેશોના સર્વહારાઓની તેણે સંજેલી સનાતન એકસંપી હજુ કાયમ છે તથા અગાઉ કદ્દી હતી તેનાથી વધારે તાકાતવાન રૂપમાં કાયમ છે, તેનો આજના દિવસ કરતાં બહેતર સાક્ષી બીજે કોઈ નથી. કારણ કે આજે, હું આ શબ્દો લખી રહ્યો છું ત્યારે, પહેલી જ વાર એકત્રિત થયેલો, એક સેના તરીકે, એક જંડા હેઠળ, એક તાત્કાલિક લક્ષ્ય ખાતર એકત્રિત થયેલો યુરોપીય તથા અમેરિકી સર્વહારા વર્ગ પોતાનાં લડાયક દળોનું નિરીક્ષણ કરી રહ્યો છે. એ લક્ષ્ય આવું છે — ૧૮૬૭માં ‘આંતરરાષ્ટ્રીય કામદાર મંડળ’ની જનિવા કોંગ્રેસમાં અને ફરી વાર ૧૮૮૮માં પેરિસની કામદાર કોંગ્રેસમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ, કાનૂન ઘડીને આઠ કલાકના કામદિનનું ધોરણ સ્થાપવામાં આવે. અને આજનું નિર્દર્શન તમામ દેશોના મૂડીદારો તથા જમીનદારોની આંખો ઝોલીને તેમને એ હકીકતનું ભાન કરાવશે કે આજે તમામ દેશોના કામદારો ખરેખર એકતાબદ્ધ છે.

આ પોતાની નજરે જોવા માર્ક્સ હજુ મારી પડ્યે હોત તો કેવું સારું થાત !

એક. અંગોલ્સ

લાંડન, ૧૯૮૩ મે, ૧૮૮૦

«Das Kommunistische Manifest»

નામે પુસ્તકમાં પ્રકાશિત, લાંડન,
૧૮૮૦

૧૮૯૨ની પોલીશ આવૃત્તિની પ્રસ્તાવના*

‘સામ્યવાદી જહેરનામા’ની નવી પોલીશ આવૃત્તિ જરૂરી બની છે એ હકીકત મનમાં વિવિધ વિચારો જગાવે છે.

સૌપ્રથમ તો એ વાત નોંધપાત્ર છે કે તાજેતરના સમયમાં ‘જહેરનામું’ જાણે પુરોપદ્ધારમાં વિશાળ પાયાના ઉદ્યોગના વિકાસનું સૂચક બની ગયું છે. અમુક દેશમાં વિશાળ પાયાના ઉદ્યોગનું જેટલું વિસ્તરણ થાય એટલા પ્રમાણમાં એ દેશના કામદારોની અંદર, મિલકતદાર વર્ગોના સંબંધમાં કામદાર વર્ગ તરીકે તેમની સ્થિતિ અંગે વાકેફ્ગારીની માંગ વૃદ્ધિ પામે છે, તેમની અંદર સામાજિક આંદોલન ફેલાવો પામે છે, અને ‘જહેરનામા’ની માંગમાં વધારો થાય છે. એ રીતે, દરેક દેશમાં કામદાર આંદોલનની હાલતનો જ નહિ પરંતુ વિશાળ પાયાના ઉદ્યોગના વિકાસની માત્રાનો પણ ઠીક ઠીક ચોક્કસ અંદાજ, એ દેશમાં પ્રસારિત ‘જહેરનામા’ની નકલોની સંખ્યા પરથી કાઢી શકાય.

તે મુજબ, પોલીશ આવૃત્તિ પોલીશ ઉદ્યોગની નિશ્ચિત પ્રગતિનો નિર્દેશ કરે છે. અને એ બાબતમાં મુદ્દલ શંકાને સ્થાન નથી કે દસ વરસ પહેલાં છેલ્લી આવૃત્તિ પ્રકાશિત થઈ તાર પછી એ પ્રગતિ હકીકતમાં થઈ છે. રશિયન પોલેંડ, કોંગ્રેસ પોલેંડ^{૩૦}, રશિયન સામ્ભાજ્યનું મોટું ઓદ્યોગિક ક્ષેત્ર બની ગયું છે. રશિયાનો વિશાળ પાયાનો ઉદ્યોગ છૂટોછવાયો વિખરાયેલો છે—એક ભાગ ફિનલ્યંડના અખાત ફરતો છે, બીજો ભાગ મધ્યમાં (મોસ્કો તથા લ્વાદીમિર) છે, ત્રીજો ભાગ કાળા તથા આઝોવ સમુદ્રોને કિનારે છે, વળી એ ઉપરાંત બીજો ભાગો અન્ય સ્થળોએ આવેલા છે—પણ પોલીશ ઉદ્યોગની જમાવદ પ્રમાણમાં નાના વિસ્તારમાં થઈ છે, અને એવા કેંદ્રીકરણના ફાયદા તથા ગેરફાયદા બન્ને તે ભોગવે છે. હરીફ રશિયન કારખાનદારો પોલેંડવાસીઓને રશિયનો બનાવી દેવાની સખત મુરાદ ધરાવતા હોવા છતાં પોલેંડની સામે જકાતી રક્ષણુંની

* પોલીશ આવૃત્તિની પ્રસ્તાવનાનો આ ગુજરાતી અનુવાદ મૂળ જર્મન વાચનાના અંગ્રેજ અનુવાદમાંથી કરવામાં આવ્યો છે.—સં.

માગણી કરીને તેમણે ફાયદાઓની હકીકત કબૂલ કરી લીધી છે. પોલીશ કારખાનદારો તથા રશિયન સરકારને ભોગવવા પડતા ગેરફાયદા પોલીશ કામદારોની અંદર સમાજવાદી વિચારોના ઝડપી ફેલાવામાં તેમ જ જીવનામા'ની વધતી જતી માંગમાં વ્યક્ત થાય છે.

પરંતુ પોલીશ ઉદ્યોગનો રશિયાના ઉદ્યોગને પાછળ રાખી દેતો ઝડપી વિકાસ પોલીશ પ્રજાના અખૂટ જેમની નવી સાભિતી તથા તેના આગામી રાષ્ટ્રીય પુનરુત્થાનની નવી ગેરટી પૂરી પાડે છે. અને સ્વતંત્ર તાકાતવાન રાષ્ટ્રના રૂપમાં પોલેંડના પુનરુત્થાનની બાબત જોડે એકલા પોલેંડવાસીઓને જ નહિ પરંતુ આપણને સૌને પણ સંબંધ છે. યુરોપનું પ્રત્યેક રાષ્ટ્ર પોતાના ધરમાં સંપૂર્ણ રૂપે સ્વાયત્ત હોય તો જ યુરોપીય રાષ્ટ્રો વચ્ચે ખરો આંતરરાષ્ટ્રીય સહયોગ શક્ય છે. સર્વહારા વર્ગના ઝડપ હેઠળ સર્વહારા લડવૈયાઓના હાથે આખરે તો કેવળ મૂડીવાદી વર્ગનું જ કામ કરાવનારી ૧૮૪૮ની કાંતિએ, તેના વસિયત વહીવટીઓ લુદ્દ બોનાપાર્ટ અને બિસ્માર્ક^{૨૧} મારફત, ઈટાલી, જર્મની, તથા હંગેરીની સ્વાધીનતા પણ હાંસલ કરી; પરંતુ ૧૭૮૨ પછી કાંતિ ખાતર એ ત્રણેંબે ભેગાં મળીને કર્યું હતું તેનાથી વધારે કરનારું પોલેંડ ૧૮૬૩માં દસ ગણા મોટા રશિયન દળ^{૨૨} સામે છળી પડ્યું ત્યારે તેને તેના સાધનસરંજામના આધારે જ પોતાનું ફોડી લેવા એકલું છોડી દેવામાં આવ્યું. ઉમરાવ વર્ગ પોલેંડની સ્વાધીનતા જળવી પણ ન શક્યો અને તેને પાછી હાંસલ પણ ન કરી શક્યો. આને મૂડીદાર વર્ગની બાબતમાં ઓછામાં ઓછું કહીએ તો તેને એ સ્વાધીનતા મહત્વની નથી લાગતી. પરંતુ તેમ છતાં યુરોપીય રાષ્ટ્રોના સંવાદી સહયોગ માટે તે જરૂરી છે. માત્ર તરુણ પોલીશ સર્વહારા વર્ગ તેને હાંસલ કરી શકે એમ છે, અને એ વર્ગના હાથમાં તે સલામત છે. કારણ કે પોલેંડની સ્વાધીનતાની જરૂર ખુદ પોલીશ કામદારો જેટલી જ બાકીના સમગ્ર યુરોપને છે.

લાંડન, ૧૦મી ફેબ્રુઆરી, ૧૮૮૨

ઓફ. ઓફોલ્સ

«*Przedswit*» નામે સામયિકમાં,
અંક ૩૫, ૨૭મી ફેબ્રુઆરી, ૧૮૮૨
અને K. Marx i F. Engels,
«*Manifest Komunistyczny*» નામે
પુસ્તકમાં પ્રકાશિત, લાંડન, ૧૮૮૨

ઈટાલિયન વાચકને

એમ કહી શકાય કે 'કોમ્પુનિસ્ટ પાર્ટીના જહેરનામા'ના પ્રકાશનનો સુસંપોગ ૧૮૪૮ની ૧૮મી માર્ચ જેડે, મિલાન અને બર્લિનની કાંતિઓના દિવસ જેડે, થયો હતો. એ કાંતિઓ એટલે કેદ્ભાં — એક યુરોપખંડના અને બીજું ભૂમધ્યના — સ્થિત બે રાષ્ટ્રોના ઉધિયારબંધ વિખ્લવો. બન્ને રાષ્ટ્રો વિભાજન અને આંતરિક વિખ્લવાદને કારણે કમનેર બની ગયેલાં હતાં, અને એ રીતે પરદેશી વર્ચસ્વના ભોગ બની ગયાં હતાં. ઈટાલી ઓસ્ટ્રીયાના શહેનશાહનું તાબેદાર હતું, અને જર્મની સમગ્ર રશિયાના આરની આડકનતી પણ એ કારણે જરાય ઓછી અસરકારક નહિ એવી ધૂસરીમાં જકડાઈ ગયું હતું. ૧૮૪૮ની ૧૮મી માર્ચના પરિણામ રૂપે ઈટાલી તથા જર્મની બેઉ એવી નામોશીથી મુક્ત થઈ ગયાં. ૧૮૪૮થી ૧૮૭૧ દરમિયાન એ બે મહાન રાષ્ટ્રોની પુનર્ઘટના થઈ અને તેઓ ગમે તેમ કરીને ફરી પગભર થયાં કારણ કે, માર્ક્સ કહેતા તેમ, ૧૮૪૮ની કાંતિને દબાવી દેનારા માણસો ઈચ્છા ન હોવા છતાંયે તેના વસિયત વહીવટીઓ હતા.

એ કાંત દરેક ઠેકાણે કામદાર વર્ગની કામગીરી હતી, કામદારોએ જ નાકાંધીઓ ખડી કરી હતી અને પોતાના લોહી વડે મૂલ્યો ચૂકવ્યાં હતાં. સરકારને ઉથલાવી પાડવાના કદમની વેળાએ માત્ર એરિસના કામદારો જ મૂડીવાદી શાસનને ઉથલાવી પાડવાનો તદ્દન પાકો ઈરાદો ધરાવતા હતા. પરંતુ તેઓ મૂડીવાદી વર્ગ અને ખુદ પોતાના વર્ગ વચ્ચે હયાત ધાતક અંટસ અંગે સલાન હોવા છતાં, દેશની આર્થિક પ્રગતિ કે ફ્રેચ કામદારોના સમુદાયોનો

બૂલ્ધિક વિકાસ, સામાજિક પુનર્નિર્માણ શક્ય બનાવે એવે તથકે હજુ નહોતાં પહોંચ્યાં. એટલે આખરો પૃથક્કરાણમાં કાંતિનાં સુફળો મૂડીવાદી વર્ગ હજમ કરી ગયો. બીજા દેશોમાં — ઈટાલીમાં, જર્મનીમાં, ઓસ્ટ્રીયામાં — કામદારોએ શરૂઆતથી જ મૂડીદાર વર્ગને સત્તાસ્થાને પહોંચાડી દેવા સિવાય બીજું કશું જ ન કર્યું. પરંતુ કોઈ પણ દેશમાં મૂડીદાર વર્ગનું શાસન રાષ્ટ્રીય સ્વાધીનતા વગર અશક્ય છે. એટલે, ૧૮૪૮ની કાંતિ પોતાની પાછળ પાછળ, એ વખત સુધી એકતા અને સ્વાયત્તાથી વંચિત રાષ્ટ્રો માટે એકતા અને સ્વાયત્તા લાવવાની જ હતી — ઈટાલી, જર્મની, હંગેરી. પોલોંડનો વારો પણ આવશે.

એ રીતે, ૧૮૪૮ની કાંતિ સમાજવાદી કાંતિ નહોતી, પણ તેણે સમાજવાદી કાંતિનો માર્ગ મોકળો કર્યો, તેની ભૂમિકા તૈયાર કરી. તમામ દેશોમાં વિશાળ પાયાના ઉદ્યોગને આપવામાં આવેલા પ્રવેગ મારફત, છેલ્લાં પિસ્તાળીસ વરસો દરમિયાન દરેક ઠેકાણે મૂડીવાદી શાસને મોટી સંઘાના, કેદ્દીફૂત, અને તાકાતવાન સર્વહારા વર્ગનું સર્જન કર્યું છે. એ રીતે તેણે, ‘જાહેરનામા’ના શબ્દોમાં, ખુદ પોતાની જ કબર ખોદનારાઓને પેદા કર્યા છે. પ્રત્યેક રાષ્ટ્રની સ્વાયત્તાતા અને એકતાની પુનર્સ્થાપના કર્યા વગર, સર્વહારા વર્ગની આંતરરાષ્ટ્રીય એકસંપી અથવા સમાન ધ્યેયોની દિશામાં એ રાષ્ટ્રોનો શાંતિમય તથા બુલ્ધિપૂર્વકનો સહયોગ સાધવાનું અશક્ય બની જશે. ૧૮૪૮ પહેલાંની રાજકીય પરિસ્થિતિમાં ઈટાલિયન, હંગેરિયન, જર્મન, પોલીશ, અને રષીયન કામદારોના સંયુક્ત આંતરરાષ્ટ્રીય કદમની કલ્પના તો કરો!

એ રીતે, ૧૮૪૮માં લડવામાં આવેલી લડાઈઓ વ્યર્થ નહોતી લડવામાં આવી. કે પછી એ કાંતિકારી યુગથી આપણને અળગા પાડનાં પિસ્તાળીસ વરસો પણ કંઈ નિરસ્થક નથી વીતી ગયાં. ફુળો પાકી રહ્યાં છે, અને મારી તો એટલી જ મંદ્રા છે કે મૂળ ‘જાહેરનામા’ના પ્રકાશને આંતરરાષ્ટ્રીય કાંતિની બાબતમાં જેમ કર્યું હતું એવી જ રીતે આ ઈટાલિયન અનુવાદનું પ્રકાશન પણ ઈટાલિયન સર્વહારા વર્ગના વિજયની આગાહી અંકિત કરે.

ભૂતકાળમાં મૂડીવાદે ભજવેલી કાંતિકારી ભૂમિકાને ‘જાહેરનામું’ પૂરો ઈન્સાફ કરે છે. પ્રથમ મૂડીવાદી રાષ્ટ્ર ઈટાલી હતું. સામંતી મધ્યયુગના અંતને તથા આધુનિક મૂડીવાદી યુગના આરંભને એક પ્રચાંડ માનવપ્રતિભાયે અંકિત કર્યા હતા — એક ઈટાલિયને, દાન્તેએ, મધ્યયુગના અંતિમ તેમ જ આધુનિક યુગના

પ્રથમ કવિઓ અંકિત કર્યા હતા. ૧૩૦૦ની સાલની જેમ જ આજે નવો ઐતિહાસિક યુગ સમીપ આવી રહ્યો છે. આ નૂતન સર્વહારા યુગના ઉદ્યની ઘડી અંકિત કરનારો નવો દાન્તે ઈટાલી આપણને આપશે?

લાંદન, ૧૮૫૧ ફેબ્રુઆરી, ૧૮૮૩

ફ્રેડરિક એંગેલ્સ

Karlo Marx e Federico Engels,

«*Il Manifesto del Partito*

Comunista» નામે પુસ્તકમાં

પ્રકાશિત, મિલાન, ૧૮૮૩

Manifest der Kommunistischen Partei.

Veröffentlicht im Februar 1848.

Proletarier aller Länder vereinigt euch.

London.

Gedruckt in der Office der „Bildungs-Gesellschaft für Arbeiter“
von D. C. Burghard.
46, LIVERPOOL STREET, BISHOPSGATE.

કોમ્યુનિસ્ટ
પાર્ટીનું
જહેરનામું

યુરોપમાં ભૂતાવળ નાચી રહી છે — સામ્યવાદની ભૂતાવળ . એ ભૂતાવળથી છુટકારો મેળવવા માટે પુરાણા યુરોપની તમામ તાકાતોએ એકસંપી સાધી છે — પોપ અને આર, મેટેરનિખ અને ગીજો²³, ફ્રેચ રેડિકલો * અને જર્મન પોલીસ જસૂસો .

એવી કોઈ વિરોધી પાટી છે ખરી કે જેને તેના સત્તાધારી વિરોધીઓએ સામ્યવાદી કહીને વગોવી ન હોય ? એવી કોઈ વિરોધી પાટી છે ખરી કે જેણે વધારે પ્રગતિશીલ વિરોધી પાટીઓને તેમ જ પ્રત્યાધાતી હરીઝોને સામ્યવાદી કહીને તેઓની ઉપર નાલેશીની વળતી વગોવળી ન વરસાવી હોય ?

આ હકીકતમાંથી બે બાબતો પરિણમે છે :

૧. તમામ યુરોપિયન તાકાતો સામ્યવાદને ખુદ એક તાકાત તરીકેની માન્યતા આપી ચૂકી છે .

૨. સામ્યવાદીઓ માટે પોતાના વિચારો, પોતાનાં લક્ષ્યો, પોતાનાં વલણો, આખી દુનિયા સમક્ષ ખુલ્લેઆમ જહેર કરવાનો અને સામ્યવાદની ભૂતાવળની વાર્તાનો મુકાબલો ખુદ પાટીના જહેરનામા વડે કરવાનો સમય હવે આવી ગયો છે .

એ ઉદ્દેશો વિવિધ પ્રજાઓના સામ્યવાદીઓ લંડનમાં બેગા મળ્યા અને તેમણે નીચે મુજબનું ‘જહેરનામું’ ધરી કાઢ્યું, જેને અગ્રોજી, ફ્રેચ, જર્મન, ઈટાલિયન, ફ્રેન્ચિશ, તથા ડેનિશ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે .

* આમૂલ પરિવર્તનવાદીઓ . — સં .

(બુજ્ઝવા અને પ્રોલિટેરિયનો) *

અત્યાર સુધી હ્યાત સમાજનો ઈતિહાસ ** વર્ગસંધર્પોનો ઈતિહાસ છે. મુક્ત નાગરિક અને ગુલામ, અમીર અને પૃથગજન, ઉમરાવ અને

* બુજ્ઝવાજી એટલે આધુનિક મૂડીદારોનો વર્ગ, સામાજિક ઉત્પાદનનાં સાધનોના માલિકો તથા મજૂરી આપીને મહેનત કરાવનારાઓનો વર્ગ. પ્રોલિટેરિયટ એટલે ઉત્પાદનનાં પોતાનાં સાધનો ન ધરાવતા, જિંદગી ટકાવી રાખવા માટે પોતાની શ્રમશક્તિ વેચવાની હાલતમાં આવી ગયેલા, આધુનિક રોજી-કામદારોનો વર્ગ. (૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં ઓગેલ્સની નોંધ.)

** એટલે કે સમગ્ર લેખિત ઈતિહાસ. લેખિત ઈતિહાસ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સમાજની, સામાજિક સંઘટનની, પ્રાર્ગેતિહાસિક માહિતી ૧૮૪૭માં લગભગ સાવ અજાણી હતી. ત્યાર પછી હાક્સથાઉસેને^{૨૪} રચિયામાં જમીનની સામુદ્દરાધિક માલિકીની શોધ કરી, અને માઉરે^{૨૫} તેને ઈતિહાસમાં શરૂ થયેલી તમામ ટ્યુટોનિક જાતિઓના સામાજિક પાયા તરીકે સાબિત કરી. પછી ધીરે ધીરે જાળવા મળ્યું કે હિંદુસ્તાનથી આપણે સુધી દરેક ઠેકાણ ગ્રામસમાજે સમાજના આદિમ રૂપના છે અથવા રહી ચૂક્યા છે. ગોગ (જેન્સ)નું ખરં રૂપલક્ષણ તથા ટોળી (ટ્રાઈબ) જેણે તેના સંબંધની મોર્જનની^{૨૬} પરમ શોધથી એ આદિમ સામ્યવાદી સમાજની આંતરિક સંઘટના તેના લાક્ષણિક રૂપમાં જહેર થઈ ગઈ. એ આદિમ સમાજે વિસર્જિત થઈ જતાં, સમાજનું અલગ અલગ વર્ગોમાં અને અંતે પરસ્પર દ્વ્યાપીલા વર્ગોમાં વિભાજન શરૂ થઈ જાય છે. વિસર્જનની એ પ્રક્રિયાની રૂપરેખા દોરવાનો પ્રયાસ મેં «Der Ursprung der Familie, des Privateigenthums und des Staats», 2. Aufl., Stuttgart, 1886. ('પરિવાર, ખાનગી મિલકત અને રાજ્યની ઉત્પત્તિ') બીજી આવૃત્તિ, સ્ટુટગાર્ટ, ૧૮૮૬ નામની મારી કૃતિમાં કર્યો છે. (૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં ઓગેલ્સની નોંધ.)

ખેતગુલામ, ગિલ્ડ-માસ્ટર * (મહાજનનો સભ્ય માલિક) અને કારીગર (જર્નિમેન), ટૂંકમાં પીડક અને પીડિત, નિરંતર એક્બીજાનો સામનો કરતા રહ્યા છે, ક્યારેક ધાની તો ક્યારેક ઉધાડી લડાઈ અવિરત લડતા રહ્યા છે, જેનું પરિણામ કાં તો સમગ્ર સમાજની કાંતિકારી પુનર્દાટનામાં અથવા હરીફ વર્ગોની સામાન્ય પાયમાલીમાં આવતું રહ્યું છે.

ઈતિહાસના પાછલા યુગોમાં આપણને લગભગ દરેક ઠેકાણે સમાજની અટપટી સંઘટના — વિવિધ સ્તરો, સામાજિક દરજાનું બહુવિધ વર્ગીકરણ — જેવા મળે છે. પ્રાચીન રોમમાં અમીરો, ઉમરાવો, પૃથગ્જનો, તથા ગુલામો હતા; મધ્યયુગમાં સામંતી ઉમરાવો, ખાંડિયા જગ્રીદારો, મહાજનના સભ્ય માલિકો, કારીગરો, તાલીમીઓ, તથા ખેતગુલામો હતા; વળી એ બધા વર્ગોમાં ઊતરતા દરજાઓ હતા.

સામંતી સમાજના ખંડેરોમાંથી કૂટી નીકળેલા આધુનિક મૂડીવાદી સમાજમાં વર્ગો વર્ચેના અંટસો ખતમ નથી થયા. તેમાં તો કેવળ નવા વર્ગો સ્થપાયા છે, પીડનના નવા સંઝેગો સર્જયા છે, સંઘર્ષનાં પુરાણાં રૂપોનાં સ્થાન નવાં રૂપોએ લઈ લીધાં છે.

પરંતુ આપણો યુગ, મૂડીદાર વર્ગનો યુગ, એક વિશિષ્ટ લક્ષણ ધરાવે છે — તેણે વર્ગો વર્ચેના અંટસોને સીધાસાદા બનાવી દીધા છે. આખો સમાજ બે પરસ્પર અદાવતી પ્રચંડ છાવણીઓમાં, એક્બીજાનો સીધો સામનો કરતા બે પ્રબળ વર્ગોમાં, વિભાજિત થઈ રહ્યો છે — મૂડીદાર વર્ગ અને સર્વહારા વર્ગ.

મધ્યયુગના ખેતમજૂરોમાંથી તદ્દન પ્રારંભિક નગરોના સનદી નગરવાસીઓનો ઉદ્ય થયો. એ સ્વતંત્ર નાગરિકોમાંથી મૂડીદાર વર્ગનાં પ્રથમ તરફો વિકાસ પામ્યાં.

અમેરિકાની શોધથી, કેપ ફ્રેતા સમુદ્રમાર્ગની શોધથી, વિકાસ પામતા મૂડીદાર વર્ગ માટે નવું કોન્ટ્ર ખુલ્લું થયું. હિંદુસ્તાન અને ચીનનાં બજારો, અમેરિકામાં વસાહત, સંસ્થાનો જોડે વ્યાપાર, અને વિનિમયનાં સાધનોમાં તેમ જ સામાન્ય રૂપે પણ્યોમાં વૃદ્ધિએ વાણિજ્યને, વહાણવટાને, ઉદ્યોગને, અભૂતપૂર્વ

* ગિલ્ડ-માસ્ટર એટલે ગિલ્ડનો મુખી નહિ પણ પાકો સભ્ય, ગિલ્ડની ભીતર સભ્યપદ ધરાવતો માલિક. (૧૮૮૮ની અંગેજ આવૃત્તિમાં એગેલ્સની નોંધ.)

પ્રવેગ આપ્યો, અને એ રીતે, પડી ભાંગતા સામંતી સમાજમાં કાંતિકારી તત્ત્વને ઝરપથી વિકસાવ્યું.

સંકુચિત ગિલ્ડો (મહાજનો)ની ઔદ્ઘોગિક ઉત્પાદનનો ઈજારો ધરાવતી ઉદ્યોગની સામંતી સંઘટના નવાં બજારોની વધતી જતી જરૂરિયાતો માટે હવે પૂરતી ન રહી. તેનું સ્થાન મેન્યુફેક્ચરની (કારખાનાની) પદ્ધતિએ લઈ લીધું. કારખાનાં શરૂ કરીને ઉત્પાદન કરતા મધ્યમ વર્ગ ગિલ્ડ-માસ્ટરોને બાજુએ ધકેલી દીધા, દરેક કારખાનાની અંદર જ શ્રમના વિભાજનના મુકાબલામાં જુદાં જુદાં ઘટક ગિલ્ડો વચ્ચેનું શ્રમનું વિભાજન અદૃષ્ટ થઈ ગયું.

દરમિયાનમાં બજારો નિરંતર વિસ્તરતાં ગયાં, માંગ નિરંતર વધતી ગઈ. મેન્યુફેક્ચરની પદ્ધતિ પણ પૂરતી ન રહી. ત્યારે વરાળ અને યંત્રોથી ઔદ્ઘોગિક ઉત્પાદનમાં કાંતિ થઈ ગઈ. મેન્યુફેક્ચરનું સ્થાન પ્રચંડ આધુનિક ઉદ્યોગે લઈ લીધું, ઔદ્ઘોગિક મધ્યમ વર્ગનું સ્થાન ઔદ્ઘોગિક કરોડપતિઓએ, આખાં ને આખાં ઔદ્ઘોગિક લશકરોના સરદારોએ, આધુનિક મૂડીદારે લઈ લીધું.

આધુનિક ઉદ્યોગે વિશ્વ બજારની સ્થાપના કરી. તેનો માર્ગ અમેરિકાની શોધથી મોકણો થયો હતો. એવા બજારથી વાણિજ્યનો, વહાણવટાનો, જ્ઞાનમાર્ગ વહેવારનો, પ્રચંડ વિકાસ થયો. એ વિકાસના વળતા પાચાસે ઉદ્યોગ વિસ્તાર પામ્યો, અને જેટલા પ્રમાણમાં ઉદ્યોગ, વાણિજ્ય, વહાણવટું, રેલવે, વિસ્તાર પામ્યાં એટલા પ્રમાણમાં મૂડીદાર વર્ગનો વિકાસ થયો, તેણે પોતાની મૂડી વધારી, અને મધ્યયુગથી ઉત્તરી આવેલા દરેક વર્ગને પૃષ્ઠભૂમિમાં ધકેલી દીધો.

એટલે આપણને જેવા મળે છે કે ખુદ આધુનિક મૂડીદાર વર્ગ કેવી રીતે લાંબા ગાળાના વિકાસની પેદાશ છે, ઉત્પાદનની તથા વિનિમયની રીતોમાં હારબંધ કાંતિઓની પેદાશ છે.

મૂડીદાર વર્ગના વિકાસના પ્રત્યેક કદમની સાથે સાથે એ વર્ગની એટલી રાજકીય ઉન્નતિ થતી ગઈ. સામંત ઉમરાવોના અમલમાં પીડિત વર્ગ, મધ્યયુગીન કોમ્યુન *માં હથિયારબંધ તથા સ્વશાસિત સંઘટન, ક્યાંક સ્વતંત્ર શહેરી પ્રજાસત્તાક

* ફ્રાંસમાં ઉગતાં શહેરોએ “ત્રીજ દરજા” તરીકે સામંતી ઉમરાવો તથા માલિકો પાસેથી સ્વશાસન તથા રાજકીય અધિકારો હાંસલ કરી લીધા તેનાથીયે પહેલાં એ શહેરોએ “કોમ્યુન” નામ ધારણ કરી લીધું હતું. અહીંથાં સામાન્ય રીતે, મૂડીદાર વર્ગના આર્થિક વિકાસની બાબતમાં ઈંગ્લેને અને તેના રાજકીય

(ઇટાલી અને જર્મનીમાં), ક્યાંક રાજશાહીમાં કરવેરા ભરતો “ગ્રીઝે દરજાઓ” (ક્રાંસમાં), ત્યાર પછી મેન્યુફેક્ચરના જમાના દરમિયાન અર્થસામંતી અથવા આપખુદ રાજશાહીમાં ઉમરાવોના મુકાબલાની કામગીરી બજાવનાર, અને હકીકતમાં સામાન્ય રૂપે મોટી રાજશાહીઓનો આધારસંબંધ — એવા મૂડીદાર વર્ગ આખરે, આધુનિક ઉદ્યોગ અને વિશ્વ બજારની સ્થાપના પછી, સંપૂર્ણ રાજકીય અમલ, આધુનિક પ્રતિનિધિ રાજ્યના રૂપમાં, પોતાને હસ્તક કરી લીધો છે. આધુનિક રાજ્યની કારોબારી તો સમગ્ર મૂડીદાર વર્ગના સહિયારા મામલા સંભાળતી સમિતિ જ છે.

ઈતિહાસિક દૃષ્ટિઓ, મૂડીદાર વર્ગ અત્યાંત કાંતિકારી ભૂમિકા ભજવી છે. મૂડીદાર વર્ગ જ્યાં જ્યાં વર્યસ્વ મેળવ્યું છે ત્યાં ત્યાં તેણે સામંતી, પિતૃપ્રધાન, ગ્રામગૌરવના સંબંધોને ખતમ કરી નાખ્યા છે. ઈન્સાનને તેના “કુદરતી ચિહ્યાતા માણસો” જેડે જકડી દેતાં પચરંગી સામંતી બંધનોને તેણે બેરહમીથી તોડીને ફાગાવી દીધાં છે, અને માનવીઓ વર્યે ઉધાડા સ્વાર્થ સિવાય, લાગણીશુન્ય “રોકડ ચુકવણી” સિવાય, બીજી કોઈ કરી બાકી રહેવા દીધી નથી. તેણે ધાર્મિક જુસ્સાના અત્યાંત દિવ્ય ભાવોન્માદોને, વીરવૃત્તિના જોશને, અસભ્ય લાગણીવિડાને, આપમતલબી ગણુતરીના ટાઢાભોળ પાણીમાં ઉબાલી દીધાં છે. તેણે વ્યક્તિગત લાયકાતને વિનિમય મૂલ્યમાં પલટાવી નાખ્યું છે, અને રદ ન થઈ શકે એવી અસંખ્ય સનદી આજાદીઓને સ્થાને એક જ વિવેકશુન્ય આજાદીની — મુક્ત વ્યાપારની — સ્થાપના કરી છે. ટંકમાં, તેણે ધાર્મિક તથા રાજકીય ભ્રમોથી ઢંકાયેલા શોષણને સ્થાને ઉધારું, બેશરમ, સીધું, પાશવી શોષણ જમાવી દીધું છે.

અત્યાર સુધી સન્માનિત અને નિષ્ઠામય અહોભાવ ઉપજાવતા દરેક વ્યવસાયનું તેજેંગંડળ મૂડીદાર વર્ગ ખતમ કરી નાખ્યું છે. તેણે તબીબને, વકીલને, પાદરીને, કવિને, વિજ્ઞાનીને, પોતાના પગારદાર રોજી-કામદારો બનાવી દીધા છે.

વિકાસની બાબતમાં ફ્રાંસને લાક્ષણિક દેશ તરીકે ગણવામાં આવ્યા છે. (૧૯૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

ઇટાલી અને ફ્રાંસના નગરવાસીઓએ સામંતી ઉમરાવો પાસેથી સ્વશાસનના પ્રાથમિક અધિકારો ખરીદી લીધા અથવા જીતી લીધા ત્યાર પછી તેમણે પોતાના શહેરી સમાજોને એ નામ આપ્યું હતું. (૧૯૯૦ની જર્મન આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

મૂડીદાર વર્ગે કુટુંબનું ભાવમય આવરણ ચીરી નાખીને કુટુંબને ખાલી પૈસાના સંબંધની હલતમાં ઉતારી નાખ્યું છે.

મૂડીદાર વર્ગ જહેર કરી દીધું છે કે પ્રત્યાધાતપંથીઓ જેની આટલી બધી પ્રશંસા કરે છે તે મધ્યયુગીન જોશના પાશવી પ્રદર્શનનો સહજ સંગાથી તદ્દન નિષ્ક્રિય પ્રમાણ હતો. પહેલી જ વાર મૂડીદાર વર્ગ બતાવી આપ્યું છે કે ઈન્સાનની પ્રવૃત્તિ કેવાં કેવાં પરિણામો પેદા કરી શકે. ઈજાપ્તના પિરામિડો, રોમના જલસેતુઓ (એક્વેડક્ટ) અને ગોથિક બાંધણીનાં દેવણો (કેથીડ્રાલો)ને પાછળ રાખી હો એવી અદ્ભુત સિદ્ધિઓ તેણે સાધી છે; અગાઉની રાષ્ટ્રોની તમામ હિન્દુતોને તથા તમામ જેહાદોને²⁷ જાંખી પાડી હો એવા મહાપ્રવાસો તેણે કરી બતાવ્યા છે.

ઉત્પાદનનાં સાધનોમાં કાંતિ આણ્યા વગર અને એ રીતે ઉત્પાદનના સંબોધોમાં તથા સાથે સાથે સમાજના સમગ્ર સંબંધોમાં કાંતિ આણ્યા વગર, મૂડીદાર વર્ગ હયાત ન રહી શકે. એથી ઊલટું, ઉત્પાદનની પુરાણી રીતોની બિનપરિવર્તિત રૂપમાં જળવણી, અગાઉના તમામ ઔદ્યોગિક વર્ગોની હયાતીની પહેલી શરત હતી. ઉત્પાદનમાં સતત કાંતિ, સમગ્ર સામાજિક સંજોગોમાં અવિરત ખલેલ, કાયમી અનિશ્ચિતતા અને હિલચાલ, મૂડીવાદી યુગને અગાઉના બધા યુગોથી અલગ તારવે છે. સધળા અચળ, સખત રીઢા સંબંધો, તેના સંગાથી પ્રાચીન તથા આદરણીય પૂર્વગ્રહો તથા માન્યતાઓ સમેત, ફેંકાઈને સાફ થઈ જાય છે, અને નવા સ્થપાયેલા સંબંધો રીઢા બનતા પહેલાં જ કાલગ્રસ્ત થઈ જાય છે. નક્કર બધું હવામાં ઓગળી જાય છે, પુનિત બધું ભ્રષ્ટ થઈ જાય છે, ઈન્સાનને આખરે પોતાની જિંદગીના ખરા સંજોગોનો, પોતાની જતિ સાથે પોતાના સંબંધોનો, હરેલ બુદ્ધિઓ સામનો કરવો પડે છે.

મૂડીદાર વર્ગના ઉત્પાદનની ચીને માટે નિરંતર વિસ્તરતા બજારની આવશ્યકતા તેને પૃથ્વીના આખા પટમાં ભમાવે છે. તેને દરેક ઠેકાણે વસવું પડે છે, દરેક ઠેકાણે સ્થાયી બનવું પડે છે, દરેક ઠેકાણે સંબંધો સ્થાપવા પડે છે.

મૂડીદાર વર્ગ વિશ્વ બજારના તેના ભોગવટા મારફત દરેક દેશમાં ઉત્પાદન તથા વપરાશને સર્વદેશી રૂપ આપ્યું છે. ઉદ્યોગ જેની ઉપર ઊભો હતો તે રાષ્ટ્રીય ભૂમિકા મૂડીદાર વર્ગ સરકાવી લીધી છે, જેથી પ્રત્યાધાતપંથીઓ ભારે ખીને ભરાય છે. તમામ પુરાણા સ્થાપિત ઉદ્યોગો કાં તો ખતમ થઈ ગયા છે અથવા દરરોજ ખતમ થઈ રહ્યા છે. તેઓનું સ્થાન નવા ઉદ્યોગો—હવે તળપદા કાચા માલનો નહિ પરંતુ અતંત દૂરવતી પ્રદેશોમાંથી આણવામાં આવેલા કાચા

માલનો ઉપયોગ કરતા ઉદ્ઘોગો, જેની પેદાશોનો વપરાશ કેવળ સ્વદેશમાં જ નહિ પરંતુ જગતના દરેક ભાગમાં થાય છે એવા ઉદ્ઘોગો—લઈ રહ્યા છે, અને એવા ઉદ્ઘોગો સ્થાપવાની બાબત તમામ સહ્ય દેશો માટે જીવનમરણની બાબત બની ગઈ છે. દેશના ઉત્પાદનથી સંતોષાઈ જતી પુરાણી જરૂરિયાતોને સ્થાને આપણને નવી જરૂરિયાતો જેવા મળે છે, જેને સંતોષવા માટે દૂરના દેશો તથા આબોહવામાં ઉત્પાદિત ચીજે આવશ્યક બને છે. પુરાણી સ્થાનિક તથા રાષ્ટ્રીય એકાઉન્ટના અને આત્મનિર્ભરતાને સ્થાને આપણને પ્રત્યેક દિશામાં વહેવાર, રાષ્ટ્રોનું સાર્વત્રિક પરસ્પરાવલંબન, જેવા મળે છે. અને ભૌતિક ઉત્પાદનની જેમ ભૌધિક ઉત્પાદનમાં પણ એમ જ બને છે. અલગ અલગ રાષ્ટ્રોનાં ભૌધિક સર્જનો સર્વસામાન્ય મિલકત બની જાય છે. રાષ્ટ્રીય એકાઉન્ટના તથા સંકુચિત મનોવૃત્તિ વધારે ને વધારે અશક્ય બને છે, અને સંખ્યાબંધ સ્થાનિક તથા રાષ્ટ્રીય સાહિત્યમાંથી વિશ્વ સાહિત્ય ઉદ્ય પામે છે.

મૂડીદાર વર્ગ ઉત્પાદનનાં તમામ સાધનોમાં ઝડપી સુધારા કરીને તથા વહેવારના ઉપાયોને બેહદ સરળ બનાવીને તમામ રાષ્ટ્રોને, તદ્દન જંગલી દશાનાં રાષ્ટ્રોને પણ, સહ્યતાના ક્ષેત્રમાં ખેંચી લે છે. તેના માલની સસ્તી કિંમતો ભારે તોપો જેવી છે, જેનો ઉપયોગ કરીને તે તમામ ચીની દીવાલોના ભુક્કા ઉડાવી દે છે, પરદેશીઓ પ્રત્યે જંગલી લોકોના તીવ્ર હઠીલા તિરસ્કારને તોડી નાખે છે. તે તમામ રાષ્ટ્રોને વિનાશના જોખમથી બચવા ઉત્પાદનની મૂડીવાદી રીત અપનાવવાની ફરજ પાડે છે, અને પોતે જેને સહ્યતા કહેવડાવે છે તેને તેઓની અંદર દાખલ કરવાની, અર્થાત् ખુદ મૂડીવાદી બની જવાની, ફરજ પાડે છે. ટૂંકમાં, તે પોતાના જ ખ્યાલને અનુરૂપ જગતનું સર્જન કરે છે.

મૂડીદાર વર્ગ ગામોને શહેરોના શાસનનાં તાબેદાર બનાવી દીધાં છે. તેણે વિશાળ શહેરોની રચના કરી છે, દેહાતી વસતિની સરખામણીમાં શહેરી વસતિ ખૂબ વધારી દીધી છે, અને એ રીતે, વસતિના સારા એવા હિસ્સાને દેહાતી જંગળીની બેવકૂફીથી છુટકારો અપાવ્યો છે. તેણે જેવી રીતે ગામોને શહેરો પર અવલંબિત બનાવી દીધાં છે એવી જ રીતે જંગલી તથા અર્ધજંગલી દશાના દેશોને સહ્ય દેશો પર, કિસાનોનાં રાષ્ટ્રોને મૂડીદારોનાં રાષ્ટ્રો પર, પૂર્વને પશ્ચિમ પર, અવલંબિત કરી દીધાં છે.

મૂડીદાર વર્ગ વસતિની, ઉત્પાદનનાં સાધનોની, તથા મિલકતની વેરવિખેર હાલતને ખતમ કરવાનું વધારે ને વધારે પ્રમાણમાં ચાલુ રાખે છે. તેણે વસતિની જમાવટ કરી છે, ઉત્પાદનનાં સાધનો કેંદ્રસ્થ કર્યા છે, અને મિલકતનું ગણતર

માણુસોના હાથમાં કેદ્દીકરણ કર્યું છે. તેનું આવશ્યક પરિણામ રાજકીય કેદ્દીકરણમાં આવ્યું છે. અલગ અલગ હિતો, કાનૂનો, સરકારો, તથા કર્વેરાની પદ્ધતિઓ ધરાવતા સ્વતંત્ર અથવા તદ્દન ઢીલા સંકળાયેલા પ્રાંતો એક જ સરકાર, ધારાધોરણ, રાષ્ટ્રીય વર્ગહિત, સરહદ, તથા જકાતપ્રથા ધરાવતા એક જ રાષ્ટ્રમાં બંધાઈ ગયા.

માંડ એકસો વરસના અમલ દરમિયાન મૂડીદાર વર્ગ સર્જેલાં ઉત્પાદક પરિબળો તમામ પુરોગામી પેઢીઓએ સર્જેલાં કુલ ઉત્પાદક પરિબળો કરતાં વધારે વિશાળ અને વધારે પ્રચંડ છે. કુદરતી શક્તિઓ પર માનવીનો અંકુશ, યંત્રો, ઉદ્યોગ તથા જેતીવાડીમાં રસાયણવિજ્ઞાનનો ઉપયોગ, વરણથી ચાલતાં જહાંલે, રેલવે, વીજળીથી ચાલતો તાર વહેવાર, જેતીવાડી માટે આખા ને આખા ખંડોની સાફ્સૂઝી, જાણે જાહુ કરીને ધરતીના પેટાળમાંથી પેદા કરેલી વિશાળ વસ્તિઓ—અગાઉની કઈ સદીને અણસારોયે હતો કે સામાજિક શ્રમના ખોળામાં આવાં ઉત્પાદક પરિબળો પોઢેલાં પડ્યાં છે!

તો આપણે જેયું કે જેના આધારે મૂડીદાર વર્ગનું ઘડતર થયું છે તે ઉત્પાદન તથા વિનિમયનાં સાધનો સામંત્ત્રી સમાજમાં ઉત્પન્ન થયાં હતાં. ઉત્પાદન તથા વિનિમયનાં એ સાધનોના વિકાસના અમૃક તબક્કે સામંત્ત્રી સમાજના ઉત્પાદન તથા વિનિમયના સંઝેગો, જેતીવાડી તથા મેન્યુફેક્ચર પદ્ધતિના ઉદ્યોગનું સામંત્ત્રી સંઘટન, ટુંકમાં મિલકતના સામંત્ત્રી સંબંધો, વિકસી ચૂકેલાં ઉત્પાદક પરિબળો જેડે સુસંગત ન રહ્યા, એ તો અનેક બેડીઓ જેવા બની ગયા. તેના ભુક્કા ઉડાવી દેવા પડે એમ હતા, તેના ભુક્કા ઉડાવી દેવામાં આવ્યા.

તેનું સ્થાન મુજલ હરીઝાઈએ વઈ લીધું, અને તેની સાથે સાથે તેને અનુરૂપ સામાજિક તથા રાજકીય તંત્ર આવ્યું, મૂડીદાર વર્ગનો આર્થિક તથા રાજકીય અમલ કાયમ થઈ ગયો.

એવી જ હિલચાલ આપણી નજર સામે ચાલી રહી છે. આધુનિક મૂડીવાડી સમાજ—ઉત્પાદનના, વિનિમયના, તથા મિલકતના પોતાના સંબંધો ધરાવતો સમાજ, ઉત્પાદન તથા વિનિમયનાં આવાં પ્રચંડ સાધનો પેદા કરનારો સમાજ—જાણે એવો જાહુગર છે કે જે પોતે જ મંત્રબળે બોલાવેલી આપાર્થિવ શક્તિઓને કાબૂમાં નથી રાખી શકતો. ગત ધણા દાયકાઓ દરમિયાન ઉદ્યોગ તથા વાણિજ્યનો ઈતિહાસ ઉત્પાદનના આધુનિક સંઝેગોની વિરુદ્ધ, મૂડીદાર વર્ગની હ્યાતી અને તેના અમલની શરતો સમા આધુનિક મિલકત સંબંધોની વિરુદ્ધ,

આધુનિક ઉત્પાદક પરિબળોના બંડનો ઈતિહાસ જ છે. સમયાંતરે ફરીને આવતી અને સમગ્ર મૂડીવાદી સમાજની હ્યાતીને દરેક વખતે વધારે જોખમી કસોટીએ ચડાવતી વાણિજ્ય કટોકટીઓનો ઉલ્લેખ પૂરતો થશે. એ કટોકટીઓમાં કેવળ મોજૂદ ઉત્પાદનનો જ નહિ પરંતુ અગાઉ સર્જિત ઉત્પાદક પરિબળોનોએ મોટો ભાગ સમય સમય પર નષ્ટ થઈ જાય છે. એ કટોકટીઓમાં અતિ-ઉત્પાદનનો એવો રોગચાળો ફાટી નીકળે છે કે જે અગાઉના બધા યુગોમાં બેહૂદગી જ ગણાયો હોત. સમાજ જાણે અચાનક જ પાછો અલ્પકાલીન જંગાલિયતમાં ધકેલાઈ જાય છે, એમ લાગે છે કે જાણે દુકાણે, તારાજીના સાર્વત્રિક જંગે, ગુજરાના પ્રત્યેક સાધનનો પુરવણો કાપી નાખ્યો છે, ઉદ્યોગ અને વાણિજ્ય જાણે નષ્ટ થઈ ગયેલા લાગે છે. પણ કેમ? કારણ કે સભ્યતા વધારે પડતી છે, ગુજરાનાં સાધનો વધારે પડતાં છે, ઉદ્યોગ વધારે પડતો છે, વાણિજ્ય વધારે પડતું છે. સમાજને હસ્તક ઉત્પાદક પરિબળો મૂડીવાદી મિલકતના સંઝેગોના વિકાસને આગળ ધ્યાવવાનું વલાણું હવે નથી ધરાવતાં, તેઓને જકડી રાખતા એ સંઝેગોથી તેઓ વધારે તાકાતવાન બની ગયાં છે, અને તેઓ થોડા વખતમાં જ એ બેડીઓને તોડી નાખે છે, સમગ્ર મૂડીવાદી સમાજમાં અંધેર પેદા કરે છે, મૂડીવાદી મિલકતની હ્યાતીને જોખમમાં મૂડી હે છે. તેઓએ પેદા કરેલી સંપત્તિને સમાવવા માટે મૂડીવાદી સમાજના સંઝેગો અત્યંત સાંકડા પડે છે. અને મૂડીદાર વર્ગ એ કટોકટીઓને કેવી રીતે પહોંચી વળે છે? એક તરફ તો ઉત્પાદક પરિબળોના ગંજને મજબૂરીથી નષ્ટ કરી નાખીને, અને બીજી તરફ નવાં બજારો સર કરીને તથા પુરાણાં બજારોનું વધારે સર્વાંગી થોષણું કરીને, એટલે કે વધારે વિસ્તૃત તથા વધારે વિનાશક કટોકટીઓનો માર્ગ મોકળો કરીને અને કટોકટીઓને અટકાવવાના ઉપાયો ઓછા કરીને.

મૂડીદાર વર્ગ ને હથિયારો વડે સામંતશાહીને જમીનદોસ્ત કરી નાખી હતી તે જ હથિયારો હવે ખુદ મૂડીદાર વર્ગની સામે ગોઠવાઈ ગયાં છે.

મૂડીદાર વર્ગ પોતાનો વિનાશ કરનારાં હથિયારો ઘડયાં છે એટલું જ નહિ પરંતુ એ હથિયારો વીજનારા ઈન્સાનોને, સર્વહારાઓને — આધુનિક કામદાર વર્ગને — પણ તેણે અસ્તિત્વમાં આપ્યા છે.

એટલા પ્રમાણમાં મૂડીદાર વર્ગનો અર્થાત્ મૂડીનો, વિકાસ થાય છે એટલા જ પ્રમાણમાં સર્વહારા વર્ગનો, આધુનિક કામદાર વર્ગનો — કામ મળે ત્યાં સુધી જ જીવતા રહી શકે અને તેમની મહેનત મૂડીમાં વધારો કરે ત્યાં સુધી જ કામ

મેળવી શકે એવા કામદારોના વર્ગનો—વિકાસ થાય છે. પોતાની જતને છૂટક છૂટક વેચવાની હાલતમાં જકડાયેલા એ કામદારો વેચાઉ માલ છે, વાણિજ્યની બીજી કોઈ ચીજ જેવા જ છે, અને તેના પરિણામે હરીકાઈની ચડતીપડતીના, બજારની તમામ તેજમંદીના, ભોગ બનેલા છે.

મશીનોના વિસ્તૃત ઉપયોગને લીધે તથા શ્રમના વિભાજનને લીધે સર્વહારાઓનાં તમામ વ્યક્તિગત રૂપલક્ષણો ખતમ થઈ ગયાં છે, અને કામદારની કામની ખુશી ખતમ થઈ ગઈ છે. તે મશીનનું જ એક અંગ બની જાય છે, અને તેની પાસેથી માત્ર તદ્દન સાદી, તદ્દન એકવિધ, અને તદ્દન સહેલાઈથી હાંસલ કરી શકાય એવી આવડતની જ અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કામદારના ઘડતરનું ખર્ચ, લગભગ પૂર્ણ રૂપે, તેની જિંદગીને ટકાવી રાખવા માટે તથા તેની જતિના ફેલાવા માટે આવશ્યક ગુજરાનાં સાધનો પૂરતું જ મર્યાદિત હોય છે. પરંતુ ચીજની, અને એટલે શ્રમની પણ કિંમત²⁸ ઉત્પાદનના ખર્ચ જેટલી હોય છે. એટલે કામની ધૂણાજનક તાસીર જેટલા પ્રમાણમાં વધે એટલા પ્રમાણમાં મહેનતાણું ઘટે છે. એટલું જ નહિ—મશીનોના ઉપયોગમાં તથા શ્રમના વિભાજનમાં જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય એટલા પ્રમાણમાં મહેનતનો બોણે પણ વધે છે—કામના કલાકોમાં વધારા મારફત, અમુક વખતની અંદર લેવાના કામમાં વધારા મારફત, કે પછી મશીનોના વધારવામાં આવેલા વેગ મારફત, વગેરે.

આધુનિક ઉદ્યોગે પિતાનુલ્ય માલિકના ટચૂકડા કારખાનાને ઔદ્યોગિક મૂડીદારના વિશાળ કારખાનામાં પલટાવી નાખ્યું છે. કારખાનામાં એકઢા કરવામાં આવેલા કામદારોનું સિપાહીઓની નેત્રે સંઘટન કરવામાં આવે છે. ઔદ્યોગિક લશકરના સિપાહીઓ તરીકે તેઓને અફસરો તથા હવાલદારોના પરિપૂર્ણ સોચાનતાની સરદારી હેઠળ ગોઠવવામાં આવે છે. તેઓ મૂડીદાર વર્ગના તથા મૂડીવાદી સમાજના ગુલામો તો છે જ, પરંતુ એ ઉપરાંત મશીન, જોબર, અને સૌથી વધારે તો ખુદ વ્યક્તિગત મૂડીવાદી કારખાનદાર, દરરોજ તથા દર કલાકે તેમને ગુલામીમાં જકડે છે. આ જુલમશાહી નફાને જ પોતાનું ધ્યેય તથા લક્ષ્ય જેટલી વધારે ખુલ્લી રીતે જહેર કરે છે એટલા પ્રમાણમાં તે વધારે અધમ, વધારે ખિક્કારપાત્ર, અને વધારે કટુતાજનક બને છે.

શારીરિક મહેનતમાં કાબેલિયત અને જોરનો ઉપયોગ જેટલો ઘટે છે, અથવા આધુનિક ઉદ્યોગ જેટલો વધારે વિકસે છે, એટલા પ્રમાણમાં પુરુષના શ્રમનું સ્થાન લ્યોનો શ્રમ લે છે. કામદાર વર્ગની બાબતમાં ઉંમરના તથા નરનારીના

બેદ હવે કશી વિશિષ્ટ સામાજિક માન્યતા નથી ધરાવતા. સૌ શ્રમનાં સાધનો હોય છે, ઉમર અને જાતિ મુજબ વધારે કે ઓછાં ખર્ચળ સાધનો હોય છે.

કારખાનદાર તરફથી કામદારનું શોપણ પૂરું થાય અને કામદારને રોકડ વેતન મળે કે તરત જ મૂડીદાર વર્ગના બીજા વિભાગો — મકાનમાલિક, દુકાનદાર, વ્યાજખોર, વગેરે — તેની ઉપર તૂટી પડે છે.

મધ્યમ વર્ગના નીચલા થરો — નાના ઉદ્ઘોગો ચલાવતા લોકો, દુકાનદારો, સામાન્ય રૂપે ધંધાદારી માણસો, કારીગરો, અને કિસાનો — એ સૌ ધીરે ધીરે સર્વહારાઓમાં પલટાઈ જાય છે, અમુક અંશો એ કારણે કે આધુનિક ઉદ્ઘોગ જે પાયા પર ચાલે છે તેને માટે તેમની નજીવી મૂડી અપૂરતી હોય છે તથા મોટા મૂડીદારો જેડેની હરીક્ષાઈમાં ખતમ થઈ જાય છે, અને અમુક અંશો એ કારણે કે ઉત્પાદનની નવી રીતો તેમની વિશિષ્ટ પ્રકારની કાબેલિયતને નકામી બનાવી દે છે. એ રીતે, સર્વહારા વર્ગની ભરતી વસતિના સધણા વર્ગોમાંથી થાય છે.

સર્વહારા વર્ગ વિકસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. તેના જન્મથી જ મૂડીદાર વર્ગ સામેનો તેનો સંધર્ષ શરૂ થઈ જાય છે.

રસાકસીની શરૂઆત વ્યક્તિગત કામદારો કરે છે, પછી એક કારાયાનાના કામદારો સંધર્ષ લડે છે, ત્યાર બાદ એક જ જાતનું કામ કરનારા, એક જ વિસ્તારના, કામદારો તેમનું સીધું શોપણ કરનારા વ્યક્તિગત મૂડીદારની સામે સંધર્ષ ચલાવે છે. તેમના હુમલા ઉત્પાદનના મૂડીવાદી સંજોગોની સામે નહિ પરંતુ ઝુદ ઉત્પાદનનાં સાધનોની સામે લક્ષ્યાંકિત હોય છે. તેઓ તેમની મહેનતની જેડે હરીક્ષાઈ કરતી આયાત કરેલી ચીજેને નાખ કરી નાખે છે, તેઓ મશીનોના ભુક્કા ઉડાવી દે છે, તેઓ કારખાનાંને આગ લગાવી દે છે, મધ્યયુગીન કામદારના અદૃશ્ય થઈ ગયેલા દરજાને બળજાબરીથી ફરી સ્થાપવાની તેઓ કોશિશ કરે છે.

એ તબક્કે કામદારો હજુ આખા દેશમાં વિભરાયેલો અને પરસ્પર હરીક્ષાઈને લીધે વિભાજિત થઈ ગયેલો બિનસંકળાયેલી હાલતનો સમુદ્ધાય હોય છે. કોઈ ઠેકાણે તેઓ એકતા સાધીને વધારે સુધારિત સંગઠન સાધી શકતા હોય તો એમ તેમની પોતાની સકિય એકસંપીના પરિણામે નહિ પરંતુ મૂડીદાર વર્ગની એકસંપીના પરિણામે બનતું હોય છે. એ વર્ગને પોતાનાં રાજકીય લક્ષ્યોની સિદ્ધ ખાતર સમગ્ર સર્વહારા વર્ગને ગતિશીલ કરવો પડે છે, વળી તે હજુ સુધી, થોડા વખત પૂરતો એમ કરી શકે છે. એટલે આ તબક્કે સર્વહારાઓ પોતાના દુશ્મનોની સામે નહિ પણ દુશ્મનોની દુશ્મનોની સામે — આપખુદ રાજશાહીના

અવશેષો, જમીનદારો, બિનઅંડોગિક મૂડીદાર, તથા નાના મૂડીદારોની સામે— લડે છે. એ રીતે સમગ્ર ઐતિહાસિક આંદોલન મૂડીદાર વર્ગના હાથમાં કેંદ્રિત થયેલું છે, આ રીતે હાંસલ કરવામાં આવેલો પ્રત્યેક વિજય મૂડીદાર વર્ગનો વિજય છે.

પરંતુ ઉદ્ઘોગનો વિકાસ થતાં, સર્વહારા વર્ગની સંખ્યામાં વધારો થવા ઉપરાંત તેનું વધારે મોટા સમૂહોમાં કેંદ્રીકરણ થાય છે, તેની તાકાત વધે છે, અને એ તાકાત અંગે તે વધારે સભાનતા અનુભવે છે. જેટલા પ્રમાણમાં મશીનો મહેનતના સધળા તફાવતોને ભૂસી નાખે છે અને લગભગ દરેક ઠેકાણે વેતનને એકસરખી નીચી સપાટીએ આણી દે છે, એટલા પ્રમાણમાં સર્વહારા વર્ગની હરોળોમાં વિવિધ હિતો અને નિંદગીના સંજેંગો વધારે ને વધારે એકસમાન બને છે. મૂડીદારો વર્ચ્યેની વધતી જતી હરીજ્ઝાઈ અને તેમાંથી પેદા થતી વાણિજ્યની કટોકટીઓને કારણે કામદારોનાં વેતનમાં નિરંતર વધારે ને વધારે વધધટ થતી રહે છે. પ્રતિદિન વધારે ઝડપથી વિકાસ પામતી મશીનોની અવિરત સુધારણા તેમના ગુજરાનને વધારે ને વધારે અનિશ્ચિત બનાવે છે, વ્યક્તિગત કામદારો અને વ્યક્તિગત મૂડીદાર વર્ચ્યેનાં ધર્ષણો વધારે ને વધારે પ્રમાણમાં બે વર્ગો વર્ચ્યેનાં ધર્ષણોનું રૂપ ધારણ કરે છે. ત્યારે કામદારો મૂડીદારની સામે એકસંપી (કામદાર મંડળો) સાધવાનું શરૂ કરે છે, તેઓ મહેનતાણાના દરોની સપાટી જળવી રાખવા સારુ એકતા સાધે છે, સમય સમય પર થતાં એવાં બંદની તૈયારી અગાઉથી કરી લેવા માટે તેઓ કાયમી મંડળો સ્થાપે છે. ક્યાંક ક્યાંક સંધર્ણ દરમિયાન તોફાનો ફાટી નીકળે છે.

ક્યારેક ક્યારેક કામદારો વિજયી બને છે, પણ થોડા સમય પૂરતા જ. તેમની લડતોનું ખરું સુફળ તાત્કાલિક પરિણામોમાં નહિ પરંતુ કામદારોની નિરંતર વિસ્તાર પામતી એકસંપીમાં છે. આધુનિક ઉદ્ઘોગે સંજેલાં વહેવારનાં બહેતર સાધનોથી કામદારોને એવી એકસંપીમાં મદદ મળે છે, એથી જુદા જુદા વિસ્તારોના કામદારો પરસ્પર સંપર્ક રાખી શકે છે. તમામ એકસરખા સ્વરૂપના સંખ્યાબંધ સ્થાનિક સંઘર્ણોનું કેંદ્રીકરણ વર્ગો વર્ચ્યેના એક જ રાષ્ટ્રીય સંઘર્ણમાં કરવા માટે એવા સંપર્કની જ જરૂર હતી. પરંતુ પ્રત્યેક વર્ગસંઘર્ણ રાજકીય સંઘર્ણ હોય છે. મધ્યયુગના નગરવાસીઓને ખરાબ માર્ગોને કારણે એવી એકસંપી સાધવામાં સદીઓની જરૂર પડી હતી, પરંતુ આધુનિક સર્વહારાઓ રેલવેની સગવડને કારણે થોડાંક વરસોની આંદર એકસંપી સાધી શકે છે.

સર્વહારામોનું એક વર્ગના રૂપમાં એ સંગઠન, અને તેના પરિણામે રાજકીય પાર્ટીના રૂપમાં સંગઠન, વળી પાછું ખુદ કામદારો વર્ચ્યેની હરીજ્ઝાઈને લીધે

સતત ખોરવાનું રહે છે. પરંતુ તે હંમેશાં વધારે મજબૂત, વધારે મક્કમ, વધારે સમર્થ રૂપમાં ફરી ખંડું થાય છે. ખુદ મૂડીદાર વર્ગની અંદરના ભાગલાનો ફાયદો ઉદાવીને તે કામદારોનાં વિશિષ્ટ હિતોની કાનૂની માન્યતા હાંસલ કરે છે. ઈંગ્લેઝમાં દસ કલાકનું બિલ એવી રીતે પાસ થયું હતું.

પુરાણા સમાજના વર્ગો વર્ચેનાં ધર્ષણો એકંદરે સર્વહારા વર્ગના વિકાસની કિયાને ઘણ્ણી રીતે આગળ ધ્યાવે છે. મૂડીદાર વર્ગને નિરંતર લડત લડવી પડે છે—શરૂઆતમાં ઉમરાવ વર્ગની સામે, પછી ખુદ મૂડીદાર વર્ગના જે હિસ્સાઓનાં હિતો ઉદ્યોગની પ્રગતિના વિરોધી બની ગયાં છે તેઓની સામે, અને લગાતાર પરદેશી મૂડીદારોની સામે. એ બધી લડતોમાં તે સર્વહારા વર્ગને અપીલ કરવાની, તેની મદદ માગવાની, અને એ રીતે તેને રાજકીય મેદાનમાં ઝોંચવાની, હાલતમાં આવી પડે છે. એટલે, ખુદ મૂડીદાર વર્ગ સર્વહારા વર્ગને રાજકીય તથા સામાન્ય કેળવણીનાં તેનાં આગવાં તત્ત્વો પૂરાં પાડે છે, અથવા બીજા શબ્દોમાં, સર્વહારા વર્ગને મૂડીદાર વર્ગની સામે લડવાનાં હથિયારો પૂરાં પાડે છે.

વળી આપણે જોઈ ગયા તેમ, ઉદ્યોગની ઉન્નતિથી શાસક વર્ગોના આખા ને આખા વિભાગો સર્વહારા વર્ગની હાલતમાં ધકેલાઈ જાય છે, અથવા ઓછામાં ઓછું, તેઓની હયાતીના સંજેગો જોખમમાં આવી પડે છે. તેઓ પણ સર્વહારા વર્ગને વાકેફુગારી તથા પ્રગતિનાં નવાં તત્ત્વો પૂરાં પાડે છે.

છેલ્લે — વર્ગસંધર્ણની નિર્ણયક ઘડી સમીપ આવે ત્યારે શાસક વર્ગની અંદર, હકીકતમાં પુરાણા સમાજના સમગ્ર ક્ષેત્રમાં, ચાલતી વિધટનની પ્રક્રિયા એવું કારણું સચોટ રૂપ ધારણ કરે છે કે શાસક વર્ગનો એક ભાગ છૂટો પડીને કાંતિકારી વર્ગની સાથે, ભાવિ જેના હાથમાં છે એ વર્ગની સાથે, જોડાઈ જાય છે. એટલે, જેવી રીતે અગાઉના જમાનામાં ઉમરાવ વર્ગનો એક વિભાગ મૂડીદાર વર્ગના પક્ષે ચાલ્યો ગયો હતો એવી જ રીતે હવે મૂડીદાર વર્ગનો એક હિસ્સો, અને ખાસ કરીને તો મૂડીવાદી વિચારકોના જે હિસ્સાએ સમગ્ર ઐતિહાસિક આંદોલનની સૈદ્ધાંતિક સમજણની કક્ષા સુધીની ઉન્નતિ સાધી લીધી છે એ હિસ્સો, સર્વહારા વર્ગને પક્ષે ચાલ્યો જાય છે.

આજે મૂડીદાર વર્ગની સામે જે બધા વર્ગો ખડા છે તેમાં એકલો સર્વહારા વર્ગ જ ખરેખરો કાંતિકારી વર્ગ છે. આધુનિક ઉદ્યોગના સામનામાં બીજા વર્ગોની અંદર સરો પેસે છે અને તેઓ આખરે ખતમ થઈ જાય છે, સર્વહારા વર્ગ તેની વિશિષ્ટ અને તાત્ત્વિક પેદાશ છે.

નીચલો મધ્યમ વર્ગ, નાનો કારખાનદાર, દુકાનદાર, કારીગર, કિસાન — એ સૌ મધ્યમ વર્ગના અંશો તરીકેની પોતાની હસ્તીને વિનાશથી બચાવવા ખાતર મૂડીદાર વર્ગની સામે લડે છે. એટલે તેઓ કાંતિકારી નહિ પણ રૂઢિયુસ્ત છે, વધારામાં તેઓ પ્રત્યાધાતી છે કારણે કે તેઓ ઈતિહાસના ચકને ઉલટું ચલાવવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ ક્યારેક કાંતિકારી હોય તો માત્ર એ કારણે કે તેઓ સર્વહારા વર્ગની હાલતમાં ધકેલાઈ જવાની અણિ પર હોય છે. એ રીતે તેઓ પોતાનાં વર્તમાન હિતોની નહિ પણ ભાવિ હિતોની રક્ષા કરે છે, તેઓ પોતાનું દૃષ્ટિબંદુ છોડી દે છે અને સર્વહારા વર્ગનું દૃષ્ટિબંદુ અપનાવી લે છે.

“ખતરનાક વર્ગ”, સમાજનો ઉતાર, પુરાણા સમાજના સૌથી નીચલા થરોએ ફુગાવી દીધિલો ચેતનહીન ગંધાતો જમેલો, સર્વહારા કાંતિથી કદાચ ઝાંક ઝાંક આંદોલનમાં ધકેલાઈ જાય ખરો. પરંતુ તેની નિંદગીના સંજેગો તો તેને પ્રત્યાધાતી કાવાદાવાના લાંચખાઉ હાથાની ભૂમિકા માટે જ ધારો વધારે તૈયાર કરે છે.

સમગ્ર પુરાણા સમાજના સંજેગો સર્વહારા વર્ગની નિંદગીમાંથી વાસ્તવમાં ક્યારના ખતમ થઈ ગયા છે. સર્વહારા પાસે મિલકત નથી, તેનાં બૌરીછોકરાં સાથેના તેના સંબંધમાં હવે મૂડીવાદી કોટુંબિક સંબંધો જોડે મુદ્દલ સમાનતા નથી રહી. ઠંગલુંદમાં, ફ્રાંસમાં, અમેરિકામાં, જર્મનીમાં, એકસરાખી આધુનિક ઔદ્યોગિક મહેનતે, મૂડીની આધુનિક તાબેદારીએ, રાષ્ટ્રીય રૂપલક્ષણની પ્રત્યેક નિશાની તેની નિંદગીમાંથી ખતમ કરી નાખી છે. કાનૂન, નીતિનિયમો, ધર્મ, એ બધા તેને માટે મૂડીવાદી પૂર્વગ્રહો છે જેની પાછળ એટલાં જ મૂડીવાદી હિતો છુપાઈને લાગ જેતાં બેઠાં છે.

વર્ચસ્વ હાંસલ કરનારા તમામ પુરોગામી વર્ગોએ પોતે હાંસલ કરી લીધિલા દરજાની કિલ્લેબંધીની કોશિશ સમગ્ર સમાજને પોતાની માલિકીના સંજેગોની તાબેદારીમાં જકડી લઈને કરી હતી. સર્વહારાઓ માલિકીની તેમની પોતાની અગાઉની રીતને નાખૂદ કરી નાખ્યા વગર, અને એમ કરીને માલિકીની અગાઉની બીજી દરેક રીતને પણ નાખૂદ કરી નાખ્યા વગર, સમાજનાં ઉત્પાદક પરિબળોના સ્વામીઓ ન જ બની શકે. તેમને પોતાને માટે હાંસલ કરવાનું અને કિલ્લેબંધીમાં સાચવી રાખવાનું કશું જ નથી. તેમનું મિશન તો વ્યક્તિગત મિલકતની અગાઉની તમામ સલામતીઓ તથા ખાતરીઓને ખતમ કરી નાખવાનું છે.

અગાઉની તમામ હિલયાલો લધુસંખ્યાઓની હતી અથવા લધુસંખ્યાઓના હિતમાં હતી. સર્વહારા આંદોલન પ્રચંડ બહુસંખ્યાનું અને પ્રચંડ બહુસંખ્યાના હિતમાં સભાન, સ્વતંત્ર આંદોલન છે. સર્વહારા વર્ગ, આપણા વર્તમાન સમાજનો સૌથી નીચલો સ્તર, સત્તાવાર સમાજના તેની ઉપર લદાઈ ગયેલા સમસ્ત સ્તરોને અખ્ર ફંગોળી દીધા વગર, હલી જ ન શકે, ખડો થઈ જ ન શકે.

મૂડીદાર વર્ગની સામે સર્વહારા વર્ગનો સંઘર્ષ, સારતત્ત્વની તો નહિ પણ રૂપની દૃષ્ટિએ, આરંભમાં રાષ્ટ્રીય સંઘર્ષ હોય છે. દરેક દેશના સર્વહારા વર્ગ બેશક સૌપ્રથમ તો પોતાના દેશમાં મૂડીદાર વર્ગનો મામલો પતાવી લેવો જેઈએ.

આપણે સર્વહારા વર્ગના વિકસના અત્યંત સામાન્ય તબક્કાઓના ચિતારમાં, વર્તમાન સમાજની અંદર ચાલતા ઓછાવતા આવૃત આંતરવિગ્રહની રૂપરેખા એટબે સુધી દોરી કે જ્યારે વિગ્રહ દરમિયાન ખુલ્લી કાંતિ ફાટી નીકળે છે, અને મૂડીદાર વર્ગને બળપૂર્વક ઉથલાવી પાડવાનું કદમ સર્વહારા વર્ગના અમલનો પાયો નાખે છે.

આપણે જેઈ ગયા કે અત્યાર સુધી સમાજનું દરેક રૂપ પીડક અને પીડિત વર્ગ વરચેના અંટસ ઉપર આધારિત રહ્યું છે. પરંતુ કોઈ વર્ગનું પીડન કરવા માટે તેને એવા અમુક સંઝેગોની ખાતરી તો મળવી જ જેઈએ કે જેમાં તે પોતાની ગુલામીની જંદગીને જેમતેમ કરીને ટકાવી રાખી શકે. સામંતી આપખુદશાહીની ધૂસરીમાં જકડાયેલો નાનો મૂડીદાર જેવી રીતે ઉન્નતિ સાધીને પૂરો મૂડીદાર બની ગયો, એવી જ રીતે જેતગુલામીના જમાનામાં જેતગુલામે ગ્રામસમાજનું સભ્યપદ મેળવવા જેટલી ઉન્નતિ સાધી હતી. પરંતુ એથી ઊલટું, આધુનિક કામદાર ઉદ્યોગની પ્રગતિની સાથે સાથે ઉન્નતિ સાધવાને બદલ્યે તેના પોતાના વર્ગની હ્યાતીના સંઝેગોથી વધારે ને વધારે નીચે સરકતો જય છે. તે કંગાલ બની જય છે, અને વસતિ તથા સંપત્તિ કરતાં કંગાલિયત વધારે જડપથી વિકસે છે. એ તબક્કે સ્પષ્ટ થઈ જય છે કે મૂડીદાર વર્ગમાં સમાજના શાસક વર્ગ તરીકે વધારે વખત કાયમ રહેવાની અને સર્વોપરી કાનૂન તરીકે સમાજની ઉપર હ્યાતીના પોતાની મરજી મુજબના સંઝેગો લાદવાની લાયકાત હવે નથી રહી. શાસન કરવા તે નાલાયક છે કારાગું કે તે પોતાના ગુલામને ગુલામીની ભીતર હ્યાતી ટકાવી રાખવાની ખાતરી આપવા અસમર્થ છે, ગુલામને આવી હાલતમાં સરકતો અટકાવવા તે કશું કરી શકતો નથી, ગુલામના ભોગે પોષણ મેળવવાને બદલ્યે તે ઊલટો ગુલામને ખવડાવવાની હાલતમાં આવી પડ્યો

છે. સમાજ હવે આ મૂડીદાર વર્ગના વર્ચસ્વ હેઠળ રહી શકે એમ નથી, અથવા બીજા શરૂઆતોમાં, તેની હયાતી હવે સમાજ સાથે સુસંગત નથી.

મૂડીદાર વર્ગની હયાતી અને તેના અમલ માટે આવશ્યક શરત મૂડીનો સંચય અને વૃદ્ધિ છે, અને મૂડી માટેની શરત છે રોજી-મજૂરી. રોજી-મજૂરી કામદારો વચ્ચેની હરીફાઈ ઉપર પૂર્ણ રૂપે આધારિત છે. ઉદ્યોગની ઉન્નતિ — જેને મૂડીદાર વર્ગ અનિયાંશે પ્રવેગ આપે છે — હરીફાઈમાંથી ઉદ્ભવતી કામદારોની એકાઉન્ટાની જગ્યાએ સહવાસમાંથી ઉદ્ભવતી કાંતિકારી એકસંપીને આપે છે. એટલે મૂડીદાર વર્ગ જેના આધારે ઉત્પાદન કરે છે તથા ઉત્પાદિત ચીજો કબજે કરી લે છે એ પાણાને જ આધુનિક ઉદ્યોગનો વિકાસ ખોટી નાખે છે. એ રીતે મૂડીદાર વર્ગ સૌપ્રથમ તો તેની પોતાની જ કબર ખોદનારાઓને પેદા કરે છે. મૂડીદાર વર્ગનું પતન અને સર્વહારા વર્ગનો વિજય એકસરખાં અનિવાર્ય છે.

૨. સર્વહારાઓ અને કોમ્પ્યુનિસ્ટો

કોમ્પ્યુનિસ્ટો સમગ્ર સર્વહારાઓ જેડે કેવો સંબંધ ધરાવે છે?

કોમ્પ્યુનિસ્ટો કામદાર વર્ગની અન્ય પાર્ટીઓના વિરોધમાં અલગ પાર્ટી બનાવતા નથી.

સમગ્ર સર્વહારા વર્ગનાં હિતોથી અલગ અને ભિન્ન કોઈ હિતો તેઓ નથી ધરાવતા.

કોમ્પ્યુનિસ્ટો કામદાર વર્ગની અન્ય પાર્ટીઓથી માત્ર આટલી બાબતોમાં જુદા પડે છે: ૧. વિવિધ દેશોના સર્વહારાઓના રાષ્ટ્રીય સંઘર્ષોમાં તેઓ સમગ્ર સર્વહારા વર્ગનાં સમસ્ત રાષ્ટ્રીયતાથી સ્વતંત્ર સર્વસામાન્ય હિતો પ્રત્યે નિર્દેશ કરે છે અને તેને મોખરે આપે છે. ૨. મૂડીદાર વર્ગની સામે કામદાર વર્ગના સંઘર્ષને વિકાસના જે વિવિધ તબક્કાઓ પાર કરવાના છે તેમાં કોમ્પ્યુનિસ્ટો હંમેશાં અને દરેક ઠેકાણે સમગ્ર આંદોલનનાં હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

એટલે કોમ્પ્યુનિસ્ટો એક તરફ તો વાસ્તવમાં દરેક દેશની કામદાર વર્ગીય પાર્ટીઓનો સૌથી ઉન્નત અને મજક્કમ વિભાગ છે, બીજી બધા વિભાગોને આગળ ધકેલતો વિભાગ છે; અને બીજી તરફ, તેઓ સર્વહારા આંદોલનની આગેકૂચનો માર્ગ, સંજેગો, તથા આખરી સામાન્ય પરિણામોની સ્પષ્ટ સમજાળ ધરાવતા હોવાથી, સૈદ્ધાંતિક દૃષ્ટિઓ, સર્વહારા વર્ગના વિશાળ સમુદ્દરાયથી ચિયાતું સ્થાન ધરાવે છે.

કોમ્પ્યુનિસ્ટોનું તાત્કાલિક લક્ષ્ય બીજી તમામ સર્વહારા પાર્ટીઓના લક્ષ્ય જેવું જ છે — સર્વહારા વર્ગનું એક વર્ગ તરીકે સંગઠન સાધવું, મૂડીદારોની સર્વોપરીતાને ઉથલાવી પાડવી, સર્વહારા વર્ગ રાજકીય સત્તા જીતી લેવી.

કોમ્પ્યુનિસ્ટોના સૈદ્ધાંતિક નિષ્કર્ષો, જગત-સુધારક બનવાનાં સ્વર્ણાં સેવતા આ કે તે કોઈ માણસે ઉપજવી અથવા શોધી કાઢેલા વિચારો કે સિદ્ધાંતો ઉપર કોઈ પણ રીતે આધારિત નથી.

તેઓ તો વર્તમાન વર્ગસંધર્મમાંથી, આપણી નજર સામે ચાલતી ઐતિહાસિક હિલચાલમાંથી ઉદ્ભવતા હકીકતી સંબંધોને સામાન્ય શરૂઆતમાં માત્ર વ્યક્ત જ કરે છે. પ્રવર્તમાન મિલકત સંબંધોની નાભૂદી સામ્યવાદનું વિશિષ્ટ લક્ષણ મુદ્દલ નથી.

ઐતિહાસિક સંજ્ઞોમાં પરિવર્તનના પરિણામે, તમામ મિલકત સંબંધોમાં નિરંતર ઐતિહાસિક પરિવર્તન થતું રહ્યું છે.

દાખલા તરીકે, ફેંચ કાંતિએ સામંતી મિલકતને મૂડીવાદી મિલકતની તરફેણમાં નાભૂદ કરી નાખી.

સામ્યવાદનું વિશિષ્ટ લક્ષણ સામાન્ય રૂપે મિલકતને નાભૂદ કરી નાખવાનું નહિ પરંતુ મૂડીવાદી મિલકતને નાભૂદ કરી નાખવાનું છે.

આધુનિક મૂડીવાદી ખાનગી મિલકત ચીજેનું ઉત્પાદન કરવાની તથા તેને કબજે કરી કેવાની પદ્ધતિની આખરી અને તદ્દન પરિપૂર્ણ અભિવ્યક્તિ છે. એ પદ્ધતિ વર્ગો વર્ચેના અંટસો ઉપર આધારિત છે, થોડા માણસોને હાથે આજા માણસોના શોષણ ઉપર આધારિત છે.

એ અર્થમાં કોમ્યુનિસ્ટોના સિદ્ધાંતનો સાર એક જ વાક્યમાં તારવી શકાય — ખાનગી મિલકતની નાભૂદી.

અમને કોમ્યુનિસ્ટોને ધમકાવવામાં આવે છે કે અમારો મુરાદ ઈન્સાનની પોતાની મહેનતના સુફળ તરીકે વ્યક્તિગત રૂપે મિલકત હાંસલ કરવાના તેના અધિકારને નાભૂદ કરી નાખવાની છે, અને કહેવામાં આવે છે કે એવી મિલકત સમગ્ર વ્યક્તિગત આજાદી, પ્રવૃત્તિ, અને સ્વતંત્રતાની ભૂમિકા છે.

સખત મહેનતથી હાંસલ કરેલી, જાતે મેળવેલી, ખુદ રણેલી મિલકત! તમારો નિર્દેશ નાના કારીગર અને નાના કિસાનની મિલકત પ્રત્યે છે? મિલકતના મૂડીવાદી રૂપના પુરોગામી રૂપ પ્રત્યે છે? તેને નાભૂદ કરી નાખવાની મુદ્દલ જરૂર નથી, ઉદ્યોગના વિકાસના પરિણામે તે મોટે ભાગે તો ક્યારની ખતમ થઈ ગઈ છે, અને હજુ દરરોજ ખતમ થઈ રહી છે.

કે પછી તમારો નિર્દેશ આધુનિક મૂડીવાદી ખાનગી મિલકત પ્રાણે છે?

પરંતુ રોજી-મજૂરી કામદાર માટે કશી મિલકત પેદા કરે છે ખરી? મુદ્દલ નહિ. તે મૂડી પેદા કરે છે, અર્થાત् એવા પ્રકારની મિલકત પેદા કરે છે જે રોજી-મજૂરીનું શોષણ કરે છે, અને નવા શોષણ માટે રોજી-મજૂરીનો નવો પુરવઠો ઉત્પન્ન કરવાના સંજ્ઞો વગર તે વધી ન શકે. વર્તમાન રૂપમાં મિલકત મૂડી અને રોજી-મજૂરી વર્ચેના અંટસ ઉપર આધારિત છે. હવે આપણે એ અંટસનાં બન્ને પાસાંનું પરીક્ષણ કરીએ.

મૂડીદાર બનવા માટે ઉત્પાદનમાં કેવળ નિલોળ વ્યક્તિગત જ નહિ પરંતુ સામાજિક દરજાને ધરાવવો જોઈએ. મૂડી સામુહિક પેદાશ છે, અને સમાજના ઘણા સભ્યોની સંયુક્ત પ્રવૃત્તિ મારફત જ તેને ગતિમાન કરી શકાય.

એટલે મૂડી વ્યક્તિગત નહિ પણ સામાજિક તાકાત છે.

એટલે મૂડીને જ્યારે સહિયારી મિલકતમાં, સમાજના તમામ સભ્યોની મિલકતમાં, પલટાવી નાખવામાં આવે ત્યારે તેના પરિણામે વ્યક્તિગત મિલકત સામાજિક મિલકતમાં નથી પલટાઈ જતી. મિલકતનું માત્ર સામાજિક સ્વરૂપ જ પલટાય છે. તેનું વર્ગ સ્વરૂપ ખતમ થઈ જાય છે.

હવે આપણે રોજ-મજૂરીનું પરીક્ષણ કરીએ.

રોજ-મજૂરીની સરેરાશ કિંમત લઘુતમ વેતન જેટલી હોય છે, અર્થાત् ગુજરાનની ચીજેના એટલા જથ્થા પૂરતી હોય છે કે જે કામદારની કામદાર તરીકેની હ્યાતી માંડ ટકાવી રાખવા માટે તદ્દન આવશ્યક હોય. એટલે રોજ-કામદાર મહેનત કરીને જે કંઈ મેળવે છે તે લૂંઝી હ્યાતીને ટકાવી રાખવા તથા ફરી પેદા કરવા પૂરતું જ હોય છે. મહેનતની પેદાશોની એવી વ્યક્તિગત માલિકીને, માનવીય જીવનને ટકાવી રાખવા તથા નવા ઈન્સાનો પેદા કરવા માટે ધરાવવામાં આવતી માલિકીને, જેમાંથી બીજાની મહેનતનો ફાયદો ઉઠાવવા માટે વધારાનું કશું બચતું ન હોય એવી માલિકીને, નાબૂદ કરી નાખવાનો કશો ઈરાદો અમે નથી ધરાવતા. અમે તો ફક્ત એવી માલિકીના કંગાલ સ્વરૂપને, જેમાં કામદાર કેવળ મૂડીમાં વધારો કરવા ખાતર જીવે છે અને શાસક વર્ગના હિતમાં જરૂરી હોય ત્યાં સુધી જ તેને જીવતો રહેવા દેવામાં આવે છે એવા સ્વરૂપને, નાબૂદ કરી નાખવા માણીએ છીએ.

મૂડીવાદી સમાજમાં સજ્જવ મહેનત સંચિત મહેનતમાં વધારો કરવાનું કેવળ સાધન જ છે. સામ્યવાદી સમાજમાં સંચિત મહેનત કામદારની હ્યાતીને વિસ્તારવાનું, સમૃદ્ધ બનાવવાનું, પ્રવેગ આપવાનું, કેવળ સાધન જ છે.

એટલે મૂડીવાદી સમાજમાં વર્તમાન ઉપર ભૂતકાળનું વર્ચસ્વ હોય છે, અને સામ્યવાદી સમાજમાં ભૂતકાળ ઉપર વર્તમાનનું વર્ચસ્વ હોય છે. મૂડીવાદી સમાજમાં મૂડી સ્વતંત્ર છે અને વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ સજ્જવ માનવી પરતંત્ર હોય છે અને તેને કશું વ્યક્તિત્વ નથી હોતું.

અને એવી હાલતની નાબૂદીને મૂડીદાર વ્યક્તિત્વ તથા આજાદીની નાબૂદી ગણ્યાવે છે! તેની વાત ખરી છે. મૂડીવાદી વ્યક્તિત્વની, મૂડીવાદી સ્વતંત્રતાની, અને મૂડીવાદી આજાદીની નાબૂદી નિઃરંક લક્ષ્યાંકિત છે.

ઉત્પાદનના વર્તમાન મૂડીવાદી સંજોગોમાં આજાઈનો અર્થ મુક્ત વ્યાપાર, મુક્ત વેચાણ તથા ખરીદી, કરવામાં આવે છે.

પરંતુ વેચાણ અને ખરીદી અહૃષ્ય થઈ જય તો મુક્ત વેચાણ તથા ખરીદી પણ અહૃષ્ય થઈ જય. મુક્ત ખરીદી તથા વેચાણની આવી વાતોનો, અને સામાન્ય રૂપે આજાઈ સંબંધી મૂડીદાર વર્ગના બીજા બધા “બહાદુરીભર્યા દેકારા”નો, કશો અર્થ હોય તો મર્યાદિત વેચાણ તથા ખરીદીની સરખામણીમાં છે, મધ્યયુગના જકડાયેલા વેપારીઓની સરખામણીમાં છે. ખરીદી તથા વેચાણની, ઉત્પાદનના મૂડીવાદી સંજોગોની, અને ઝુદ મૂડીદાર વર્ગની સામ્યવાદી નાબૂદીના વિરોધમાં તેનો કશો અર્થ નથી.

ખાનગી મિલકતને નાબૂદ કરી નાખવાના અમારા ઈરાદાથી તમે ત્રાસ પામો છો. પરંતુ તમારા વર્તમાન સમાજમાં નેવું ટકા વસતિ માટે તો ખાનગી મિલકત ક્યારની નાબૂદ થઈ ચૂકી છે, અને થોડાક માણસો માટે તેની હ્યાતીનું એકમાત્ર કારણ એ નેવું ટકાના હાથમાં તેની બિનહ્યાતી જ છે. એટલે, તમે અમને મિલકતના એવા રૂપની નાબૂદીના ઈરાદા બદલ ધમકાવો છો કે નેની હ્યાતીની આવશ્યક શરત સમાજની પ્રચંડ બહુસંખ્યા માટે કશી મિલકતની બિનહ્યાતી છે.

ટૂકમાં, તમે અમને તમારી મિલકત નાબૂદ કરી નાખવાના ઈરાદા બદલ ધમકાવો છો. વાત ચોક્કસ એમ જ છે, અમારો ઈરાદો એવો જ છે.

તમે કહો છો કે ને ઘડીથી મહેનતને મૂડી, નાણું, અથવા સાંથમાં પલટાવવાનું શક્ય ન રહે, નેની ઉપર ઈજારો જમાવી શકાય એવી સામાજિક તકાતમાં પલટાવવાનું શક્ય ન રહે, અર્થાત् ને ઘડીથી વ્યક્તિગત મિલકતને મૂડીવાદી મિલકતમાં, મૂડીમાં, રૂપાંતરિત કરવાનું શક્ય ન રહે, તે ઘડીથી વ્યક્તિત્વ અહૃષ્ય થઈ જય છે.

એટલે તમારે એકરાર કરી કેવો જોઈએ કે તમારી નજરમાં “વ્યક્તિ”નો અર્થ બીજું કોઈ નહિ પણ મૂડીદાર છે, મિલકતનો મધ્યમ વર્ગીય માલિક છે. એવા માણસને તો ખરેખર હઠાવી દેવો જોઈએ, તેની હ્યાતી અશક્ય બનાવી દેવી જોઈએ.

સામ્યવાદ કોઈ પણ ઈન્સાનને સમાજની પેદાશોની માલિકી ધરાવવાની શક્તિથી વંચિત નથી કરતો, એ તો ફક્ત એવી માલિકી મારફત બીજાની મહેનતનો ફાયદો ઉદ્ઘાવવાની શક્તિથી તેને વંચિત કરે છે.

એવો વાંધો ઉદ્ઘાવવામાં આવ્યો છે કે ખાનગી મિલકતની નાબૂદીથી તમામ કામ બંધ થઈ જશે અને આપણે સાર્વત્રિક પ્રમાદના ભોગ બની જઈશું.

એવી દલીલ મુજબ તો મૂડીવાદી સમાજ નર્યા પ્રમાણે લીધે લાંબા વખત પહેલાં તારાજ થઈ ગયો હોત, કારણ કે તેના જે સભ્યો કામ કરે છે તેમને કશું જ નથી મળતું, અને જેમને કંઈક મળે છે તેઓ કામ નથી કરતા. આ આખો વાંધો એવી પુનરુક્તિનું જ એક વધુ ઉદાહરણ છે કે મૂડી ન રહે ત્યારે કોઈ જતની રોજ-મજૂરી પાણું ન જ રહે.

ભૌતિક પેદાશોના ઉત્પાદન તથા માલિકીની સામ્યવાદી રીત સામે ઉઠાવવામાં આવેલા બધા વાંધા ભૌદ્ધિક પેદાશોના ઉત્પાદન અને માલિકીની સામ્યવાદી રીત સામે પણ ઉઠાવવામાં આવ્યા છે. મૂડીદારની નજરમાં જેવી રીતે વર્ગ મિલકતની નાભૂદી ખુદ ઉત્પાદનની નાભૂદી છે, એવી જ રીતે તેની નજરમાં વર્ગ સંસ્કૃતિની નાભૂદી સમગ્ર સંસ્કૃતિની નાભૂદી જેડે એકરૂપ છે.

જેની નાભૂદીનો તેને અફ્સોસ છે એ સંસ્કૃતિ પ્રચંડ બહુસંખ્યા માટે તો કેવળ યંત્રવત् કામગીરીની તાલીમ જ છે.

પરંતુ મૂડીવાદી મિલકતની અમારી વાંછિત નાભૂદીને તમે આગાદી, સંસ્કૃતિ, કાનૂન, વગેરે સંબંધી તમારા મૂડીવાદી ખયાલોનું ધોરણ લાગુ કરતા રહો ત્યાં સુધી અમારી જેડે દલીલબાજી ન કરશો. જેવી રીતે તમારું કાયદાશાસ્ક સૌને માટે કાનૂન બનાવી દેવામાં આવેલી તમારા વર્ગની મરજી જ છે, તમારા વર્ગની હયાતીના આર્થિક સંઝેગો જેનું તાત્ત્વિક સ્વરૂપ તથા દિશા નિર્ધારિત કરે છે એવી મરજી જ છે, એવી જ રીતે તમારા ખુદ વિચારો તમારા મૂડીવાદી ઉત્પાદન તથા મૂડીવાદી મિલકતના સંઝેગોમાંથી જ કૂટી નીકળેલા છે.

વર્તમાન સમયે તમારી ઉત્પાદનની રીત અને મિલકતના રૂપમાંથી કૂટી નીકળતાં સામાન્યિક રૂપોને—ઉત્પાદનની પ્રગતિ દરમિયાન ઉદ્ય પામતા અને અદૃશ્ય થઈ જતા ઐતિહાસિક સંબંધોને—પ્રકૃતિના તથા તર્કના સનાતન નિયમોમાં રૂપાંતરિત કરી દેવા તમને લલચાવતી ગેરસમજમાં તમે તમારા પુરોગામી પ્રત્યેક શાસક વર્ગના સહભાગી છો. પ્રાચીન મિલકતની બાબતમાં તમે જે સ્પષ્ટ જેઈ શકો છો, સામંતી મિલકતની બાબતમાં તમે જેનો એકરાર કરો છો, તેને મિલકતના તમારા પોતાના મૂડીવાદી રૂપની બાબતમાં કબૂલ કરી બેવાની બેશક તમને મનાઈ છે.

પરિવારની નાભૂદી! કોમ્યુનિસ્ટોની આ બદનામ દરખાસ્ત સાંભળીને તો આમૂલું પરિવર્તનના કટૂર હિમાયતીઓ પણ છંછેડાઈ જય છે.

વર્તમાન પરિવાર, મૂડીવાદી પરિવાર, કેવા પાયા ઉપર આધારિત છે? મૂડી ઉપર, ખાનગી ફાયદા ઉપર. આ પરિવાર સંપૂર્ણ વિકસિત રૂપમાં તો કેવળ

મૂડીદાર વર્ગની અંદર જ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ પરિસ્થિતિના પૂરક સંભેગો સર્વહારાઓની અંદર પરિવારના વાસ્તવિક અભાવમાં તથા જહેર વેશ્યાપ્રથામાં જેવા મળે છે.

મૂડીવાદી પરિવારના પૂરક સંભેગો અદૃશ્ય થઈ જશે ત્યારે મૂડીવાદી પરિવાર આપમેળે અદૃશ્ય થઈ જશે, અને મૂડી અદૃશ્ય થઈ જતાં એ બેઠ અદૃશ્ય થઈ જશે.

માબાપના હાથે બાળકોના શોષણને અટકાવવાની મુરાદ ધરાવવાનો આરોપ તમે અમારી ઉપર લગાવી રહ્યા છો? અમે એ ગુનો કબૂલ કરી લઈએ છીએ.

પરંતુ તમે કહેશો કે ધરની કેળવાણીને સ્થાને સામાજિક રૂપની કેળવણી દાખલ કરીને અમે અત્યારે પુનિત સંબંધને નષ્ટ કરી નાખીએ છીએ.

અને તમારી કેળવાણી! એ પણ શું સામાજિક નથી? તમે જેવા સંભેગોમાં કેળવણી આપો છો એ સામાજિક સંભેગો શું તેને નિર્ધારિત નથી કરતા? શાળાઓ વગેરે મારફત સમાજની સીધી અથવા આડકતરી દખલગીરી શું તેને નિર્ધારિત નથી કરતી? કેળવણીમાં સમાજની દખલગીરીને કોમ્પ્યુનિસ્ટોએ નથી ઉપજવી કાઢો. તેઓ તો ફક્ત એ દખલગીરીના સ્વરૂપમાં ફેરફાર કરવાની જ, અને કેળવણીને શાસક વર્ગના પ્રભાવથી છુટકારો અપાવવાની જ, કોશિશ કરે છે.

આધુનિક ઉદ્યોગની કિયાના પરિણામે સર્વહારાઓની અંદર પારિવારિક સંબંધોના જેમ જેમ વધારે ભુક્કા ઉડતા જાય છે, અને તેમનાં બાળકો વાણિજ્યની સાચી વસ્તુઓમાં તથા શ્રમનાં સાધનોમાં પલટાતાં જાય છે, તેમ તેમ પરિવાર તથા કેળવણી અંગેનાં, માવતર અને સંતાન વચ્ચે પુનિત સંબંધ અંગેનાં, પોકળ મૂડીવાદી ગુણગાન વધારે ધૂણાસપદ બનતાં જાય છે.

પણ તમે કોમ્પ્યુનિસ્ટો ખીઓને સૌની સહિયારી બનાવી દેશો—આખો મૂડીદાર વર્ગ એક અવાજે ગરજ ઉઠે છે.

મૂડીદારની નજરમાં તેની પત્ની કેવળ ઉત્પાદનનું સાધન હોય છે. તેને સાંભળવા મળે છે કે ઉત્પાદનનાં સાધનોનો ઉપયોગ સહિયારો કરવામાં આવશે, એટલે સ્વાભાવિક રીતે જ તે એવા નતીજા પર પહોંચી જાય છે કે ખીઓ પણ સૌની સહિયારી બની જવાની દશામાં ધકેલાઈ જશે.

તેને ખયાલ પણ નથી આવતો કે હક્કિતમાં લક્ષ્ય ખીઓના કેવળ ઉત્પાદનનાં સાધનો તરીકેના દરજાને નાભૂદ કરી નાખવાનું છે.

બાકી તો, કોમ્યુનિસ્ટો ખુલ્લાંખુલ્લા અને સત્તાવાર રીતે ખીઓને સૌની સહિયારી બનાવી દેવાના છે એવો ઢોગ કરતા આપણા મૂડીદારના સદાચારી રોપ કરતાં વધારે હાસ્યાસ્પદ બીજું કશું નથી. ખીઓને સૌની સહિયારી બનાવી દેવાની કશી જરૂર કોમ્યુનિસ્ટોને નથી, એવી હાલત તો લગભગ સદાકાળથી હથાત છે.

આપણા મૂડીદારોને એટલેથી સંતોષ નથી કે તેમના સર્વહારાઓની પત્નીઓ તથા પુત્રીઓ તેમની તાબેદારીમાં હોય છે — સાધારણ વેશ્યાઓની તો વાત જ રહેવા દઈએ — એટલે તેઓ એકબીજાની પત્નીઓ જોડે બેહદ મોજથી વિલાસ માણે છે.

મૂડીવાદી લગ્ન વાસ્તવમાં સહિયારી પત્નીઓની પ્રથા છે. એટલે કોમ્યુનિસ્ટોની ઉપર વધારેમાં વધારે તો એટલો જ આક્ષેપ મૂકી શકાય કે ખીઓને દંભી રીતે અને પડા પાછળ સૌની સહિયારી રાખવાને બદલે તેઓ એવી હાલત ખુલ્લી અને કાનૂની રીતે દાખલ કરવા માગે છે. બાકી તો આપમેણે સ્પષ્ટ છે કે ઉત્પાદનની વર્તમાન પદ્ધતિની નાભૂદીની સાથે સાથે, એ પદ્ધતિમાંથી જ પેદા થયેલી હાલત — ખીઓ સૌની સહિયારી હોવાની હાલત — નાભૂદ થઈ જશે, અર્થાત् જહેર તથા ખાનગી બન્ને પ્રકારની વેશ્યાપ્રથા નાભૂદ થઈ જશે.

વધુમાં કોમ્યુનિસ્ટોની ઉપર દેશો તથા રાષ્ટ્રીયતાને નાભૂદ કરી નાખવાની મુરાદ ધરાવવાનો આક્ષેપ લગાવવામાં આવે છે.

કામદાર ઈન્સાનોને કોઈ દેશ નથી. તેમની પાસે જે જ નહિ તેને આપણે તેમની કનેથી છીનવી ન શકીએ. સર્વહારા વર્ગને સૌપ્રથમ રાજકીય સર્વોપરીતા હાંસલ કરવાની છે, રાષ્ટ્રનો અગ્રિમ વર્ગ બનવાનું છે, પોતે રાષ્ટ્ર બની રહેવાનું છે, એટલે તે હજુ સુધી રાષ્ટ્રીય છે — જોકે શબ્દના મૂડીવાદી અર્થમાં નહિ.

મૂડીદાર વર્ગનો વિકાસ, વાણિજ્યની આજાદી, વિશ્વ બજાર, ઉત્પાદનની રીતની એકરૂપતા અને તેને અનુરૂપ જીવનસંભેગોને લીધે પ્રજાઓ વર્ચેના રાષ્ટ્રીય લેદભાવ તથા વેરભાવ દરરોજ વધારે ને વધારે પ્રમાણમાં અદૃશ્ય થઈ રહ્યા છે.

સર્વહારા વર્ગની સર્વોપરીતાને પરિણામે તેઓ વધારે જડપથી અદૃશ્ય થવા લાગશે. સર્વહારા વર્ગની મુક્તિની પ્રથમ શરતોમાંની એક છે — બીજા નહિ તો અગ્રિમ સભ્ય દેશોનું સંયુક્ત કરન્ન.

એક ઈન્સાનના હાથે બીજા ઈન્સાનના શોધણુંને જેટલા પ્રમાણમાં ખતમ કરી નાખવામાં આવે એટલા પ્રમાણમાં એક રાષ્ટ્રના હાથે બીજા રાષ્ટ્રના શોધણુંને પણ ખતમ કરવામાં આવશે.

રાષ્ટ્રની અંદર વર્ગો વર્ચ્યેનો વેરભાવ જેટલા પ્રમાણમાં અદૃશ્ય થઈ જશે એટલા પ્રમાણમાં એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્ર પ્રત્યેની દુશ્મનાવટ ખતમ થઈ જશે.

ધાર્મિક, દાર્શનિક, અને સામાન્ય રૂપે વૈચારિક દૃષ્ટિઓ સામ્યવાદની ઉપર લગ્નવવામાં આવતા આક્ષેપો ગંભીર પરીક્ષણને લાયક નથી.

એટલું સમજવા માટે શું ઊંડી અંતરદૃષ્ટિની જરૂર છે ખરી કે માનવીના ભૌતિક અસ્થિત્વના સંઝેગોમાં, તેના સામાજિક સંબંધો તથા સામાજિક જીવનમાં, થતા પ્રત્યેક પરિવર્તનની સાથે સાથે, તેના વિચારોમાં, મંતવ્યોમાં, તથા ધારણાઓમાં, ટૂંકમાં કહીએ તો માનવીની આંતરપ્રતીતિમાં, પરિવર્તન થાય છે.

ભૌતિક ઉત્પાદનમાં જેટલા પ્રમાણમાં પરિવર્તન થાય એટલા પ્રમાણમાં બૌદ્ધિક ઉત્પાદનમાં પરિવર્તન થાય છે—વિચારોનો ઈતિહાસ એ સિવાય બીજું શું સાબિત કરે છે? પ્રત્યેક યુગમાં તેના શાસક વર્ગના જ વિચારો હંમેશાં વર્યસ્વ ધરાવતા રહ્યા છે.

જ્યારે લોકો સમજનમાં કાંતિ આણનારા વિચારોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેઓ કેવળ એ હકીકતને જ વ્યક્ત કરતા હોય છે કે પુરાણા સમજની અંદર નવા સમજનાં તર્ફાનું સર્જન થયું છે, અને જિંદગીના પુરાણા સંઝેગો જેમ જેમ ખતમ થતા જાય છે તેમ તેમ એકધારા એટલા જ પ્રમાણમાં પુરાણા વિચારો પણ ખતમ થતા જાય છે.

પ્રાચીન દુનિયા છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે જ્યુસ્ટી ધર્મ પ્રાચીન ધર્મોની ઉપર ફૂટેથ હાંસલ કરી. અદારમી સદ્ગીમાં તર્કપ્રમાણેવાદી વિચારોની સામે જ્યુસ્ટી વિચારો પરાજિત થઈ ગયા ત્યારે સામંતી સમાજ એ વખતના કાંતિકારી મૂડીદાર વર્ગની સામે પોતાના મોતનો જંગ લડી રહ્યો હતો. ધાર્મિક સ્વતંત્રતા અને અંતરાત્માની આજાદીના વિચારોએ તો જ્ઞાનના ક્ષેત્રમાં હરીકૃષ્ણના અમલને કેવળ વ્યક્ત જ કર્યો હતો.

એવી દલીલ કરવામાં આવશે કે “ઐતિહાસિક વિકાસ દરમિયાન ધાર્મિક, નીતિનિયમો સંબંધી, દાર્શનિક, તથા કાનૂનો સંબંધી વિચારોમાં પરિવર્તન આવ્યું છે. પરંતુ ધર્મ, નીતિનિયમો, ફિલ્મ્સ્ફિસ્ટ, રાજકીય વિજ્ઞાન, તથા ધારાધોરણો એવા પરિવર્તન છિતાં નિરંતર ટકી રહ્યાં જ છે. વળી આજાદી, ઈન્સાહ, વગેરે

નેવાં સનાતન તથ્યો તો સમાજની તમામ અવસ્થાઓમાં સર્વસામાન્ય રહ્યાં છે. પરંતુ સામ્યવાદ સનાતન તથ્યોને નવા આધારે સ્થાપવાને બદલે નાભૂદ કરી નાખે છે, સમગ્ર ધર્મ તથા સમગ્ર નીતિનિયમોને નાભૂદ કરી નાખે છે. એટલે તે ભૂતકાળના સમગ્ર ઔતિહાસિક અનુભવની વિરુદ્ધ કામગીરી કરે છે.”

આ આક્ષેપનો સાર શો છે? વીતી ગયેલા સમગ્ર સમાજનો ઈતિહાસ વગ્રો વર્ણયેના અંટસોના વિકાસમાં સમાયેલો છે. વિવિધ યુગોમાં એ અંટસોએ વિવિધ રૂપો અભિત્યાર કર્યાં છે.

પરંતુ તેમોનાં રૂપ ગમે એવાં રહ્યાં હોય તોયે એક હકીકત, અર્થાતું સમાજના એક ભાગના હાથે બીજ ભાગનું શોષણ, વીતેલા તમામ યુગોમાં સર્વસામાન્ય રહી છે. એટલે કશા અચરજની વાત નથી કે વીતેલા યુગોની સામાજિક ચેતના બહુલતા તથા અનેકવિધતા પ્રદર્શિત કરતી હોવા છતાં, તે અમુક સામાન્ય રૂપોની અંદર, અથવા સામાન્ય વિચારોની અંદર, ફરતી રહી છે, ને વગ્રો વર્ણયેના અંટસોની તદ્દન નાભૂદી વગર પૂર્ણ રૂપે અદૃશ્ય ન થઈ શકે.

સામ્યવાદી કાંતિ પરંપરાગત મિલકત સંબંધો જેડે તદ્દન મૂળગામી વિચછેદ છે, એટલે કશા આશ્ર્યની વાત નથી કે તેના વિકાસમાં પરંપરાગત વિચારો જેડેનો તદ્દન મૂળગામી વિચછેદ સમાવિષ્ટ છે.

પરંતુ આપણે સામ્યવાદ સામેના મૂડીવાદી વાંધાઓની વાત અહોયાં પૂરી કરીએ.

આપણે ઉપર જોઈ ગયા કે કામદાર વર્ગની કાંતિનું પહેલું કદમ સર્વહારા વર્ગની ઉન્નતિ સાધીને તેને શાસક વર્ગ બનાવી દેવાનું છે, લોકશાહી માટેની લડત જીતી લેવાનું છે.

સર્વહારા વર્ગ પોતાની સર્વોપરીતાનો ઉપયોગ મૂડીદાર વર્ગના હાથમાંથી ધીરે ધીરે તમામ મૂડી છીનવી વેવા માટે કરશે, ઉત્પાદનનાં તમામ સાધનોને રાજ્ય હસ્તક, અર્થાતું શાસક વર્ગ તરીકે સંગઠિત સર્વહારા વર્ગના હાથમાં, કેંદ્રીત કરવા માટે કરશે, ઉત્પાદક પરિબળોના સંચયમાં બને એટલી ઝડપે વૃદ્ધિ કરવા માટે કરશે.

શરૂઆતમાં એ કામગીરી મિલકતના અધિકારો ઉપર તથા મૂડીવાદી ઉત્પાદનના સંઝેગો ઉપર જુલ્દી તરાપોનાં કદમો સિવાય બીજ કોઈ રીતે બેશક ન જ થઈ શકે; એટલે આર્થિક દૃષ્ટિએ અપૂરતાં તથા અસંગીન લાગે પરંતુ આંદોલન દરમિયાન વિકાસ પામીને પોતાની સીમાઓને વટાવી જાય, પુરાણી

સામાજિક વ્યવસ્થાની ઉપર નવી તરાપો આવશ્યક બનાવે, અને ઉત્પાદનની રીતમાં ધરમૂળથી કાંતિ આણવાના ઉપાય તરીકે અનિવાર્ય હોય, એવાં કદમો સિવાય બીજી કોઈ રીતે ન જ થઈ શકે.

એ કદમો વિવિધ દેશોમાં બેશક વિભિન્ન હશે.

તેમ છતાં, સૌથી ઉન્નત દેશોમાં નીચેનાં કદમો સારા પ્રમાણમાં સામાન્ય રૂપે લાગુ થઈ શકશે:

૧. જમીનની માલિકીની નાભૂદી અને જમીનની સમગ્ર સાંથનો સાર્વજનિક હેતુઓ માટે ઉપયોગ.

૨. વૃદ્ધિશીલ અથવા સોપાનબદ્ધ ભારે આપકવેરો.

૩. વારસાના બધા અધિકારોની નાભૂદી.

૪. પરદેશ વસવા જતા તમામ માણસો તથા તમામ બળવાખોરોની મિલકતની જાતી.

૫. રાજ્યની મૂડી તથા સંપૂર્ણ ઈજારદારી ધરાવતી રાષ્ટ્રીય બોંક મારફત, ધિરાણનું રાજ્યને હસ્તક કેંદ્રીકરણ.

૬. સંદેશવ્યવહાર તથા વાહનવ્યવહારનું રાજ્યને હસ્તક કેંદ્રીકરણ.

૭. રાજ્યની માલિકીનાં કારખાનાં તથા ઉત્પાદનનાં સાધનોનું વિસ્તરણ, પડતર જમીનમાં જેતી અને સર્વસામાન્ય યોજના મુજબ સમગ્ર જમીનમાં સુધારણા.

૮. મહેનત કરવાની સૌની સરખી જવાબદારી. ઔદ્યોગિક સૈન્યોની સ્થાપના, ખાસ કરીને જેતીવાડી માટે.

૯. ઉદ્યોગો સાથે જેતીવાડીનો સમન્વય, દેશમાં વસતિની સરખી વહેંચણી મારફત શહેર અને ગામ વચ્ચેના બેદની ધીરે ધીરે નાભૂદી.

૧૦. સાર્વજનિક શાળાઓમાં તમામ બાળકોને મફત શિક્ષણ. કારખાનાંમાં વર્તમાન રૂપની બાળમજૂરીની નાભૂદી. ઔદ્યોગિક ઉત્પાદન જેઠે શિક્ષણનો સમન્વય, વગેરે.

વિકાસ દરમિયાન વર્ગબેદો અદૃશ્ય થઈ જાય, અને સમગ્ર ઉત્પાદન સમગ્ર રાષ્ટ્રના વિશાળ સંઘટનને હસ્તક કેંદ્રીત થઈ જાય, ત્યારે જહેર સત્તાનું રાજકીય સ્વરૂપ ખતમ થઈ જશે. યોગ્ય રીતે જ રાજકીય સત્તા કહેવાતી સત્તા તો એક વર્ગનું પીડન કરવા માટે બીજા વર્ગની સંગઠિત સત્તા જ છે. મૂડીદાર વર્ગના સંઘર્ષ દરમિયાન સર્વહારા વર્ગને સંજોગોના દખાણને કારણે પોતાનું એક વર્ગ તરીકે સંગઠન સાધવું પડે, કાંતિ કરીને તે પોતાને શાસક વર્ગ બનાવી હે, અને

શાસક વર્ગ તરીકે જેર વાપરીને ઉત્પાદનના પુરાણા સંજોગોને ખતમ કરી નાખે, તો એ સંજોગોની સાથે સાથે, વર્ગો વર્ચ્યેના અંટસોના તથા સામાન્ય રૂપે વર્ગોના અસ્તિત્વ માટેના સંજોગોને ખતમ કરી નાખશે, અને એ રીતે વર્ગ તરીકેની પોતાની સવોપરીતાને ખતમ કરી નાખશે.

વર્ગો તથા વર્ગો વર્ચ્યેના અંટસો ધરાવતા પુરાણા મૂડીવાદી સમાજને સ્થાને આપાણને ઓણું સહજીવન સાંપડશે કે જેમાં દરેકનો મુક્ત વિકાસ સૌના મુક્ત વિકાસની શરત બની રહેશે.

૩. સમાજવાદી અને સામ્યવાદી સાહિત્ય

૧. પ્રત્યાધાતો સમાજવાદ

ક. સામંતી સમાજવાદ

ફ્રાંસ અને ઈંગ્લેઝના ઉમરાવ વર્ગાની ઐતિહાસિક સ્થિતિને કારણે, આધુનિક મૂડીવાદી સમાજની વિરુદ્ધ પુસ્તિકાઓ લખવાનો તો જાણે તેઓનો વ્યવસાય થઈ ગયો. ૧૮૩૦ના જુલાઈની ફ્રેંચ કાંતિમાં તથા ઈંગ્લેઝના સુધારા આંદોલનમાં^{૨૭}, એ ઉમરાવ વર્ગ ફરી પાછા તિરસ્કૃત નવા તાલેવરોના હાથે પરાજિત થઈ ગયા. ત્યાર પછી ગંભીર રાજકીય સંઘર્ષનો તો મુદ્દલ સવાલ જ ન રહ્યો. કેવળ સાહિત્યિક લડાઈ જ શક્ય રહી. પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં પણ પુનરુત્થાનના જમાના* ની પુરાણી હાકલો અશક્ય બની ગઈ હતી. હમદર્દી જગાવવાના ઈરાદે ઉમરાવ વર્ગને દેખીતી રીતે તો પોતાનાં હિતો પડતાં મૂકૃવાં પડ્યાં, અને મૂડીદાર વર્ગની વિરુદ્ધ પોતાનું તહોમતનામું માત્ર શોષિત કામદાર વર્ગના હિતમાં ઘડવું પડ્યું. એ રીતે ઉમરાવ વર્ગ પોતાના નવા માલિકની નિંદાનાં ગીત ગાઈને તથા તેના કાનમાં આગામી આકૃતની અનિષ્ટ આગાહીઓ ગણગણીને વેર લીધું.

એ રીતે સામંતી સમાજવાદનો ઉદ્ય થયો— અરધાં રોદણાં, અરધી કૂથલી, અરધો ભૂતકાળનો પડ્યો, અરધી ભાવિની દહેશત; ક્યારેક કટુ, ચનુરાઈભરી, અને વેધક ટીકા વડે મૂડીદાર વર્ગના દિલના છેક ઊંડપણમાં ધા કરતો; પરંતુ આધુનિક ઈતિહાસની આગેકૂચને સમાજવાની તદ્દન અશક્યિતને કારણે હુમેશાં હાસ્યાસ્પદ અસર પેદા કરતો.

જનતાનો ટેકો હાંસલ કરવાના ઈરાદે ઉમરાવ વર્ગ સર્વહારાની બિક્ષાજોળીને ઝંડા તરીકે મોખરે ગોઢવી. પરંતુ લોકો તેની ભેગા ભણે કે તરત જ તેની પૂછે

* ૧૬૬૦થી ૧૬૮૮નો ઈંગ્લેઝનો પુનરુત્થાનનો જમાનો નહિ પણ ૧૮૧૪થી ૧૮૩૦નો ફ્રાંસનો પુનરુત્થાનનો જમાનો. (૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

પુરાણાં સામંતી કુળચિહ્નો જોઈને તુચ્છકારના ભાવે ખડખડાટ હસતા પાછા રહાના થઈ જતા.

ફેંચ લેન્જિટિમિસ્ટોના એક વિભાગની તથા ‘તગુણ ઈંગ્લેઝ’³⁰ ની બાબતમાં એવા તમારા થયા હતા.

સામંતશાહીવાદીઓ શોધણની તેમની અને મૂડીદાર વર્ગની રીત વચ્ચેનો તફાવત બતાવતી વેળા ભૂલી જાય છે કે તેઓ તદ્દન જુદા સંજોગો તથા પરિસ્થિતિમાં શોધણ ચલાવતા હતા. એ સંજોગો અને પરિસ્થિતિ હવે કાલગ્રસ્ત બની ગયાં છે. તેમના શાસનમાં આધુનિક સર્વહારા વર્ગનું અસ્તિત્વ જ નહોનું એ હકીકત બતાવતી વેળા તેઓ ભૂલી જાય છે કે આધુનિક મૂડીદાર વર્ગ સમાજના તેમના પોતાના રૂપની આવશ્યક પેદાશ છે.

બાકી તો તેઓ પોતે જે ટીકા કરે છે તેના પ્રત્યાઘાતી સ્વરૂપને એટલું ઓછું છાનું રાખે છે કે મૂડીદાર વર્ગની સામે તેમનો મુખ્ય આરોપ આ મુજબ છે — મૂડીવાદી અમલમાં એક વર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં સમાજની પુરાણી વ્યવસ્થાને જગ્મણથી ઉત્થેડી નાખવાનો છે.

તેઓ મૂડીદાર વર્ગને ધ્યાબે છે તે એટલા માટે નહિ કે મૂડીદાર વર્ગ સર્વહારા વર્ગનું સર્જન કરે છે, પણ એટલા માટે કે કાંતિકારી સર્વહારા વર્ગનું સર્જન કરે છે.

એટલે અમલી રાજકારણમાં તેઓ કામદાર વર્ગની વિરુદ્ધ બળજબરીનાં તમામ કદમોમાં સાથ આપેછે, અને ભવ્ય વાગાહંબર કરતા હોવા છતાં, સાધારણ નિંદગીમાં તો ઉદ્યોગના ઝાડ ઉપરથી પડેલાં સોનાનાં સફરજન નીચા નમીને વીણું લે છે તથા ઉન, બીટની ખાંડ, તેમ જ બટાકના દારૂના વેપાર માટે સત્ય, પ્રેમ, અને પ્રતિષ્ઠાના સોદા કરી નાખે છે.*

જેવી રીતે પાદરી હમેશાં ઉમરાવના સંગાથમાં રહ્યો છે એવી જ રીતે પાદરીઓનો સમાજવાદ હમેશાં સામંતી સમાજવાદના સંગાથમાં રહ્યો છે.

* આ બાબત મુખ્યને જર્મનીને લાગુ પડે છે જ્યાં જગીરો ધરાવતા ઉમરાવો તથા પાટીદારો પોતાની જગીરોના વિશાળ હિસ્સાઓમાં પોતાને હિસાબે કારબારીઓ મારફત ખેતી કરાવે છે, અને તે ઉપરાંત વિસ્તૃત પ્રમાણમાં બીટની ખાંડ બનાવવાના તથા બટાકનો દારૂ ગાળવાના ધંધા કરે છે. વધારે દોહતમંદ બ્રિટિશ ઉમરાવો હજુ એવી કક્ષાથી ઉપર રહ્યા છે, પરંતુ તેઓ પણ જ્યે છે કે વધુ યા ઓછી લેઈમાન જોઈનટ સ્ટોક કંપનીઓ ચાલુ કરનારાઓને પોતાના નામનો ઉપયોગ કરવા દઈને, ધર્તી જતી સાંથની ખોટ કેવી રીતે પૂરી કરી લેવી. (૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં એગેલ્સની નોંધ.)

ખ્રિસ્તી વૈરાગ્યવૃત્તિને સમાજવાદી રંગે રંગવા કરતાં વધારે સહેલું બીજું કશું નથી. ખ્રિસ્તી ધર્મે ખાનગી મિલકતની વિરુદ્ધ, લગ્નની વિરુદ્ધ, રાજ્યની વિરુદ્ધ, બરાડા નથી પાડ્યા? તેને બદલે દાનવૃત્તિ તથા ગરીબીના જીવનનો, ભ્રષ્ટચયર્થ તથા દેહદમનનો, મઠજીવનનો તથા દેવળમાં ભક્તિનો ઉપદેશ તેણે નથી આપ્યો? ખ્રિસ્તી સમાજવાદ તો કેવળ પવિત્ર જળ છે જેના વડે પાદરી ઉમરાવના હેયાબણાપા ટાઢા પાડે છે.

ખ. નિમ્ન-મૂડીવાદી સમાજવાદ

જેને મૂડીદાર વર્ગ પાયમાલ કરી નાખ્યો હોય, આધુનિક મૂડીવાદી સમાજના વાતાવરણમાં જેના અસ્તિત્વના સંજેંગો ક્ષીય થતા ગયા હોય અને ખતમ થઈ ગયા હોય, એવો વર્ગ સામંતી ઉમરાવ વર્ગ એકલો જ નથી. મધ્યયુગીન નગરવાસીઓ તથા નાના કિસાન માલિકો આધુનિક મૂડીદાર વર્ગના અગ્રદૂતો હતા. ઉદ્યોગ તથા વાણિજ્યની દૃષ્ટિએ બહુ ઓછા વિકસિત દેશોમાં એ બે વર્ગો ઉંગતા મૂડીદાર વર્ગની જોડાએ હજુ મુડદાલ હ્યાતી ટકાવી રહ્યા છે.

જ્યાં આધુનિક મૂડીવાદનો પૂરો વિકાસ થયો છે એવા દેશોમાં નિમ્ન-મૂડીવાદીનો એક નવો વર્ગ રચાયો છે. એ વર્ગ હંમેશાં સર્વહારા વર્ગ તથા મૂડીદાર વર્ગની વચ્ચે ડગુમગુ રહે છે, અને મૂડીવાદી સમાજના પૂરક ભાગ તરીકે નિરંતર નવેસરથી બનતો રહે છે. પરંતુ એ વર્ગના વ્યક્તિગત સભ્યો હરીકાઈના પરિણામે સતત સર્વહારા વર્ગમાં ફેંકાતા જાય છે, અને જેમ જેમ આધુનિક ઉદ્યોગનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેઓ એવી ઘડીને સમીપ આવતી પણ જોઈ શકે છે કે જ્યારે તેઓ આધુનિક સમાજના એક સ્વતંત્ર વિભાગ તરીકે તદ્દન અદૃશ્ય થઈ જશે, અને ઉદ્યોગોમાં, જેતીમાં, તથા વાણિજ્યમાં તેમનું સ્થાન જેબરો, કારભારીઓ, તથા ગુમાસ્તાઓ લઈ લેશે.

ફ્રાંસ જેવા દેશોમાં કે જ્યાં વસતિનો અરધા કરતાં વધારે હિસ્સો કિસાનોનો છે, ત્યાં સ્વાભાવિક હતું કે મૂડીદાર વર્ગની સામે સર્વહારા વર્ગનો પક્ષ વેનારા વેખકો મૂડીવાદી અમલની પોતાની ટીકામાં કિસાન તથા નિમ્ન-મૂડીવાદીના ધોરણનો ઉપયોગ કરે, અને એ મધ્યવર્તી વર્ગોના દૃષ્ટિબંદુથી કામદાર વર્ગનું

જેશેલું સમર્થન કરે. એ રીતે નિમ્ન-મૂડીવાદી સમાજવાદનો ઉદ્ય થયો. સિસ્મોન્ટ્ટી³¹ કેવળ ફ્રાંસમાં નહિ પરંતુ ઈંગ્લેઝમાં પણ એવા વિચારપ્રવાહનો આગેવાન હતો.

સમાજવાદના એ વિચારપ્રવાહે આધુનિક ઉત્પાદનના સંજોગમાં હથાત આંતરવિરોધોનું અત્યંત સૂક્ષ્મ પૃથક્કરણ કર્યું. તેણે અર્થશાસ્ત્રીઓના દંભી ખુલાસાઓને ઉધાડા પાડ્યા. મશીનો તથા શ્રમ-વિભાજનની, થોડાક માણસોના હાથમાં મૂડી તથા જર્મીનના કેંદ્રીકરણની, અને અતિ-ઉત્પાદન તથા કટોકટીઓની વિનાશક અસરો તેણે નિર્વિવાદ રૂપે સાબિત કરી દીધી. નાના મૂડીદાર તથા કિસાનની અનિવાર્ય પાયમાલી, સર્વહારા વર્ગની કંગાલિયત, ઉત્પાદનમાં અરાજકતા, સંપત્તિની વહેંચણીમાં કારમી અસમાનતાઓ, રાષ્ટ્રો વરચે વિનાશક ઔદ્યોગિક લડાઈ, અને પુરાણાં નીતિબંધનો, પુરાણા કૌટુંબિક સંબંધો, તથા પુરાણી પ્રજાઓના વિઘટન પ્રયોગે તેણે નિર્દેશ કર્યો.

પરંતુ એ પ્રકારના સમાજવાદનાં રચનાત્મક લક્ષ્યોમાં કાં તો ઉત્પાદનનાં તથા વિનિમયનાં પુરાણાં સાધનોને અને તેની સાથે સાથે પુરાણા મિલકત સંબંધોને તથા પુરાણા સમાજને ફરી સ્થાપવાની આકંક્ષા રખાઈ છે, અથવા ઉત્પાદન તથા વિનિમયનાં આધુનિક સાધનોને પુરાણા મિલકત સંબંધોના—આધુનિક સાધનોને કારણે જે ખતમ થઈ ગયાં છે અને ચોક્કસ રૂપે ખતમ થઈ જવાનાં જ હતાં એ સંબંધોના—માળખામાં જકડી લેવાની આકંક્ષા રખાઈ છે. બન્ને દૃષ્ટિએ તે પ્રત્યાધાતી તેમ જ તરંગી છે.

તેના આખરી શબ્દો છે—ઔદ્યોગિક ઉત્પાદન માટે સામૂહિક ગિલ્ડો (મહાજનો), એતીવાડીમાં પિતૃશાસનના સંબંધો.

અંતમાં જ્યારે સંગીન ઔતિહાસિક હકીકતોએ આત્મવંચનાની તમામ કેદી અસરોને ખતમ કરી નાખી ત્યારે એ પ્રકારનો સમાજવાદ ગમગીનીની સખત આંચકીએ ખાતો ખતમ થઈ ગયો.

ગ. જર્મન અથવા “ખરો” સમાજવાદ

ફ્રાંસનું સમાજવાદી અને સામ્યવાદી સાહિત્ય, મૂડીદાર વર્ગની સત્તાના દબાણ હેઠળ સર્જયેલું સાહિત્ય, અને એ સત્તા સામેના સંધરને વ્યક્ત કરતું સાહિત્ય, જર્મનીમાં એવે વખતે દાખલ થયું કે જ્યારે એ દેશમાં સામંતી આપખુદશાહીની સામે મૂડીદાર વર્ગનો સંધર તાજે જ શરૂ થયો હતો.

જર્મન ક્લિબસૂઝો, નીમફિલસૂઝો, અને મનીધીઓએ એ સાહિત્યને ઉત્સાહપૂર્વક જડપી લીધું, પરંતુ તેઓ ભૂલી ગયા કે ફ્રાંસથી જર્મનીમાં આવેલાં

એ લખાણોની સાથે સાથે ફ્રાંસની સામાજિક પરિસ્થિતિ જર્મનીમાં નહોતી આવી. એ ફ્રેચ સાહિત્યનું સમગ્ર તાત્કાલિક અમલી મહત્વ જર્મન સામાજિક પરિસ્થિતિના સંપર્કમાં ખતમ થઈ ગયું, અને તેણે નિભેળ સાહિત્યક સ્વરૂપ ધારણું કરી લીધું. એ રીતે, અધારમી સંદીના જર્મન ફિલ્સ્ફૂઝની નજરમાં પ્રથમ ફ્રેચ કાંતિની માંગો સામાન્ય રૂપમાં “વ્યવહાર્ય તર્ક”ની “માંગોથી વધારે કશું જ નહોતું, અને કાંતિકારી ફ્રેચ મૂડીદાર વર્ગના સંકલ્પની અભિવ્યક્તિ તેમની નજરમાં શુદ્ધ સંકલ્પના, સંકલ્પ તો જેવો હોય જ એ સંકલ્પના, સામાન્ય રૂપે ખરા માનવીય સંકલ્પના, નિયમો અંકિત કરતી હતી.

જર્મન સાહિત્યકારોની સમગ્ર કામગીરી નવા ફ્રેચ વિચારોનો તેમના પ્રાચીન તત્ત્વજ્ઞાની અંતરાત્મા જેડે સુમેળ કરી વેવામાં જ, અથવા એમ કહીએ કે પોતાનું તત્ત્વજ્ઞાની દૃષ્ટિબન્દું તજ દીધા વગર ફ્રેચ વિચારોને તેમાં ઉમેરી દેવામાં જ, સમાયેલી હતી.

વિદેશી ભાષાની કૃતિઓને જેવી રીતે અનુવાદ મારફત પોતાની કરી વેવામાં આવે એવી જ રીતે એ ઉમેરણી થઈ હતી.

એ તો જાણીનું છે કે ખ્રિસ્તી ધર્મ પૂર્વના પ્રાચીન મૂર્તિપૂજાક લોકોની પ્રશિષ્ટ કૃતિઓની હસ્તપ્રતો ઉપર પાદરીઓ ક્રેચોલિક સંતોની બેવકૂફીભરી જીવનકથાઓ લખી લેતા. જર્મન સાહિત્યકારોએ ભ્રષ્ટ ફ્રેચ સાહિત્યની બાબતમાં એ કુમ ઊલટાવી નાખ્યો. મૂળ ફ્રેચ કૃતિઓની નીચે તેમણે પોતાનો તત્ત્વજ્ઞાની બજ્ઝવાદ લખી કાઢ્યો. દાખલા તરીકે, નાણાની આર્થિક કામગીરીઓની ફ્રેચ ટીકાની નીચે તેમણે “માનવતાનો પરિત્યાગ” લખ્યું, અને મૂડીવાદી રાજ્યની ફ્રેચ ટીકાની નીચે તેમણે “સામાન્યતાના પ્રકારનું પતન” લખ્યું, વગેરે.

ફ્રેચ એતિહાસિક ટીકાઓની પાછળ એવાં તત્ત્વજ્ઞાની વાક્યો લખી કાઢવાના કૃત્યને તેમણે “પ્રવૃત્તાની ફિલ્સ્ફૂઝી”, “ખરો સમાજવાદ”, “સમાજવાદનું જર્મન વિજ્ઞાન”, “સમાજવાદનો તત્ત્વજ્ઞાની આધાર”, વગેરે નામો આખ્યાં.

એ રીતે ફ્રેચ સમાજવાદી અને સામ્યવાદી સાહિત્યને તદ્દન સત્ત્વહીન બનાવી દેવામાં આવ્યું. અને જર્મન માણસના હાથમાં તે એક વર્ગની સામે બીજ વર્ગના સંઘર્ષનિ વ્યક્ત કર્યાં બંધ થઈ ગયું એટલે જર્મન માણસને ખયાલ બંધાઈ ગયો કે પોતે “ફ્રેચ એકાંગિતા”ને દૂર કરી દીધી છે; પોતે ખરી આવશ્યકતાઓનું નહિ પણ સત્યની આવશ્યકતાઓનું, સર્વહારા વર્ગનાં હિતોનું નહિ પણ માનવીય

પ્રકૃતિનાં, સામાન્ય રૂપે માનવીનાં—કોઈ વર્ગના નહિ, કશી વાસ્તવિકતા વગરના, કેવળ તત્ત્વજ્ઞાની કલ્યાણાવિહારના ધૂંધળા જગતમાં જ અસ્તિત્વ ધરાવતા માનવીનાં—હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

પોતાનું નિશાળિયાઈ બેસન ગંભીર ભાવે તથા ઊંડા ધ્યાનથી કરતા અને ધૂતારાની જેમ પોતાના હલકા માલનાં ભારે ગુણગાન ગાતા એ જર્મન સમાજવાદની વિદ્યાદંભી નિર્દોષતા દરમિયાનમાં ધીરે ધીરે ઓસરી ગઈ.

સામાન્ય ઉમરાવ વર્ગ તથા આપખુદ રાજશાહી સામેની જર્મન તથા ખાસ કરીને પ્રશ્નિયન મૂડીદાર વર્ગની લડત, અથવા બીજ શર્જોમાં લિબરલ (ઉદારવાદી) હિલચાલ વધારે જોશીલી બની.

એથી “ખરા” સમાજવાદને લાંબા વખતથી વાંछિત તક સાંપડી ગઈ. તેણે રાજકીય આંદોલનની સમક્ષ રાજકીય માગણીઓ પેશ કરી. તેણે ઉદારવાદની સામે, પ્રતિનિધિ સરકારની સામે, મૂડીવાદી હરીકાઈની સામે, મૂડીવાદી અખભારી સ્વાતંત્ર્યની સામે, મૂડીવાદી ધારાધોરણની સામે, તેમ જ મૂડીવાદી સ્વતંત્રતા તથા સમાનતાની સામે પરંપરાગત કદુવાઓ ઝીકી; અને તેણે લોકસમુદ્ઘાયોને ઉપદેશ આપ્યો કે એ મૂડીવાદી આંદોલનથી તેમને કશું મળવાનું નથી પણ બધું ગુમાવી દેવાનું જ છે. જર્મન સમાજવાદ બરાબર વાખતસર ભૂલી ગયો કે પોતે જેનો મૂર્ખાઈભયો પડ્યો પાડી રહ્યો હતો એ ફ્રેંચ ટીકામાં આધુનિક મૂડીવાદી સમાજના અસ્તિત્વની તથા તેના સંગાથી આર્થિક જીવનસંલેગોની અને તેને અનુરૂપ બંધારણની પૂર્વધારણા કરવામાં આવી હતી, જર્મનીમાં આગામી સંધર્ણનું લક્ષ્ય જે સિદ્ધિઓ હાંસલ કરવાનું હતું એ જ બાબતોની પૂર્વધારણા કરવામાં આવી હતી.

આપખુદ સરકારો અને તેઓના પાદરીઓ, પ્રોફેસરો, દેહાતી જગીરદારો તથા અમલવારોના રસાલા માટે તેણે ખતરનાક મૂડીદાર વર્ગની સામે મનવાંછિત ચાડિયાની કામગીરી બજવી.

બરાબર એ જ વખતે એ જ સરકારોએ જર્મન કામદાર વર્ગના વિદ્રોહોની ઉપર વીજિલા કોરડા તથા વરસાવેલી ગોળીઓની કડવી દવા પછી એ મીઠો અંજમ હતો.

એ રીતે “ખરા” સમાજવાદે જર્મન મૂડીદાર વર્ગ સામેની લડતમાં સરકારોના હથિયારની કામગીરી બજવી, અને તેની સાથે સાથે પ્રત્યાઘાતી હિતનું, જર્મન કૂપમંડૂકોના હિતનું, સીધું પ્રતિનિધિત્વ કર્યું. જર્મનીમાં સોળમી

સદીના અવશેષ સમો અને ત્યારથી વિવિધ રૂપોમાં સતત ફરી દેખા દેતો નિમ્ન-મૂડીવાદી વર્ગ વર્તમાન પરિસ્થિતિનો ખરો સામાજિક પાયો છે.

એ વર્ગને જગતી રાખવો એટલે જર્મનીમાં વર્તમાન હાલતને જગતી રાખવી. મૂડીદાર વર્ગની ઔદ્ઘોગિક અને રાજકીય સર્વોપરીતા તેને નિશ્ચિત વિનાશના જોખમમાં મૂકી દે છે—એક તરફ મૂડીના કંદૂકરણથી અને બીજી તરફ કાંતિકારી સર્વહારા વર્ગના ઉદયથી. “ખરો” સમાજવાદ એ બન્ને ગંભીરોને એક જ કંકરે મારી નાખતો દેખાયો. એટલે તે રોગચાળાની જેમ ફેલાવા લાગ્યો.

જર્મન સમાજવાદીઓએ હાડકંના માળા જેવાં પોતાનાં તુચ્છ “સાનાતન સત્યો”ને પહેરાવેલા તરંગનાં જાળાના જમાએ, શબ્દાલંકારનાં પુણોની ગુંથાળીવાળા તથા વેવલા વાગણીવેડાની આકણમાં બોળેલા જમાએ, એ અપાર્થિવ જમાએ, તેમના માલના વેચાણમાં અદ્ભુત વધારો કરવાની કામગીરી બજાવી.

અને જર્મન સમાજવાદ પણ નિમ્ન-મૂડીવાદી કૂપમંડુકના પ્રતિનિધિ તરીકેના પોતાના ધંધાને વધારે ને વધારે પ્રમાણમાં સમજતો ગયો.

તેણે જર્મન રાષ્ટ્રને આદર્શ રાષ્ટ્ર ધોષિત કર્યું, અને જર્મન ક્ષુદ્ર કૂપમંડુકને લાક્ષણિક માનવી ધોષિત કર્યો. એ આદર્શ માણસની દરેક દુષ્ટ નીચતાને તેણે છૂપા, ઉચ્ચતર, સમાજવાદી ગુણ તરીકે ગણ્યાવી, તેના ખરા રૂપલક્ષણથી તદ્દન ઊલટા ગુણ તરીકે ગણ્યાવી. સામ્યવાદના “પાશવી રીતે વિનાશક” વલણનો વિરોધ કરવા જેટલી અને તમામ વર્ગસંધર્થો પ્રત્યે ધોર તથા એકસરખી ધૃણા ધોષિત કરવા જેટલી આખરી હેઠે તે પહોંચી ગયો. બહુ થોડા અપવાદો બાદ કરતાં, જર્મનીમાં હાલ (૧૮૪૭માં) ફેલાવો પામતાં તમામ કહેવાતાં સમાજવાદી અને સામ્યવાદી પ્રકાશનો એવા જેમ ચૂસી બેનારા ગલીય સાહિત્યના ક્ષેત્રનાં છે.*

૨. ઇન્ડિયુસ્ન, અથવા મૂડીવાદી, સમાજવાદ

મૂડીદાર વર્ગનો એક હિસ્સો સામાજિક તકલીફી દૂર કરવા ઉત્સુક છે, જેથી મૂડીવાદી સમાજનું સતત અસ્તિત્વ સુનિશ્ચિત બનાવી શકાય.

* ૧૮૪૮ના કાંતિકારી ઝંગાવતે એ આખા અધમ વલણને ખતમ કરી નાખ્યું અને તેના હિમાયતીઓની સમાજવાદમાં માણ્ય મારવાની તાલાવેલી ખતમ કરી નાખી. એ વલણનો મુખ્ય પ્રતિનિધિ અને લાક્ષણિક નમૂનો હેર કાર્લ ગૂન^{૩૨} હતો. (૧૮૯૦ની જર્મન આવૃત્તિમાં એંગેલ્સની નોંધ.)

એ હિસ્સામાં અર્થશાસ્ત્રીઓ, દાનવીરો, માનવતાવાદીઓ, કામદાર વર્ગની હાલત સુધારનારાઓ, જીવદ્યા મંડળોના સભ્યો, મદિરાત્યાગના જન્મની હિમાયતીઓ, અને કલ્પનામાં આવી શકે એવી દરેક જાતના ખૂશાખાંચરાના સુધારકો સામેલ છે. વળી આ પ્રકારના સમાજવાદની પરિપૂર્ણ પદ્ધતિઓ ઘડી કાઢવામાં આવી છે.

આ પ્રકારના સમાજવાદના એક ઉદાહરણ તરીકે અમે પ્રુધોની કૃતિ ‘દરિદ્રતાની ઝિલ્સૂફી’નો ઉલ્લેખ કરીશું.

સમાજવાદી મૂડીદારો આધુનિક સામાજિક સંજોગોમાંથી આવશ્યક રૂપે પેદા થતા સંઘથો તથા જેખમો વગર તેના તમામ ફાયદા માણવા માગે છે. તેઓ વર્તમાન સમાજને તેનાં કાંતિકારી તથા વિધટનકારી તત્ત્વો વગર ટકાવી રાખવા માગે છે. તેમને મૂડીદાર વર્ગ જોઈએ છે પણ સર્વહારા વર્ગ નથી જોઈતો. મૂડીદાર વર્ગ સ્વાભાવિક રીતે જ, જેમાં તેની સર્વોપરીતા હોય એવી દુનિયાને ઉત્તામ ગણીને કલ્પે છે; અને મૂડીવાદી સમાજવાદ એવી સુખચેનની કલ્પનાને વિવિધ ઓછીવધારે પરિપૂર્ણ પદ્ધતિઓમાં વિકસાવે છે. એવી પદ્ધતિને અમલમાં મૂકીને સીધા નવા રામરાજ્યના સમાજમાં કૂચ કરી જવાની સર્વહારા વર્ગને સહાય આપતી વેળા તે વાસ્તવમાં માત્ર એટલું જ જરૂરી બનાવે છે કે સર્વહારા વર્ગ વર્તમાન સમાજની મર્યાદાઓમાં જ રહે, પણ મૂડીદાર વર્ગ અંગેના તેના તમામ ધિક્કારભર્યા વિચારો તજ હે.

આ સમાજવાદના એક બીજા અને વધારે વ્યવહારુ પણ ઓછા પદ્ધતિસર પ્રકારમાં, દરેક કાંતિકારી આંદોલનને કામદાર વર્ગની નજરમાં હલકું પાડી નાખવાની કોશિશ રૂપે બતાવવામાં આવ્યું છે કે કામદારોને કોઈ ખાલી રાજકીય સુધારથી નહિ પણ જિંદગીના ભૌતિક સંજોગોમાં, આર્થિક સંબંધોમાં, પરિવર્તનથી જ કોઈ લાભ થઈ શકે. પરંતુ આ પ્રકારના સમાજવાદમાં જિંદગીના ભૌતિક સંજોગોમાં પરિવર્તનોનો અર્થ, માત્ર કાંતિથી જ કરી શકાય એવી ઉત્પાદનના મૂડીવાદી સંબંધોની નાભૂદી નથી, બલકે એ સંબંધોની સતત હ્યાતી ઉપર આધારિત વહીવટી સુધારા છે, અર્થાત् એવા સુધારા છે કે જે મૂડી અને મહેનત વચ્ચેના સંબંધોને કોઈ રીતે અસર નથી કરતા, પણ બહુ બહુ તો મૂડીવાદી સરકારનું ખર્ચ ઓછું કરે છે અને વહીવટી કામ સરળ બનાવે છે.

મૂડીવાદી સમાજવાદ જ્યારે ખાલી આલંકારિક ભાષા બની રહે ત્યારે, અને માત્ર ત્યારે જ, પૂરતી અભિવ્યક્તિ સાધે છે.

મુક્ત વ્યાપાર—કામદાર વર્ગના લાભમાં. રક્ષણાત્મક વેરા—કામદાર વર્ગના લાભમાં. કેદ સુધારા—કામદાર વર્ગના લાભમાં. મૂડીવાદી સમાજની આ આખરી વાત છે, અને ગંભીર અર્થ ધરાવતી એકમાત્ર વાત છે.

તેનો સાર આ વાક્યમાં તારવીએ—મૂડીદાર મૂડીદાર રહે છે—કામદાર વર્ગના લાભમાં.

૩. ટીકાત્મક - તરંગી સમાજવાદ અને સામ્યવાદ

અમે અહીંથી એ સાહિત્યનો ઉલ્લેખ નથી કરતા કે જેણે દરેક મહાન આધુનિક કાંતિમાં સર્વહારા વર્ગની માંગોને હમેશાં વ્યક્ત કરી છે—દાખલા તરીકે બાબ્યોફ્નાં³³ તથા બીજાઓનાં લખાણો.

સામંતી સમાજને ઉથલાવી પાડવામાં આવી રહ્યો હતો ત્યારે, સાર્વત્રિક ઉત્તોજનાના જમાનામાં, સર્વહારા વર્ગ પોતાનાં લક્ષ્યો સાધવા માટે કરેલા પ્રથમ સીધા પ્રયાસો, એ વખતે સર્વહારા વર્ગની અવિકસિત હાલતને લીધિ તેમ જ તેની મુક્તિના આર્થિક સંઝેગોની ગેરહાજરીને લીધિ, અનિવાર્ય રૂપે નાકામ્યાબ થઈ ગયા. તેની મુક્તિના સંઝેગો હજુ પેદા નહોતા થયા, અને આગામી મૂડીવાદી યુગ જ તેને પેદા કરી શકે એમ હતો. સર્વહારા વર્ગનાં એ પ્રથમ આંદોલનોનું સંગાથી કાંતિકારી સાહિત્ય અનિવાર્ય રૂપે પ્રત્યાધાતી સ્વરૂપ ધરાવતું હતું. તેમાં સર્વસામાન્ય વૈરાગ્યવૃત્તિ અને તદ્દન કઢંગા રૂપની સામાજિક સમતા સામેલ હતી.

સૌંટ સાઈમન, કૂરિયે, ઓવેન³⁴, તથા બીજાઓની યોગ્ય રીતે જ સમાજવાદી તથા સામ્યવાદી ગણાતી પદ્ધતિઓનો ઉદ્ભબ, મૂડીદાર વર્ગ અને સર્વહારા વર્ગ વર્ચ્યેના સંઘર્ષના ઉપરોક્ત પ્રારંભિક અવિકસિત ગણામાં થયો હતો (જુઓ વિભાગ ૧—‘મૂડીદાર અને સર્વહારાઓ’).

એ પદ્ધતિઓના સંસ્થાપકો વર્ગો વર્ચ્યેના અંટ્સોને તેમ જ પ્રવર્તમાન પ્રકારના સમાજમાં વિઘનકારી તત્ત્વની કામગીરીને ખરેખર જુઓ છે. પરંતુ હજુ શિશુવ્યના સર્વહારા વર્ગમાં તેમને કશી ઔતિહાસિક પહેલકદમી કે કશું સ્વતંત્ર રાજકીય આંદોલન નજરે પડતાં નથી.

વર્ગો વર્ચ્યેના અંટ્સનો વિકાસ ઉદ્યોગના વિકાસની સાથે સાથે એકસરખા પ્રમાણમાં થતો હોવાથી, તેમની સમક્ષ ઉપસ્થિત આર્થિક પરિસ્થિતિમાં તેમને સર્વહારા વર્ગની મુક્તિ માટેના ભૌતિક સંઝેગો હજુ નજરે નથી પડતા. એટલે તેઓ એવા સંઝેગો પેદા કરનારા નવા સામાજિક વિજાનની, નવા સામાજિક નિયમોની, તલાશ કરે છે.

औतिहासिक કિયાનું સ્થાન તેમની વ્યક્તિગત શોધક પ્રવૃત્તિ લઈ લે, મુજિત્તના ઔતિહાસિક રીતે સર્જયેલા સંજેગોનું સ્થાન કપોળકલિપત સંજેગો લઈ લે, અને સર્વહારા વર્ગના ધીરે ધીરે આપોઆપ રચાતા સંગઠનનું સ્થાન એ શોધકોએ ઉપજવી કાઢેલું સમાજનું સંઘટન લઈ લે. તેમની નજરમાં ભવિષ્યનો ઈતિહાસ તેમની સામાજિક યોજનાઓના પ્રચાર તથા વાસ્તવિક અમલનું રૂપ ધારણ કરી લે છે.

તેઓ પોતાની યોજનાઓ ધડતી વેળા મુખ્યત્વે કામદાર વર્ગનાં, સૌથી વધારે હાઉમારી વેઠતા વર્ગનાં, હિતોની કાળજી સભાન રૂપે રાખે છે. તેમને માટે તો સર્વહારા વર્ગનું અસ્તિત્વ કેવળ સૌથી વધારે હાઉમારી વેઠતા વર્ગ તરીકે જ છે.

વર્ગસંઘર્ષની અવિકસિત હાલત તેમ જ એ પ્રકારના સમાજવાદીઓના પોતાના વાતાવરણને કારણે તેઓ પોતાને વર્ગો વર્ચ્યેના વેરભાવથી ખૂબ ઊંચી કક્ષાએ ગણે છે. તેઓ સમાજના દરેક સભ્યની—સૌથી વધારે ફાયદા માણના સભ્યની પણ—હાલત સુધારવા માગે છે. એટલે વર્ગના કશા બેદભાવ વગર સમગ્ર સમાજને અપીલ કરવાની, બલકે શાસક વર્ગને ખાસ અપીલ કરવાની તેમને ટેવ પડી ગઈ છે. કારણ કે, લોકો તેમની પદ્ધતિને એક વાર સમજી લે એટલે પછી બને એટલા સરસ સમાજની બને એટલી સરસ યોજનાને તેમાં ઓળખી લીધા વગર કેમ રહે?

એટલે તેઓ સમગ્ર રાજકીય, અને ખાસ કરીને સમગ્ર કાંતિકારી પ્રવૃત્તિને નકારી કાઢે છે. તેમની મંદ્ઘા પોતાનાં લક્ષ્યો શાંતિમય ઉપાયો વડે સિદ્ધ કરવાની છે, અને અનિવાર્ય રૂપે નિષ્ફળ જનારા નાનકડા અખતરાઓ મારફત તથા ઉદાહરણના પ્રભાવ મારફત, તેઓ નવા દૈવી સામાજિક આદેશનો માર્ગ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે.

સર્વહારા વર્ગ હજુ સાવ અવિકસિત હાલતમાં હોય અને તેને પોતાની સ્થિતિનો ઘ્યાલ માત્ર કલ્પનાના આધારે જ હોય, એવા જમાનામાં ધડી કાઢવામાં આવેલાં આવાં તરંગી ચિત્રો, સમાજની સામાન્ય પુનર્ધારના માટે એ વર્ગની પ્રથમ સાહિની જંખનાઓને અનુરૂપ છે.

પરંતુ એ સમાજવાદી તથા સામ્યવાદી પ્રકાશનોમાં ટીકાત્મક તત્ત્વ પણ છે. તેઓ વર્તમાન સમાજના પ્રત્યેક સિદ્ધાંતની ઉપર પ્રખાર કરે છે. એટલે કામદાર વર્ગની વાકેફ્ગારી માટે અત્યાંત મૂલ્યવાન સામગ્રી તેમાં ભરપૂર પડી છે. તેમાં રજૂ કરવામાં આવેલાં અમલી કંદમો—દાખલા તરીકે, શહેરો અને ગામો વચ્ચેના બેદની નાબૂદી, પરિવારની નાબૂદી, ખાનગી વ્યક્તિઓના હિસાબે ઉદ્યોગો

ચલાવવાનું બંધ કરવું, વેતનની પ્રથાની નાભૂદી, સામાજિક સુમેળની ઘોષણા, રાજ્યની કામગીરીઓ બદલાવી નાખીને માત્ર ઉત્પાદનની દેખરેખ પૂરતી બનાવી દેવી—આ બધી દરખાસ્તો વગોં વચ્ચેના અંટસોની નાભૂદી પ્રત્યે જ નિર્દેશ કરે છે. પરંતુ એ જમાનામાં વગોં વચ્ચેના અંટસો તો હજુ તાજ જ દેખા દઈ રહ્યા હતા, અને એ પ્રકાશનોમાં અંટસોનાં કેવળ તદ્દન આરંભનાં તથા અસ્પષ્ટ રૂપોને જ ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. એટલે આ દરખાસ્તો નિર્ભેણ તરંગી સ્વરૂપની છે.

ટીકાતમક-તરંગી સમાજવાદ તથા સામ્યવાદનું મહત્ત્વ ઐતિહાસિક વિકાસ નેડે ઊલટા કમનો સંબંધ ધરાવે છે. આધુનિક વર્ગસંધર્થ નેટલા પ્રમાણમાં વિકસે છે અને ચોક્કસ આકાર ધારણ કરે છે એટલા પ્રમાણમાં, સંધર્થી અળગા આ કપોળકલિપત ધોરણનાં તથા સંધર્થની ઉપર આ ઉટપટાંગ પ્રધારોનાં સમગ્ર અમલી મૂલ્ય તથા સમગ્ર સૌલ્ખાંતિક આધાર ખતમ થતાં જાય છે. એટલે, આ પદ્ધતિઓના પ્રવર્તકો ધણી દૃષ્ટિએ કાંતિકારી હતા, પરંતુ તેમના શિષ્યોએ દરેક દાખલામાં ખાલી પ્રત્યાધારી સંપ્રદાયો જ સ્થાપ્યા છે. સર્વહારા વર્ગના પ્રગતિશીલ ઐતિહાસિક વિકાસના વિરોધમાં તેઓ પોતાના ઉસ્તાદોના મૂળ વિચારોને જોરથી વળગી રહે છે. એટલે તેઓ વર્ગસંધર્થને ચેતનહીન બનાવી દેવાની તથા વગોં વચ્ચેના અંટસોને સુમેળમાં પલટાવી નાખવાની કોશિશ કરે છે, સુસંગત કોશિશ કરે છે. તેઓ હજુ પોતાના સામાજિક તરંગોના પ્રયોગોની સફળતાનાં સ્વભાવાં સેવે છે; છૂટીછવાઈ ‘ફ્લાન્સટેરેસ’, ‘હોમ કોલોનીઝ’, અને ‘લિટલ ઈકારિયા’*—વસાહતો અમરાપુરીનાં ટચૂકડાં રૂપો—સ્થાપવાનાં સ્વભાવાં સેવે છે; અને આ બધા હવાઈ મહેલો ચણવા માટે તેમને મૂડીદારના

* ચાર્લ્સ કૂરિયેની પોજના મુજબની વસાહતો ‘ફ્લાન્સટેરેસ’ નામે ઓળખાતી હતી. કાબેએ તેના તરંગની દુનિયાના સમાજને, અને આગળ જતાં તેની અમેરિકી સામ્યવાદી વસાહતને, ‘ઈકારિયા’ નામ આપ્યું હતું. (૧૮૮૮ની અંગેજી આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

ઓવેને તેની સામ્યવાદી આદર્શ વસાહતને ‘હોમ કોલોનીઝ’ અથવા ‘નિવાસ વસાહતો’ નામ આપ્યું હતું. કૂરિયેએ આયોનેલી સાર્વજનિક હવેલીઓનું નામ ‘ફ્લાન્સટેરેસ’ હતું. કલ્પનાવિવાસના તરંગી દેશની કાબેએ ચિત્રિત કરેલી સામ્યવાદી સંસ્થાઓને ‘ઈકારિયા’ નામ આપવામાં આવ્યું હતું. (૧૮૯૦ની જર્બન આવૃત્તિમાં અંગેલ્સની નોંધ.)

દિલમાં હમદર્રી જગાવવી પડે છે તથા તેનાં નાણાંની ભીખ માગવી પડે છે. તેઓ ધીરે ધીરે નીચે સરકતા, ઉપર વર્જિવાઈ ગયેલા પ્રત્યાઘાતી રૂઠિયુસ્ત સમાજવાદીઓની કતારમાં પહોંચી જય છે. એ સમાજવાદીઓથી તેઓ ફક્ત એટલા પૂરતા જ જુદા પડે છે કે તેઓ વધારે પદ્ધતિસર વિદ્યાદંભી હોય છે અને તેમને પોતાના સામાજિક વિજ્ઞાનની ચમત્કારી અસરોમાં ઝનૂની તથા વહેમી શ્રૂદ્ધા હોય છે.

એટલે તેઓ કામદાર વર્ગનાં તમામ રાજકીય કદમોનો ઉગ્ર વિરોધ કરે છે. તેમની દૃષ્ટિએ એવાં કદમો નવા દેવી આદેશમાં વગર વિચારી અશ્રૂદ્ધમાંથી જ પરિણમી શકે.

ઈંગ્લિંડમાં ઓવેનપંથીઓ અને ફ્રાંસમાં ફૂરિયેપંથીઓ અનુકૂળે ચાર્ટિસ્ટોનો³⁵ અને રિફ્રોર્મીસ્ટેસનો³⁶ વિરોધ કરે છે.

ઈંગ્લેઝમાં ચાર્ટર્સ્ટો તથા અમેરિકામાં “ગ્રામ સુધારકો” જેવી વર્તમાન કામદાર વર્ગીય પાર્ટીઓના સંબંધમાં કોમ્યુનિસ્ટોનું ધોરણ બીજ વિભાગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

કોમ્યુનિસ્ટો કામદાર વર્ગનાં તાત્કાલિક લક્ષ્યો તથા હિતો ખાતર લડે છે. પરંતુ વર્તમાન આંદોલનમાં તેઓ આંદોલનના ભાવિનું પ્રતિનિધિત્વ કરે છે તથા ધ્યાન રાખે છે. ફ્રાંસમાં કોમ્યુનિસ્ટો ઇન્ડિયુસ્ટ અને રેડિકલ મૂડીદાર વર્ગની સામે સોશ્યલ-એમોકેટો *ની જેડે ઓકસાંપી સાથે છે, પરંતુ મહાન કાંતિના વખતથી ઉત્તરી આવેલાં પરંપરાગત સૂત્રો તથા ભ્રમોના સંબંધમાં ટીકાત્મક ધોરણ અખાત્યાર કરવાનો અધિકાર તેઓ જાળવી રાખે છે.

તેઓ સિવટ્યાલેંડમાં રેડિકલોનું સમર્થન કરે છે, પરંતુ હકીકિત લક્ષ બહાર નથી રાખતા કે એ પાર્ટી પરસ્પર વેરભાવી તત્ત્વોની બનેલી છે, અમુક અંશે ફ્રેચ અર્થમાં લોકશાહીવાદી સમાજવાદીઓની અને અમુક અંશે રેડિકલ મૂડીવાદીઓની બનેલી છે.

પોલેંડમાં રાષ્ટ્રીય મુજિની પ્રથમ શરત તરીકે કિસાન કાંતિનો આગ્રહ

* એ વખતે આ પાર્ટીના પ્રતિનિધિઓ પાલમેન્ટમાં લેન્દૂ-રોલં તથા સાહિત્યમાં લુઈ બ્લાં³⁷ હતા અને દૈનિક અખભારોમાં «Reforme» હતું. એ વખતે સોશ્યલ-એમોક્સીના એ પ્રણેતાઓની દૃષ્ટિમાં તેનો અર્થ હતો — લોકશાહીવાદી અથવા પ્રજાસત્તાકવાદી પાર્ટીનો ઓછીવધારે સમાજવાદી રંગછાયા ધરાવતો હિસ્સો. (૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિમાં એંગેલ્સની નોંધ.)

એ વખતે ફ્રાંસમાં સોશ્યલિસ્ટ-એમોકેટિક પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટીના પ્રતિનિધિઓ રાજકીય જીવનમાં લેન્દૂ-રોલં અને સાહિત્યમાં લુઈ બ્લાં હતા. એ રીતે, વર્તમાન જર્નન સોશ્યલ-એમોક્સીથી તે બેહદ નિરાળી હતી. (૧૮૯૦ની જર્નન આવૃત્તિમાં એંગેલ્સની નોંધ.)

રાખનારી પાર્ટીનું, ૧૮૪૬માં^{૩૮} કેકોવમાં વિખ્લવ જગાવનારી પાર્ટીનું, તેઓ સમર્થન કરે છે.

જર્મનીમાં મૂડીદાર વર્ગ જ્યારે જ્યારે આપખુદ રાજશાહીની સામે, સામંતી જગીરદારોની સામે, તથા નિમ્ન-મૂડીવાદી વર્ગની સામે લડે છે ત્યારે તેઓ તેના સંગાથમાં લડે છે.

પરંતુ તેઓ મૂડીદાર વર્ગ અને સર્વહારા વર્ગ વચ્ચેના કટૂર વેરભાવની બને એટલી વધારેમાં વધારે સમજણ કામદાર વર્ગમાં સિંચવાનું એક પળ માટે પણ ક્યારેય બંધ નથી કરતા, જેથી મૂડીદાર વર્ગ પોતાની સર્વોપરીતાની સાથે સાથે ને રાજકીય સંઝેગો અનિવાર્ય રૂપે ઊભા કરવાનો છે તેનો સીધેસીધો ઉપયોગ જર્મન કામદારો ધણાંબધાં હથિયારો તરીકે કરી શકે, અને જર્મનીમાં પ્રત્યાધાતી વર્ગોના પતન પછી મૂડીદાર વર્ગ સામેની લડત તત્કાળ શરૂ થઈ જાય.

કોમ્યુનિસ્ટો પોતાનું ધ્યાન મુખ્યત્વે જર્મની તરફ વાળી રહ્યા છે કારણ કે એ દેશ મૂડીવાદી કાંતિની પૂર્વવિનાએ પહોંચી ગયો છે. એ કાંતિ ચોક્કસ રૂપે યુરોપીય સભ્યતાના અધિક ઉનનત સંઝેગોમાં થશે અને તેમાં સર્વહારા વર્ગ સત્તારમી સદ્ગીના ઈંગ્લેઝના સર્વહારા વર્ગ કરતાં તથા અદારમી સદ્ગીના ફ્રેંચ સર્વહારા વર્ગ કરતાં વધારે વિકસિત સ્થિતિમાં હશે. જર્મનીમાં મૂડીવાદી કાંતિ તો તેને પગલે પગલે તરત જ થનારી સર્વહારા કાંતિનો કેવળ પૂર્વરંગ જ હશે.

ટૂંકમાં કોમ્યુનિસ્ટો દરેક ઠેકાણે વર્તમાન સામાજિક તથા રાજકીય વ્યવસ્થાની સામે પ્રત્યેક કાંતિકારી આંદોલનનું સમર્થન કરે છે.

તેઓ એ બધાં આંદોલનોમાં પ્રત્યેકના મુખ્ય સવાલ તરીકે મિલકતના સવાલને — એ વખતે તેનો વિકાસ ભલે ગમે એટલે અંશે થયો હોય તો પણ — મોખરે લાવે છે.

છીલ્લે — તેઓ દરેક ઠેકાણે બધા દેશોની લોકશાહીવાદી પાર્ટીઓની એકસંપી તથા સહમતી માટે જહેમતો કરે છે.

કોમ્યુનિસ્ટો પોતાના વિચારો તથા લક્ષ્યોને દુપાવવાના ખ્યાલ સુલ્લાંને નફરતની નજરે જુઓ છે. તેઓ ખુલ્લાંખુલ્લા જહેર કરે છે કે અમારાં લક્ષ્યો તો સમગ્ર વર્તમાન સામાજિક સંઝેગોને બળજબરીથી ઉઘેડી નાખીને જ સાધી શકાય એમ છે. સામ્યવાદી કાંતિ સમક્ષ શાસક વર્ગને ધૂજવા દો. સર્વહારા વર્ગને પોતાની બેડીઓ સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી. તેમને જીતવા માટે આખી હુનિયા છે.

કુનિયાના કામદારો, એક થાયો!

ਪਰਿਵਾਰ

સામ્યવાદના સિદ્ધાંતો^{૩૭}

સવાલ ૧: સામ્યવાદ એટલે શું?

જવાબ: સામ્યવાદ એટલે સર્વહારા વર્ગની મુક્તિના સંજેગોનો સિદ્ધાંત.

સવાલ ૨: સર્વહારા વર્ગ એટલે શું?

જવાબ: સર્વહારા વર્ગ સમાજનો એવો વર્ગ છે કે ને ગુજરાનનાં સાધનો કશી મૂડીના આધારે પેદા કરેલા નફામાંથી નહિ, પરંતુ તદ્દન અને માત્ર પોતાની મહેનતના વેચાણમાંથી જ હાંસલ કરે છે; જેનાં સુખસગવડ અને કઠળાઈઓનો, જિંદગી અને મોતનો, પૂરી હ્યાતીનો, આધાર મહેનતની માંગ ઉપર હોય છે, એટલે કે વારાફરતી આવતા સારા વેપારના અને માટા વેપારના દિવસો ઉપર હોય છે, બેલગામ હરીકાઈમાંથી પરિણમતી તેજુમંદી ઉપર હોય છે. ટૂંકમાં, સર્વહારા વર્ગ, અથવા સર્વહારાઓનો વર્ગ, ઓગાળીસમી સદીનો કામદાર વર્ગ છે.

સવાલ ૩: એ રીતે, સર્વહારાઓ સદા અસ્તિત્વમાં નથી રહ્યા?

જવાબ: ના. ગરીબ લોકો અને કામદાર વર્ગો હંમેશાં અસ્તિત્વમાં રહ્યા છે, અને કામદાર વર્ગો મોટે ભાગે હંમેશાં ગરીબ રહ્યા છે. પરંતુ મુક્ત અને બેલગામ હરીકાઈ જેવી રીતે હંમેશાં અસ્તિત્વમાં નથી રહી એવી જ રીતે, હમણાં જણાવવામાં આવેલા સંજેગોમાં જિંદગી ગુજરતા હોય એવા ગરીબો, એવા કામદારો, અર્થાત્ સર્વહારાઓ હંમેશાં અસ્તિત્વમાં નથી રહ્યા.

સવાલ ૪: સર્વહારા વર્ગનો ઉદ્ય કેવી રીતે થયો?

જવાબ: ગઈ સદીના ઉત્તરાર્ધમાં ઈંગ્લેઝમાં વિકાસ પામેલી ઔદ્યોગિક કાંતિના પરિણામે, અને ત્યાર પણી દુનિયાના બધા સભ્ય દેશોમાં એવી કાંતિના

પુનરાવર્તનના પરિણામે, સર્વહારા વર્ગનો ઉદ્ય થયો. વરાળયંત્ર, વિવિધ કાંતશૂયંત્રો, પાવર-લૂમ, અને વિશાળ સંખ્યામાં બીજાં યાંત્રિક સાધનોની રૂચના થવાથી એ ઓદ્યોગિક કાંતિ થઈ. ખૂબ મોંધાં હોવાથી માત્ર મોટા મૂડીદારો જ ખરીદી શકે એવાં એ યંત્રોએ ઉત્પાદનની તત્કાલીન આખી રીતને પલટાવી નાખી અને તત્કાલીન કામદારોને રજુણતા કરી મુક્યા, કારણ કે કામદારો પોતાના સાદા રેટિયા તથા હાથસાળ વડે બનાવી શકે તેનાથી વધારે સસ્તી અને બહેતર ચીજે યંત્રો બનાવવા લાગ્યાં. એ રીતે યંત્રોએ ઉદ્યોગ પૂરેપૂરો મોટા મૂડીદારોના હાથમાં સુપરત કરી દીધો અને કામદારોની નજીવી મિલકત (ઓજારો, હાથસાળો, વગેરે) નકાખી બનાવી દીધી. પરિણામે થોડા વખતમાં મૂડીદારો દરેક વસ્તુના માલિક બની ગયા અને કામદારો કને કશું જ ન રહ્યું. કાપડના ઉત્પાદનના ક્ષેત્રમાં કારખાનાની પ્રથા એ રીતે દાખલ થઈ. યંત્રોને તથા કારખાનાની પ્રથાને એક વાર પ્રવેગ આપવામાં આવ્યો એટલે કારખાનાની પ્રથા ઝડપથી ઉદ્યોગની બીજી બધી શાખાઓમાં પહોંચી ગઈ — ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં અને પુસ્તકછપાઈ, પોટરી, તથા ધાતુની ચીજેના ઉદ્યોગોમાં. મહેનત વધારે ને વધારે પ્રમાણમાં ઘણા કામદારોની અંદર વહેંચાઈ જવા લાગી. પહેલાં એક કામદાર આખી ચીજ બનાવતો હતો તેને બદલે હવે ચીજનો માત્ર એક ભાગ બનાવવા લાગ્યો. મહેનતની એવી વહેંચણીને કારણે ઉત્પાદિત ચીજે વધારે ઝડપથી અને એટલે વધારે સસ્તી કિંમતે પૂરી પાડવાનું શક્ય બન્યું. એથી દરેક કામદારની મહેનત સાંચ સાંચી અને વારંવાર પુનરાવર્તિત યંત્રવત્ત કામગીરી બની ગઈ. મશીન એવી કામગીરી કામદાર જેટલી જ સરસ કરી શકે એટલું જ નહિ પરંતુ સારી પેઠે બહેતર પણ કરી શકે. એ રીતે, કાંતશુ અને વણાટ ઉદ્યોગોની જેમ જ, એક એક કરીને ઉદ્યોગની એ બધી શાખાઓમાં પણ વરાળશક્તિ, મશીનો, તથા કારખાનાની પ્રથાનું વર્ચસ્વ સ્થપાઈ ગયું. પરંતુ તેના પરિણામે એ બધી મોટા મૂડીદારોના હાથમાં ચાલી ગઈ, અને તેમાં પણ કામદારોની સ્વતંત્રતાના આખરી અંશો છીનવી લેવામાં આવ્યા. ધીરે ધીરે ખરા મેન્યુફેક્ચર ઉપરાંત હાથકારીગરીના ધંધાઓમાં પણ કારખાનાની પ્રથાનું વર્ચસ્વ સ્થપાઈ ગયું, કારણ કે તેમાં પણ મોટા મૂડીદારોએ વિશાળ કારખાનાં ખડાં કરીને નાના કારીગરોને વધારે ને વધારે પ્રમાણમાં બાળુ પર ધકેલી દીધા. એવાં કારખાનાંમાં ખર્ચની પુષ્કળ બચત થતી અને કામદારોની અંદર મહેનતની અનુકૂળ વહેંચણી પણ થઈ શકતી, પરિણામે એમ બન્યું છે કે સભ્ય દેશોમાં મહેનતની લગભગ તમામ શાખાઓ કારખાનાની પ્રથા મુજબ ચલાવવામાં આવે

છે, અને લગભગ એ તમામ શાખાઓમાં વિશાળ પાયાના ઉદ્ઘોગે હાથકારીગારી તથા મેન્યુફેડ્યરની હકાલપટ્ટી કરી છે. તેના પરિણામે, અગાઉના મધ્યમ વર્ગોં, ખાસ કરીને નાના ઉસ્તાદ કારીગરો, વધારે ને વધારે પ્રમાણમાં પાયમાલીની હાલતમાં ધકેલાઈ ગયા છે; કામદારોની અગાઉની હાલત તદ્દન પલટાઈ ગઈ છે, અને ધીરે ધીરે બીજા બધા વર્ગોને પોતાની અંદર સમાવી લેતા બે નવા વર્ગોં અસ્તિત્વમાં આવ્યા છે. એ બે વર્ગોં છે—

૧. મોટા મૂડીદારોનો વર્ગ. બધા સભ્ય દેશોમાં ગુજરાનાં તમામ સાધનોનો તેમ જ ગુજરાનાં એ સાધનોના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ તથા ઓઝરોનો (મશીનો, કારખાનાં, વગેરે) એકમાત્ર માલિક એ વર્ગ છે. એ વર્ગ મૂડીદારોનો વર્ગ અથવા મૂડીદાર વર્ગ છે.

૨. એવા લોકોનો વર્ગ કે જેમની પાસે મુદ્દલ કશું જ નથી અને એટલે જેમને ગુજરાનાં સાધનો બદલામાં મેળવવા માટે પોતાની મહેનત મૂડીદારને વેચવી પડે છે. એ વર્ગ સર્વહારાઓનો વર્ગ અથવા સર્વહારા વર્ગ તરીકે ઓળખાય છે.

સવાલ ૫: સર્વહારાઓની મહેનતનું મૂડીદારને વેચાણ કેવા સંભેગોમાં થાય છે?

જવાબ: મહેનત પણ બીજા કોઈ પણ્ય * જેવું જ પણ્ય છે, અને બીજા કોઈ પણ્યની કિંમત નિર્ધારિત કરતા નિયમો અનુસાર જ તેની કિંમત પણ નિર્ધારિત થાય છે. વિશાળ પાયાના ઉદ્ઘોગના કે મુક્ત હરીફાઈના—આપણે જેઈશું કે બન્નેનો અર્થ એક જ છે—વર્ષસ્વમાં પણ્યની કિંમત સરેરાશ હંમેશાં એ પણ્યના ઉત્પાદનના ખર્ચ જેટલી હોય છે. એટલે, મહેનતની કિંમત પણ એવી જ રીતે મહેનતના ઉત્પાદનના ખર્ચ જેટલી હોય છે. કામદારને મહેનત કરવા લાયક રાખવા માટે અને કામદાર વર્ગને નાચ થઈ જતો અટકાવવા માટે જરૂરી ગુજરાનાં સાધનોનો જથ્થો જ ચોક્કસ રૂપે મહેનતના ઉત્પાદનનું ખર્ચ હોય છે. એ રીતે, એ હેતુ માટે જરૂરી હોય તેનાથી વધારે કામદારને તેની મહેનતના બદલામાં ન મળે; મહેનતની કિંમત, અથવા વેતન, નીચામાં નીચી કષાયો રહે, જિંદગી ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી આવશ્યકતાની કષાયો રહે. વેપાર ક્યારેક સારો અને ક્યારેક મોળો હોય છે, એટલે, જેવી રીતે કારખાનદારને તેના પણ્યના બદલામાં ક્યારેક વધારે ને ક્યારેક ઓછું મળે,

* વેચવાની વસ્તુ, વેપારી માલ.—સં.

એવી જ રીતે કામદારને પણ ક્યારેક વધારે ને ક્યારેક ઓછું મળો. પરંતુ વખત ભલે સારો કે માઠો ગમે તેવો હોય, જેવી રીતે કારખાનદારને તેના પણુંના બદલામાં સરેરાશ પણુંના ઉત્પાદનના ખર્ચ જેટલું—એથી વધારેય નહિ ને ઓછુંથે નહિ—મળી જાય છે, એવી જ રીતે કામદારને પણ સરેરાશ એટલું લઘુતમ—એથી વધારેય નહિ ને ઓછુંથે નહિ—મળી રહે છે. વિશાળ પાયાનો ઉદ્યોગ મહેનતની તમામ શાખાઓને વધારે સર કરતો જશે તેમ તેમ વેતનનો આ આર્થિક નિયમ વધારે સખતીથી લાગુ થતો જશે.

સવાલ ૬: ઔદ્યોગિક કાંતિ પહેલાં કયા કયા કામદાર વર્ગો અસ્તિત્વમાં હતા?

જવાબ: સમાજના વિકાસના વિવિધ તબક્કાઓ અનુસાર કામદાર વર્ગો વિવિધ પરિસ્થિતિઓમાં જિંદગી ગુજરતા હતા અને મિલકૃતદાર તથા શાસક વર્ગો જેડે વિવિધ સંબંધો ધરાવતા હતા. પ્રાચીન જમાનામાં કામદાર લોકો પોતાના માલિકોના ગુલામો હતા. ધર્મ પદ્ધત દેશોમાં તેમ જ અમેરિકના દક્ષિણ ભાગોમાં પણ હજુ એવી જ પરિસ્થિતિ છે. મધ્યયુગમાં કામદાર લોકો જમીનદાર ઉમરાવોની માલિકીના ઝેતગુલામો હતા. હંગેરી, પોલિંડ, અને રશ્યામાં હજુ એવી જ પરિસ્થિતિ છે. મધ્યયુગમાં શહેરોમાં નાના મૂડીદારની નોકરી કરતા હાથકારીગરો પણ હતા. મેન્યુફેક્ચરનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમાં કામ કરતા કામદારોની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. હવે ઓછાવધારે પ્રમાણમાં મોટા મૂડીદારો એ કામદારોને કામે રાખે છે.

સવાલ ૭: સર્વહારા ગુલામથી કઈ રીતે જુદો છે?

જવાબ: ગુલામને સીધિસીધો વેચી નાખવામાં આવે છે, સર્વહારાને પોતાની જાતનું વેચાણ દિવસ અને કલાકના હિસાબે કરતું પડે છે. દરેક અલગ ગુલામને, એક જ માલિકની મિલકતને, તેના ગુજરાનની ખાતરી હોય છે—પછી તે ભલે તેના માલિકનાં હિતો મુજબ હોય અને ગમે એટલું કંગાલ હોય. દરેક અલગ સર્વહારા જાણે આખા મૂડીદાર વર્ગની મિલકત હોય છે. તેની મહેનત તો જ્યારે જરૂર પડે ત્યારે જ ખરીદવામાં આવે છે, અને એટલે તેને ગુજરાનની કશી ખાતરી નથી મળતી. ગુજરાનની ખાતરી સર્વહારા વર્ગને કેવળ સમગ્ર રૂપમાં જ મળે છે. ગુલામ હરીકાઈના ક્ષેત્રની બહાર હોય છે, પરંતુ સર્વહારા હરીકાઈના ક્ષેત્રની અંદર જ હોય છે અને તેની તમામ તેજમંદીઓનો ભોગ બને છે. ગુલામને નાગરિક સમાજનો સભ્ય નથી ગણવામાં આવતો, વસ્તુ ગણવામાં આવે છે. સર્વહારાને વ્યક્તિ ગણવામાં આવે છે, નાગરિક સમાજનો

સત્ય ગણવામાં આવે છે. એ રીતે, ગુલામ કદાચ સર્વહારા કરતાં બહેતર જિંદગી જીવતો હોય, પરંતુ સર્વહારા સમજના વિકાસના ઉચ્ચતર તબક્કાનો ઈન્સાન છે, અને પોતે ગુલામ કરતાં ઊંચી કક્ષા ધરાવે છે. ગુલામ તો ખાનગી મિલકતના તમામ સંબંધોમાંથી માત્ર ગુલામીના સંબંધને ખતમ કરીને મુક્ત થઈ જય, અને એ રીતે ખુદ સર્વહારા બની જય; સર્વહારા સામાન્ય રૂપે ખાનગી મિલકતને નાભૂદ કરીને જ મુક્ત થઈ શકે.

સવાલ ૮: સર્વહારા ખેતગુલામથી કઈ રીતે જુદો છે?

જવાબ: ખેતગુલામના કબજમાં ઉત્પાદનનું સાધન—જમીનની પટ્ટી—હોય છે, અને તેનો ઉપયોગ પણ તે કરી શકે છે. બદલામાં તે પાડનો અમુક હિસ્સો આપી દે છે અથવા કામ કરી આપે છે. સર્વહારા બીજા કોઈ માટે એ બીજા કોઈનાં ઉત્પાદનનાં સાધનોનો ઉપયોગ કરે છે. બદલામાં તેને પેદાશનો અમુક હિસ્સો મળે છે. ખેતગુલામ આપે છે, સર્વહારાને આપવામાં આવે છે. ખેતગુલામને ગુજરાનની ખાતરી હોય છે, સર્વહારાને નથી હોતી. ખેતગુલામ હરીકાઈના ક્ષેત્રની બહાર હોય છે, સર્વહારા તેની આંદર હોય છે. ખેતગુલામ કાં તો શહેરમાં નાસી જઈને અને ત્યાં કારીગર બની જઈને, અથવા જમીનદારને મહેનત તથા નીપણેને બદલે ગૈસ આપીને અને એ રીતે જમીનનો મુક્ત પટ્ટો હાંસલ કરીને, અથવા પોતાના સામાંતી હાડેમને નસાડી મૂકીને અને એ રીતે ખુદ માલિક બની જઈને, ટૂંકમાં એક યા બીજી રીતે મિલકતદાર વર્ગની હરોળોમાં તથા હરીકાઈમાં દાખલ થઈને, મુક્ત બની જય. સર્વહારા હરીકાઈને, ખાનગી મિલકતને, અને તમામ વર્ગલિદોને નાભૂદ કરીને મુક્ત થઈ શકે.

સવાલ ૯: સર્વહારા હાથકારીગરથી કઈ રીતે જુદો છે? *

સવાલ ૧૦: સર્વહારા મેન્યુફેક્ચરના કામદારથી કઈ રીતે જુદો પડે છે?

જવાબ: સોળમીથી અઢારમી સદી દરમિયાનનો મેન્યુફેક્ચરનો કામદાર હજુ પોતાનાં ઉત્પાદનનાં સાધનોની—સાણ, ક્રોટુંબિક રેટિયા, અને જમીનનો નાનકડો ખ્લોટ— માલિકી ધરાવતો હતો. તે કુરસદના વખતે જમીનના ખ્લોટમાં ખેતી કરતો. સર્વહારાની પાસે આમાંનું કશું નથી હોતું. મેન્યુફેક્ચરનો કામદાર મોટે ભાગે માત્ર દેહાતોમાં જ વસે છે, અને જમીનદાર કે શેઠ જેઠે તેના સંબંધો

* એંગેલ્સે હસ્તપ્રતમાં અહીંથી જવાબ માટે ખાલી જગ્યા છોડી દીધી છે. — સં.

ઓદ્ઘાવધારે પ્રમાણમાં પિતૃશાસન પ્રકારના હોય છે. સર્વહારા મુખ્યત્વે મોટાં શહેરોમાં વસે છે, અને તેને કામે રાખનારા માલિકની જોડે તેનો સંબંધ ચોપખો પૈસાનો સંબંધ હોય છે. મોટા પાયાનો ઉદ્યોગ મેન્યુફેક્ચરના કામદારને પિતૃશાસન પ્રકારના સંબંધોથી છૂટો કરી દે છે. તેના હાથમાં હજુ બચી રહેલી મિલકત તે ગુમાવી બેસે છે, અને પરિણામે સર્વહારા બની જાય છે.

સ્વાલ્પ ૧૧ : ઔદ્યોગિક કાંતિનાં અને મૂડીદાર તથા સર્વહારાઓમાં સમાજના વિભાજનનાં તાત્કાલિક પરિણામો કેવાં છે?

જવાબ : પહેલી વાત તો એ કે કામમાં મશીનોના ઉપયોગને લીધે ઔદ્યોગિક ચીજેની કિંમતો સતત ઘટતી ગઈ એટલે શારીરિક મહેનત ઉપર આધારિત પુરાણી મેન્યુફેક્ચર અથવા ઉદ્યોગની પદ્ધતિ બધા દેશોમાં તદ્દન ખતમ થઈ ગઈ. અત્યાર સુધી ઔદ્યોગિક વિકાસથી લગભગ સાવ અણગા રહી ગયેલા અને આજ પર્યાત મેન્યુફેક્ચર ઉપર આધારિત ઉદ્યોગ ધરાવતા અર્ધજંગલી દેશોને તેઓની એકાકિતામાંથી પરાણે બહાર ખોચી અઢવામાં આવ્યા. તેઓએ અંગેજેનો સસ્તો માલ ખરીદવાનું શરૂ કરી દીધું અને પોતાના મેન્યુફેક્ચર કામદારોને ખતમ થઈ જવા દીધા. એ રીતે, હજારો વરસોથી સ્થળિત દશામાં પડેલા દેશોમાં સર્વાંગી કાંતિકારી પરિવર્તનો થયાં — દાખલા તરીકે હિંદુસ્તાન, અને હવે ચીન પણ કાંતિની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે. એ રીતે, આજે ઈંગ્લેઝમાં નવું મશીન બનાવવામાં આવે એટલે એક વરસની અંદર ચીનમાં લાખો કામદારોની રોજની રોટી ઝૂંટવાઈ જાય છે. એ રીતે, વિશાળ પાયાના ઉદ્યોગ પૃથ્વીની તમામ પ્રજાઓને એકબીજના સંબંધમાં આણું દીધી છે, બધાં સ્થાનિક બજારોને એકસાથે બાંધી લઈને એક વિશ્વ બજાર ઊભું કરી દીધું છે, દરેક હેકાણે સર્ભ્યતા અને પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે, અને હાલત એવે તબક્કે પહોંચી ગઈ છે કે સર્ભ્ય દેશોમાં જે કંઈ બને તેની અસર બીજા તમામ દેશોમાં પડે છે. એ રીતે ઈંગ્લેઝ કે ફ્રાંસના કામદારો અત્યારે મુક્તિ હાંસલ કરી વે તો એથી બીજા બધા દેશોમાં કાંતિકારી આંદોલન પ્રેરિત થશે જ, અને તેના પરિણામે એ દેશોના કામદારો પણ વહેલા કે મોડા મુક્તિ હાંસલ કરી વેશે.

બીજી વાત — જ્યાં જ્યાં મેન્યુફેક્ચરનું સ્થાન વિશાળ પાયાના ઉદ્યોગે લઈ લીધું ત્યાં ત્યાં ઔદ્યોગિક કાંતિએ મૂડીદાર વર્ગને, તેની સંપત્તિને, તથા તેની સત્તાને વિકાસની ઊંચામાં ઊંચી કષાએ પહોંચાડી દીધાં, અને મૂડીદાર વર્ગને દેશનો પ્રથમ વર્ગ બનાવી દીધો. તેના પરિણામે, જ્યાં જ્યાં એમ બન્યું

ત્યાં ત્યાં મૂડીદાર વર્ગો રાજકીય સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને અત્યાર સુધી સત્તાસ્થાને બેઠેલા વર્ગાની — ઉમરાવો તથા ગિલ્ડ-નગરવાસીઓ અને એ બેઉંચું પ્રતિનિધિત્વ કરતી આપખુદ રાજશાહીની — હકાલપટ્ટી કરી. મૂડીદાર વર્ગ વંશપરંપરાગત માલિકીની પ્રથાને અથવા જમીનકુપી મિલકતના વેચાળુની બંધીને તેમ જ ઉમરાવ વર્ગના ખાસ અધિકારોને નાખુદ કરી નાખીને ઉમરાવશાહીની, ઉમરાવ વર્ગની, તાકાતને ખતમ કરી નાખી. મૂડીદાર વર્ગ તમામ ગિલ્ડોને તથા કારીગરી સંબંધી ખાસ અધિકારોને નાખુદ કરી નાખીને ગિલ્ડ-નગરવાસીઓની તાકાતને ખતમ કરી નાખી. એ બેઉંચે સ્થાને તેણે મુક્ત હરીકાઈની સ્થાપના કરી, અર્થાત् સમાજની એવી પ્રથા સ્થાપી કે જેમાં દરેકને ઉદ્યોગની કોઈ પણ શાખા અપનાવવાનો અધિકાર હોય, અને જરૂરી મૂડીની ગેરહાજરી સિવાય બીજી કોઈ બાબત તેને એ સંબંધમાં રોકી ન શકે. એટલે મુક્ત હરીકાઈની સ્થાપના એવી ઘોષણા બની રહે છે કે હવેથી સમાજના સભ્યો કેવળ તેમની મૂડીની અસમાનતાના પ્રમાણમાં અસમાન રહેશે, મૂડી નિર્ણયક તાકાત છે, અને એટલે મૂડીદારો, મૂડીદાર વર્ગ, સમાજમાં પ્રથમ વર્ગનું સ્થાન ધરાવે છે. પરંતુ મુક્ત હરીકાઈ વિશાળ પાયાના ઉદ્યોગના આરંભમાં જરૂરી છે, કારણ કે વિશાળ પાયાના ઉદ્યોગની ઉન્નતિ સમાજની એવી પરિસ્થિતિમાં જ થઈ શકે. — મૂડીદાર વર્ગ ઉમરાવ વર્ગની તથા ગિલ્ડ-નગરવાસીઓની સામાજિક તાકાત એવી રીતે ખતમ કરી નાખ્યા પછી તરત જ તેઓની રાજકીય સત્તા પણ ખતમ કરી નાખી. મૂડીદાર વર્ગ સમાજમાં પ્રથમ વર્ગ બની ગયો એટલે તેણે રાજકીય કોત્રમાં પણ પોતાને પ્રથમ વર્ગ ઘોષિત કરી દીધો. તેણે પ્રતિનિધિ પ્રથાની સ્થાપના મારફત એમ કર્યું. એ પ્રથા કાનૂન સમક્ષ મૂડીવાદી સમાનતા ઉપર તથા મુક્ત હરીકાઈની કાનૂની માન્યતા ઉપર આધારિત છે, અને તેને યુરોપીય દેશોમાં બંધારણીય રાજશાહીના રૂપમાં દાખલ કરવામાં આવી હતી. એ બંધારણીય રાજશાહીઓમાં અમુક મૂડી ધરાવતા માણસો જ, અર્થાત् મૂડીદારો જ, મત આપવાનો અધિકાર ધરાવે છે, એવા મૂડીવાદી મતદારો પ્રતિનિધિઓને ચૂંટે છે, અને એવા મૂડીવાદી પ્રતિનિધિઓ માલ પૂરો પાણવાનો ઈન્કાર કરવાના અધિકાર મારફત મૂડીવાદી સરકાર ચૂંટે છે.

ત્રીજી વાત — ઔદ્યોગિક કાંતિના પરિણામે જેટલા પ્રમાણમાં મૂડીદાર વર્ગનો વિકાસ થયો એટલા જ પ્રમાણમાં સર્વહારા વર્ગનો વિકાસ થયો. જેટલા પ્રમાણમાં મૂડીદારને દોલત હાંસલ થઈ એટલા પ્રમાણમાં સર્વહારાઓની સંખ્યામાં

વધારો થયો. સર્વહારાઓને કેવળ મૂડી જ કામે રાખી શકે, અને મૂડીમાં વધારો મહેનતના ઉપયોગથી જ થઈ શકે, એટલે મૂડીની વૃદ્ધિની લોડાનેડ એકસરખા વેગે સર્વહારા વર્ગની વૃદ્ધિ થતી રહે છે. તેની સાથે સાથે, ઔદ્યોગિક કાંતિ મોટાં શહેરોમાં મૂડીદાર તથા સર્વહારાઓને એકત્રિત કરે છે, કારણ કે મોટાં શહેરોમાં ઉદ્યોગ અન્યાંત નફાકારક રોતે ચલાવી શકાય. વિશાળ સમુદ્ધારો એવી રીતે એક જગ્યાએ એકત્રિત થતાં, સર્વહારાઓ પોતાની તાકાત અંગે સભાન બને છે. વધુમાં—ઔદ્યોગિક કાંતિ નેમ નેમ વધારે વિકસે તેમ તેમ વધારે મશીનોની રચના થાય છે, તેના ઉપયોગથી શારીરિક મહેનતની આવશ્યકતા ખતમ થતી જાય છે, અને અમે કહી ચૂક્યા છીએ તેમ વિશાળ પાયાનો ઉદ્યોગ વેતનને લઘુતમ કષાએ ઉતારી નાખીને સર્વહારા વર્ગની હાલત વધારે ને વધારે અસત્ય બનાવી દે છે. એ રીતે, એક તરફ સર્વહારા વર્ગના વધતા જતા અસંતોષને કારણે અને બીજી તરફ તેની વધતી જતી તાકાતને કારણે, ઔદ્યોગિક કાંતિ સર્વહારા વર્ગને હાથે સામાન્યિક કાંતિનો માર્ગ તૈયાર કરે છે.

સવાલ ૧૨: ઔદ્યોગિક કાંતિનાં વધુ પરિણામો કેવાં છે?

જવાબ: વિશાળ પાયાના ઉદ્યોગે વરાળયાંત્ર અને બીજાં યંત્રોના રૂપમાં, ઔદ્યોગિક ઉત્પાદનને ઢૂંકા ગાળામાં તથા જરાક ખરચે અસીમ પ્રમાણમાં વધારી દેવાનું શક્ય બનાવતાં સાધનો પેદા કર્યા. વિશાળ પાયાના ઉદ્યોગના આવશ્યક પરિણામ સમી મુક્ત હરીકાઈએ, ઉત્પાદનની સરળતાને કારણે, થોડા વખતમાં જ અન્યાંત ઉગ્ર સ્વરૂપ અખન્યાર કરી લીધું. મૂડીદારો મોટી સંખ્યામાં ઉદ્યોગના ક્ષેત્રની અંદર દાખલ થઈ ગયા, અને બહુ ઝડપથી એવી હાલત પેદા થઈ ગઈ કે ઉત્પાદન જરૂરત કરતાં વધારે થવા લાગ્યું. પરિણામે, ઉત્પાદિત માલ વેચી ન શકાયો અને વ્યાપારી કટોકટી તરીકે ઓળખાતા સંજોગો ઊભા થયા. કારખાનાં બંધ થઈ ગયાં, કારખાનદારોએ દેવાળાં કાઢ્યાં, અને કામદારોની રોજી ખતમ થઈ ગઈ. કારમી કંગાલિયત ફેલાઈ ગઈ. થોડા વખતમાં વધારાનો માલ વેચાઈ ગયો, કારખાનાં પાછાં ચાલુ થઈ ગયાં, વેતનમાં વધારો થયો, અને ધીરે ધીરે વેપાર અગાઉ કરતાં વધારે તડામાર ચાલવા લાગ્યો. પરંતુ થોડા વખતની અંદર માલનું વળી પાછું વધારે પડતું ઉત્પાદન થઈ ગયું, વળી કટોકટી આવી, અને અગાઉની કટોકટીના કમ મુજબ જ ચાલી. એ રીતે,

ચાલુ સદીના આરંભથી ઉદ્યોગની હાવત સમૃદ્ધિના ગાળાઓ તથા કટોકટીના ગાળાઓ વચ્ચે ડેલતી રહી છે, પાંચથી સાત વરસના લગભગ નિયમિત મધ્યાંતરે એકસરખી કટોકટી આવતી રહી છે, કામદારોને અભૂતપૂર્વ અસાધું કંગાલિયતના ભોગ બનાવતી રહી છે, સામાન્ય કાંતિકારી જુવાળ પેદા કરતી રહી છે, અને સમગ્ર વર્તમાન પદ્ધતિ માટે બેહદ ભારે જોખમ ઊભું કરતી રહી છે.

સવાલ ૧૩: ફરી ફરીને નિયમિત આવતી આ વ્યાપારી કટોકટીઓનો શો નિષ્કર્ણ તારવી શકાય?

જવાબ: પહેલી વાત — વિશાળ પાયાના ઉદ્યોગના આરંભના તબક્કાઓમાં તેણે જ મુક્ત હરીફાઈને પેદા કરી હોવા છતાં, હવે તે મુક્ત હરીફાઈના માળખાથી વધારે વિકાસ પામી ચૂક્યો છે; હરીફાઈ તથા સામાન્ય રૂપે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઔદ્યોગિક ઉત્પાદનનું સંચાલન હવે વિશાળ પાયાના ઉદ્યોગને જકડતી બેડી બની ગયાં છે; વિશાળ પાયાના ઉદ્યોગે એ બેડીને તોડી નાખવી પડશે અને એ તેને તોડી નાખશે; વિશાળ પાયાના ઉદ્યોગને જ્યાં સુધી તેના વર્તમાન આધારે ચલાવવામાં આવશે ત્યાં સુધી તે દર સાત વરસે ફરી ફરીને આવતી સામાન્ય અંધાધુંધી — દર વખતે સમગ્ર સભ્યતા માટે જોખમ ઊભું કરતી અને સર્વહારાઓને કંગાલિયતના કૂવામાં ધકેલી દેવા ઉપરાંત એવી જ રીતે મોટી સંખ્યામાં મૂડીદારોને પણ પાયમાલીના ભોગ બનાવી દેનારી — મારફત જ ટકી રહી શકશે; એટબે કાં તો વિશાળ પાયાના ઉદ્યોગને તજી દેવો પડે — જે તદ્દન અશક્ય છે — અથવા સમાજનું પૂરેપૂરું નંબું સંઘટન આવશ્યક બની જાય કે જેમાં એકબીજાની જોડે હરીફાઈ કરતા અલગ અલગ કારખાનદારો ન રહે પરંતુ સમગ્ર સમાજ ઔદ્યોગિક ઉત્પાદનનું સંચાલન ચોક્કસ યોજના મુજબ તથા સૌની જરૂરિયાતો મુજબ કરે.

બીજી વાત — વિશાળ પાયાનો ઉદ્યોગ અને તેણે શક્ય બનાવેલું ઉત્પાદનનું અસીમ વિસ્તરણ નવી સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આણી શકે, અને એવા સમાજમાં જિંદગીની તમામ જરૂરિયાતોની ચીજોનું ઉત્પાદન એટલા વિપુલ પ્રમાણમાં કરવામાં આવે કે સમાજનો પ્રત્યેક સભ્ય પોતાની તમામ શક્તિઓ તથા કાંબેલિયતોને પૂર્ણતમ સ્વતંત્રતાથી વિકસાવી તથા અજમાવી શકે. એ રીતે, વિશાળ પાયાના ઉદ્યોગનું જે લક્ષણ વર્તમાન સમાજમાં સમગ્ર કંગાલિયત અને

તમામ વ્યાપારી કટોકટીઓ પેદા કરે છે, એ જ લક્ષણ, નિરાળા સામાજિક સંઘટનમાં, એ કંગાલિયતને અને વિનાશક તેજમંદીઓને ચોક્કસ રૂપે ખતમ કરી નાખશે.

એ રીતે, સાફું સાબિત થઈ જાય છે કે—

૧) અત્યારથી આ બધાં અનિષ્ટેના એકમાત્ર કારણ તરીકે એવી સામાજિક વ્યવસ્થાને જ ગાણાવી શકાય કે જે વર્તમાન સંજોગોને અનુરૂપ હવે નથી રહ્યી.

૨) નવી સામાજિક વ્યવસ્થાની સ્થાપના માર્ગથત આ બધાં અનિષ્ટેને તદ્દન નાભૂદ કરી નાખવાનો ઉપાય તૈયાર છે.

સવાલ ૧૪: એ નવી સામાજિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ?

જવાબ: નવી સામાજિક વ્યવસ્થા સૌપ્રથમ તો સામાન્ય રૂપે ઉદ્યોગનું તથા ઉત્પાદનની તમામ શાખાઓનું સંચાલન, માંહોમાંહે હરીકાઈ કરતા બિનસંકળાયેલા અલગ અલગ માણસોના હાથમાંથી લઈ લેશે, અને તેને બદલે, ઉત્પાદનની તમામ શાખાઓનું સંચાલન સમગ્ર સમાજ વતી કરશે, અર્થાત् સામાજિક યોજના મુજબ તથા સમાજના તમામ સભ્યોની સામેલગીરીથી કરશે. એ રીતે હરીકાઈને ખતમ કરી નાખવામાં આવશે અને તેનું સ્થાન સહજજીવન લઈ લેશે. અલગ અલગ માણસોના હાથે ઉદ્યોગના સંચાલનનું અનિવાર્ય પરિણામ ખાનગી માલિકીમાં આવે છે અને હરીકાઈ તો અલગ અલગ ખાનગી માલિકોના હાથે ઉદ્યોગના સંચાલનની એક રીત સિવાય બીજું કર્શું નથી, એટલે ખાનગી માલિકીને ઉદ્યોગના વ્યક્તિગત સંચાલનથી તથા હરીકાઈથી છૂટી ન પાડી શકાય. એટલે, ખાનગી માલિકીને પણ નાભૂદ કરી નાખવામાં આવશે, અને તેને બદલે ઉત્પાદનનાં તમામ સાધનોનો સહિયારો ઉપયોગ કરવામાં આવશે તથા ઉત્પાદિત ચીજેની વહેંચણી સર્વસંમતિથી કરવામાં આવશે, અથવા માલનો સહિયારો ઉપભોગ સ્થાપવામાં આવશે. ઉદ્યોગના વિકાસમાંથી અનિવાર્ય રૂપે પેદા થતી સમગ્ર સામાજિક પદ્ધતિના રૂપાંતરની અત્યારે સંક્ષિપ્ત તથા અત્યારે લાક્ષણિક મુદ્દાસર અભિવ્યક્તિ ખાનગી માલિકીની નાભૂદી છે, અને એટલે યોગ્ય જ છે કે કોમ્પ્યુનિસ્ટોએ તેને મુખ્ય માંગ તરીકે રજૂ કરી છે.

સવાલ ૧૫: એટલે ખાનગી મિલકતની નાભૂદી અગાઉ શું અશક્ય હતી?

જવાબ: ખરી વાત. સામાજિક વ્યવસ્થામાં પ્રત્યેક પરિવર્તન, મિલકત સંબંધોમાં પ્રત્યેક કાંતિ, પુરાણા મિલકત સંબંધોને અનુરૂપ ન બનતાં નવાં

ઉત્પાદક પરિબળોના સર્જનનું આવશ્યક પરિણામ હોય છે. ખુદ ખાનગી મિલકતનો ઉદ્ય એવી રીતે થયો હતો. ખાનગી મિલકત સદાસર્વદા અસ્તિત્વમાં નથી રહી. મધ્યયુગના અંતિમ ગાળામાં ઉત્પાદનની નવી રીત મેન્યુફેક્ચરના રૂપમાં દાખલ કરવામાં આવી. એ રીત તત્કાલીન સામંતી અને ગિલ્ડ મિલકત જોડે અસંગત હતી. પુરાણા મિલકત સંબંધોના માળખાથી વધારે વિકાસ પામેલા મેન્યુફેક્ચરે માલિકીનું નવું રૂપ પેદા કર્યું — ખાનગી માલિકી પેદા કરી. મેન્યુફેક્ચરના ગાળામાં અને વિશાળ પાયાના ઉદ્ઘોગના વિકાસના પહેલા તબક્કામાં, ખાનગી માલિકી સિવાય મિલકતનું બીજું કોઈ રૂપ શક્ય નહોતું, ખાનગી માલિકી ઉપર આધારિત સમાજ વ્યવસ્થા સિવાય બીજી કોઈ સમાજ વ્યવસ્થા શક્ય નહોતી. સૌને પૂરું પાડવા જેટલું જ નહિ, પરંતુ સામાજિક મૂડીની વૃદ્ધિ સારુ તેમ જ ઉત્પાદક પરિબળોના અધિક વિકાસ સારુ ઉત્પાદિત ચીજો પૂરી પાડવા માટે પણ, પૂરતું ઉત્પાદન જ્યાં સુધી ન થઈ શકે ત્યાં સુધી, ઉત્પાદક પરિબળોનો હક્કેમ વર્ચસ્વી વર્ગ તથા ગરીબ પીડિત વર્ગ અસ્તિત્વમાં રહેવાના જ. એ વર્ગો કેવી રીતે રચાય છે તેનો આધાર ઉત્પાદનના વિકાસના તબક્કા ઉપર રહેશે. ખેતીવાડી ઉપર આધારિત મધ્યયુગમાં આપણને ઉમરાવ અને ખેતગુલામ જોવા મળે છે, મધ્યયુગના ત્યાર પછીના ગાળામાં આપણને શહેરોમાં ગિલ્ડ-માસ્ટરો અને તેના શિખાઉ કારીગરો તથા દહાડિયાઓ જોવા મળે છે, સત્તરમી સદીમાં મેન્યુફેક્ચર માલિકો અને મેન્યુફેક્ચર કામદારો જોવા મળે છે, અને ઓગણીસમી સદીમાં મોટો કારખાનદાર અને સર્વહારા જોવા મળે છે. સાફ છે કે એ વખત સુધી ઉત્પાદક પરિબળોનો વિકાસ હજુ એટલો બખોળો નહોતો થયો કે સૌને માટે પૂરતો માલ પેદા થાય અને એ ઉત્પાદક પરિબળો માટે ખાનગી મિલકત જંજર બની જાય, અવરોધ બની જાય. પરંતુ હવે વિશાળ પાયાના ઉદ્ઘોગના વિકાસના પરિણામે જ્યારે — પહેલી વાત — મૂડી તથા ઉત્પાદક પરિબળોનું સર્જન અભૂતપૂર્વ પાયા ઉપર થયું છે, અને એ ઉત્પાદક પરિબળોમાં ટૂંકા ગાળાની અંદર અંતહીન રૂપે અનેક ગણી વૃદ્ધિ કરવાનાં સાધનો હયાત છે; બીજી વાત — એ ઉત્પાદક પરિબળો થોડાક મૂડીદારોના હાથમાં કેદ્દીત થઈ ગયાં છે અને લોકોનો વિશાળ સમુદ્દર વધારે ને વધારે પ્રમાણમાં સર્વહારા વર્ગની કતારોમાં ધકેલાઈ રહ્યો છે, અને મૂડીદારની દોલતમાં થતી અનેક ગણી વૃદ્ધિ જેટલા જ પ્રમાણમાં એ લોકોની હાલત વધારે ને વધારે કંગાલ તથા અસંખ બની રહી છે; ત્રીજી વાત — એ પ્રબળ અને સહેલાઈથી વૃદ્ધિ પામતાં ઉત્પાદક પરિબળો ખાનગી મિલકતના માળખા કરતાં અને મૂડીદાર

કરતાં એટલા પ્રચંડ પ્રમાણમાં વધી ગયાં છે કે તેઓ સામાજિક વ્યવસ્થામાં સતત ભયંકર ઊથલપાથલ પેદા કરી રહ્યાં છે—ત્યારે જ, ખાનગી મિલકતની નાબૂદી હવે શક્ય બની છે એટલું જ નહિ પરંતુ તદ્દન આવશ્યક પણ બની ગઈ છે.

સવાલ ૧૬: ખાનગી મિલકતની નાબૂદી શાંતિની રીતો વડે થશે ખરી?

જવાબ: મંધા રાખીએ કે એમ બની શકે, અને કોમ્યુનિસ્ટો તેનો પ્રતિકાર ચોક્કસ નહિ જ કરે. કોમ્યુનિસ્ટો સારી રીતે જાણે છે કે તમામ કાવતરાં કેવળ વ્યર્થ જ નહિ પરંતુ હાનિકર પણ હોય છે. તેઓ સારી રીતે જાણે છે કે કાંતિઓ ઈરાદો બાંધીને તથા આપમરજી મુજલ્બ નથી કરી શકતી. કાંતિઓ તો સર્વત્ર અને સદૈવ, વિશિષ્ટ પાર્ટીઓ તથા સમગ્ર વગ્નોની નેતાણીરીના સંકલ્પથી તદ્દન સ્વતંત્ર સંઝેગોનું આવશ્યક પરિણામ હોય છે. પરંતુ કોમ્યુનિસ્ટો તેની સાથે સાથે સમજે પણ છે કે લગભગ દરેક સભ્ય દેશમાં સર્વહારા વર્ગના વિકાસને બળજબરીથી રૂંધવામાં આવે છે, અને તેના પરિણામે કોમ્યુનિસ્ટોના વિરોધીઓ કાંતિને દરેક રીતે પ્રવેગ આપવાની કામગીરી કરે છે. અંતમાં પીડિત સર્વહારા વર્ગનિ કાંતિ કરવાની હાલતમાં ધ્કેલી દેવામાં આવે તો અમે કોમ્યુનિસ્ટો સર્વહારાઓનો બચાવ હાલ નેવી રીતે વાણીમાં કરી રહ્યા છીએ એવી જ રીતે ત્યારે કૃત્યોમાં કરીશું.

સવાલ ૧૭: ખાનગી મિલકતને એક ઝટકે નાબૂદ કરી નાખવાનું શક્ય બનશે ખરું?

જવાબ: ના, સહિયારી મિલકતના સર્જન માટે ઉત્પાદક પરિબળોમાં આવશ્યક પ્રમાણમાં વૃદ્ધ એક ઝટકે જેટલી અશક્ય છે, એટલું જ અશક્ય એ પણ છે. એટલે, પૂરા સંભવિત રૂપે નજીક આવી રહેલી સર્વહારા કાંતિ વર્તમાન સમાજનું રૂપાંતર કેવળ ધીરે ધીરે જ કરી શકશે, અને ઉત્પાદનનાં સાધનોનો આવશ્યક જથ્થો પેદા થઈ જય ત્યારે જ ખાનગી માલિકીને નાબૂદ કરશે.

સવાલ ૧૮: એ કાંતિનો કુમ કેવો રહેશે?

જવાબ: એ કાંતિ સૌપ્રથમ તો લોકશાહી બંધારણ અમલમાં મૂકશે અને એ રીતે સર્વહારા વર્ગના પ્રત્યક્ષ કે પરોક્ષ શાસનનો આરંભ કરશે—ઇંગ્લાંડમાં સર્વહારા વર્ગ જનતાની બહુસંખ્યા બની ચુક્ક્યો છે ત્યાં પ્રત્યક્ષ, અને ફ્રાંસ તથા જર્મનીમાં પરોક્ષ, કારણ કે એ દેશોમાં સર્વહારાઓની જેડે નાના કિસાનો તથા મૂડીદારોને ઉમેરવામાં આવે ત્યારે જનતાની બહુસંખ્યા બને છે, એ વગ્નો

રાજકીય હિતોની વૃદ્ધિએ વધારે ને વધારે પ્રમાણમાં સર્વહારા વર્ગની ઉપર અવલંબિત બનતા જાય છે અને એટલે થોડા વખતમાં સર્વહારા વર્ગની માંગોને આધીન થઈ જશે. આથી કદાચ બીજી લડત જરૂરી બનશે, કેવળ સર્વહારા વર્ગના વિજયમાં જ પરિણમે એવી લડત લડવામાં આવશે.

ખાનગી માલિકી ઉપર સીધો પ્રહાર કરતાં અધિક કદમો સાધવાના તેમ જ સર્વહારા વર્ગની હ્યાતી સલામત બનાવવાના ઉપાય તરીકે લોકશાહીનો ઉપયોગ તત્કાળ ન કરવામાં આવે તો તે સર્વહારા વર્ગ માટે તદ્દન નકામી બની જાય. વર્તમાન સંબંધોમાંથી હવે પરિણમી ચૂકેલાં એ કદમોમાંનાં મુખ્ય નીચે મુજબ છે:

૧. વૃદ્ધિશીલ આવકવેરા, ભારે વારસા કર, સીધા વંશજ સિવાય બીજાઓના (ભાઈઓ, ભાત્રીઓ, વગેરે) વારસાહકની નાબૂદી, ફરજિયાત ધિરાણો, વગેરે મારફત ખાનગી માલિકી ઉપર અંકુશ.

૨. જમીનદારો, કારખાનદારો, અને રેલવે તથા વહાણવટાના ઉદ્યોગપતિઓનું કમશા: માલિકીહરણ — અમુક અંશે રાજ્યના ઉદ્યોગની હરીકાઈ મારફત અને અમુક અંશે ચલાણી નોટોના રૂપમાં વળતર આપીને સીધું.

૩. પરદેશ વસવા ચાલ્યા જનારા તમામ માણસોની તેમ જ જનતાની બહુસંખ્યા સામે બળવા કરનારા તમામ માણસોની મિલકતની જગ્યા.

૪. રાષ્ટ્રીય માલિકીની જમીન, કારખાનાં, તથા વર્કશોપોમાં મહેનતનું અથવા સર્વહારાઓના કામનું સંઘટન કરવું, અને એ રીતે ખુદ કામદારોની અંદર ચાલતી હરીકાઈ ખતમ કરી નાખવી તથા કારખાનદારોની હ્યાતી કાપમ રહે ત્યાં સુધી તેમને ફરજ પાડવી કે તેઓ કામદારોને રાજ્ય તરફથી અપાતા વેતન જેટલું જ ઊંચું વેતન આપે.

૫. ખાનગી માલિકીની નાબૂદી પરિપૂર્ણ થઈ જાય ત્યાં સુધી કામની બાબતમાં સમાજના સંઘણા સભ્યોની સરખી જવાબદારી. ઔદ્યોગિક સૈન્યોની સ્થાપના — ખાસ કરીને જેતીવાડીમાં.

૬. રાજ્યની મૂડી ધરાવતી રાષ્ટ્રીય બેંકની સ્થાપના અને તમામ ખાનગી બેંકો તથા બેંક્રોના દમન મારફત ધિરાણ તથા બેંકિંગ પદ્ધતિઓનું રાજ્યને હસ્તક કેદ્દીકરણ.

૭. રાષ્ટ્રને હસ્તક મૂડી તથા કામદારોમાં જેટલા પ્રમાણમાં વૃદ્ધ થાય એટલા પ્રમાણમાં રાષ્ટ્રીય કારખાનાં, વર્કશોપો, રેલવે, તથા જહાજોની સંખ્યામાં વધારો

કરવો, પડતર જમીનમાં ખેતી ચાલુ કરવી, અને પહેલેથી જેડાતી જમીનમાં સુધારો કરવો.

૮. બાળકો માબાપની સારસંભાળથી છૂટાં થવા જેટલાં મોટાં થઈ જય એટલે તેમને રાષ્ટ્રીય સંસ્થાઓમાં અને રાષ્ટ્રીય ખરો શિક્ષણ આપવું. શિક્ષણનો ઉત્પાદન જેડે સમન્વય.

૯. ઉદ્યોગ તેમ જ ખેતીવાડીમાં કામ કરતા નાગરિકોના સમુદ્ઘાયોના સહિયારા વસ્વાટ માટે રાષ્ટ્રીય માલિકીની જમીનમાં વિશાળ મકાનો બાંધવાં, અને શહેરી જિંદગી તથા દેહાતી જિંદગીના લાભોનો સમન્વય એવી રીતે સાધવો કે નાગરિકોને એ બેમાંથી એકેયની એકાંગિતા અથવા ગેરલાભોના ભોગ ન બનવું પડે.

૧૦. આરોગ્યને હાનિકર તથા ખરાબ બાંધણુંનાં તમામ ધરો તથા મકાનોને પાડી નાખવાં.

૧૧. કાયદેસર તથા બિનકાયદેસર સંતાનોને એકસરખો વારસાહક.

૧૨. વાહનવ્યવહારનાં તમામ સાધનોનું રાષ્ટ્રના હાથમાં કેંદ્રીકરણ.

આ બધાં કદમ્ભોનો અમલ એકીસાથે બેશક ન થઈ શકે. પરંતુ હંમેશાં એકનો પાછળ પાછળ બીજું આવશે. એક વાર ખાનગી માલિકી ઉપર મૂળગામી હત્થો થઈ જય એટલે સર્વહારા વર્ગને આગળ ધપવું પડશે; અને સમગ્ર મૂડીને, સમગ્ર ખેતીવાડીને, સમગ્ર ઉદ્યોગને, સમગ્ર વાહનવ્યવહારને, તથા વિનિમયનાં તમામ સાધનોને રાજ્યને હસ્તક કેંદ્રિત કરવાં પડશે. આ બધાં કદમ્ભો એવાં પરિણામોની દિશામાં કામગીરી કરે છે, અને દેશનાં ઉત્પાદક પરિબળો સર્વહારા વર્ગની મહેનત મારફત જેટલા પ્રમાણમાં વૃદ્ધિ પામશે એટલા પ્રમાણમાં એ કદમ્ભો સાધ્ય બનશે તથા કેંદ્રીકરણની દિશામાં તેનાં પરિણામો એટલા પ્રમાણમાં વિકસિત થશે. છેલ્લે—જ્યારે સમગ્ર મૂડી, સમગ્ર ઉત્પાદન, અને સમગ્ર વિનિમય રાષ્ટ્રને હસ્તક કેંદ્રિત થઈ જશે ત્યાં સુધીમાં ખાનગી માલિકીની હ્યાતી આપમેળે ખતમ થઈ ગઈ હશે, નાણું બિનજરૂરી બની ગયું હશે, અને ઉત્પાદન એટલું વધી ગયું હશે તથા ઈન્સાનો એટલા બદલાઈ ગયા હશે કે પુરાણા સામાજિક સંબંધોનાં આખરી રૂપો પણ ખરી પડવાની હાલતમાં પહોંચી ગયાં હશે.

સવાલ ૧૯: એવી કાંતિ માત્ર એક જ દેશમાં થાય એ શક્ય છે ખરું?

જવાબ: ના. વિશાળ પાયાના ઉદ્ઘોગે વિશ્વ ભાજર પેદા કરીને પૃથ્વીની તમામ પ્રજાઓને, અને ખાસ કરીને સભ્ય પ્રજાઓને, એવી રીતે સાંકળી લીધી છે કે દરેક પ્રજાનો આધાર બીજી પ્રજાની હાલત ઉપર હોય છે. વધુમાં, વિશાળ પાયાના ઉદ્ઘોગે સધળા દેશોના સામાજિક વિકાસને એટલો બધો એકસરખો બનાવી દીધો છે કે એ બધા દેશોમાં મૂડીદાર વર્ગ તથા સર્વહારા વર્ગ સમાજના જે નિર્ણયક વર્ગો બની ગયા છે, અને તેઓની વચ્ચેનો સંઘર્ષ વર્તમાન સમયનો મુખ્ય સંઘર્ષ બની ગયો છે. એટલે સામ્યવાદી કાંતિ કેવળ રાષ્ટ્રીય નહિ હોય. ઓછામાં ઓછું સધળા સભ્ય દેશોમાં — ઈંગ્લેઝ, અમેરિકા, ફ્રાંસ, તથા જર્મનીમાં — એવી કાંતિ એકીસાથે થશે. એ દેશોમાંથી પ્રત્યેકમાં લાંબા કે ટૂંકા ગાળાની અંદર તેના વિકાસનો આધાર એ બાબત ઉપર રહેશે કે કયો દેશ વધારે વિકસિત ઉદ્ઘોગ, વધારે સંપત્તિ, અને ઉત્પાદક પરિબળોનો વધારે મોટો સમૂહ ધરાવે છે. એટલે જર્મનીમાં તે સૌથી ઓછો વેગ ધારણ કરશે અને તેની સિદ્ધિ સૌથી વધારે મુશ્કેલ બનશે; ઈંગ્લેઝમાં તે સૌથી વધારે જડપી વેગ ધારણ કરશે અને તેની સિદ્ધિ સૌથી સહેલી બનશે. દુનિયાના બીજા દેશોની ઉપર પણ તે સારી પેઢે પ્રભાવ પાડશે, તેઓના વિકાસની અત્યાર સુધીની રીતને તદ્દન પવટાવી નાખશે અને તેઓના વિકાસને ભારે પ્રવેગ આપશે. એ તો વિશ્વ કાંતિ બનવાની છે અને એટલે તેનું મેદાન આખી દુનિયા હશે.

સવાલ ૨૦: ખાનગી માલિકીની આખરી નાભૂદીનાં પરિણામો કેવાં હશે?

જવાબ: તમામ ઉત્પાદક પરિબળોનો તથા વહેવારનાં સાધનોનો ઉપયોગ તેમ જ ઉત્પાદિત ચીજેનો વિનિમય તથા વહેચાણી ખાનગી મૂડીદારોના હાથમાંથી સમાજ કુબળે લઈ લેશે, અને ઉપલબ્ધ સાધનો તથા સમગ્ર સમાજની જરૂરિયાતો ઉપર આધારિત યોજના મુજબ તેનું સંચાલન કરશે, એટલે સૌપ્રથમ તો વિશાળ પાયાના ઉદ્ઘોગનાં વર્તમાન સમયનાં અનિષ્ટ પરિણામો દૂર થઈ જશે. કટોકટીઓ બંધ થઈ જશે. સમાજની વર્તમાન પદ્ધતિમાં અતિ-ઉત્પાદનની હાલત ઊભી કરતું અને એ રીતે કંગાલિયતનું પ્રબળ કારણ બની રહેતું વિસ્તૃત ઉત્પાદન ત્યારે પૂરું પણ નહિ પડે, અને તેને વધારે વિસ્તારવું પડશે. સમાજની તાત્કાલિક જરૂરિયાતોથી વધી જતું અતિ-ઉત્પાદન ત્યારે કંગાલિયત પેદા કરવાને બદલે સૌની જરૂરિયાતો સંતોષશે, નવી જરૂરિયાતો પેદા કરશે, અને સાથે સાથે નવી જરૂરિયાતોને સંતોષવાનાં સાધનો પેદા કરશે. એ તો અધિક પ્રગતિની

શરત અને પ્રવેગક બની રહ્યો, અત્યાર સુધી બનતું રહ્યું છે તેમ સામાજિક વ્યવસ્થાને અંધાધૂધીમાં સંડોવી દીધા વગર તે પ્રગતિ સાધ્યો. વિશાળ પાયાનો ઉદ્યોગ એક વાર ખાનગી માલિકીની ધૂસરીથી મુક્ત થઈ જશે એટલે તેનો વિકાસ એવા પ્રચંડ પાયા ઉપર થશે કે આપણને તેના વિકાસનો વર્તમાન સ્તર, આપણા યુગના વિશાળ પાયાના ઉદ્યોગની સરખામણીમાં, મેન્યુફેફર પદ્ધતિના વિકાસ જેવો નજીવો લાગશે. ઉદ્યોગનો એવો વિકાસ સમાજને ઉત્પાદિત ચીજેનો એટલો જથ્યો પૂરો પાડશે કે જેથી સૌની જરૂરિયાતો સંતોષાય. ખાનગી માલિકીના દબાસથી અને જમીનના નાના નાના ટુકડા પડી જવાથી અવરોધાતી ઝેતીવાડી પણ, ઉપલબ્ધ સુધારણાઓ તથા વૈજ્ઞાનિક સિદ્ધિઓના અમલના પરિણામે, નવી ઉન્નતિ સાધશે અને સમાજને ચીજેનો વિપુલ જથ્યો પૂરો પાડશે. એ રીતે, સમાજના તમામ સભ્યોની જરૂરિયાતો સંતોષે એવી વહેંચણી માટે સમાજ પૂરતા પ્રમાણમાં ચીજેનું ઉત્પાદન કરશે. તેના પરિણામે, સમાજનું વિવિધ વેરભાવી વર્ગોમાં વિભાજન બિનજરૂરી બની જશે. તે બિનજરૂરી બની જશે એટલું જ નહિ પરંતુ નવી સામાજિક વ્યવસ્થા જેડે અસંગત પણ બની જશે. વર્ગો મહેનતના વિભાજન મારફત અસ્તિત્વમાં આવ્યા છે, અને મહેનતના વિભાજનનું અત્યાર સુધી હ્યાત રૂપ તદ્દન અદૃશ્ય થઈ જશે. ઔદ્યોગિક તથા ઝેતીવાડીના ઉત્પાદનને નિર્દ્ધિપિત હંચી કક્ષાઓ સુધી વિકસાવવા માટે કેવળ યાંત્રિક તથા રાસાયણિક સહાયક સાધનો જ પૂરતાં ન થાય, એ સહાયક સાધનોને ગતિમાન કરનારા લોકોની શક્તિઓને પણ એવી જ રીતે સરખા પ્રમાણમાં ખીલવવી જોઈએ. ગઈ સદીમાં કિસાનો તથા મેન્યુફેફર કામદારો વિશાળ પાયાના ઉદ્યોગમાં ઝોચાયા ત્યારે જેવી રીતે તેમને પોતાની જિંદગીની આખી રીત બદલવી પડેલી, અને તદ્દન નિરાળા ઈન્સાનો બની જવું પડેલું, એવી જ રીતે, સમગ્ર સમાજને ઉસ્તક ઉત્પાદનની સહિયારી વ્યવસ્થા અને તેમાંથી પરિણમતો ઉત્પાદનનો નવો વિકાસ તદ્દન નિરાળા ઈન્સાનોને આવશ્યક બનાવે છે, અને તેમનું ધડતર પણ કરે છે. આને દરેક અલગ માણસને ઉત્પાદનની એક શાખા સોંપવામાં આવે છે, એ માણસ તેની જેડે જકડાયેલો હોય છે, તેના શોષણનો ભોગ બનેલો હોય છે, દરેક માણસે બાડીના સૌને ભોગે પોતાની માત્ર એક જ કાબેલિયત ખીલવી હોય છે, દરેક માણસ સમગ્ર ઉત્પાદનની માત્ર એક જ શાખા અથવા કેવળ શાખાનીએ શાખા વિશે જ વાકેફગાર હોય છે. આને લોકો જેવા છે એવી હાલતમાં તેઓ ઉત્પાદનની

સહિયારી વ્યવસ્થા ન સંભાળી શકે. સમકાળીન ઉદ્યોગમાં પણ એવા માપુસો ઓછા ને ઓછા ઉપયોગી બનતા જાય છે. સમગ્ર સમાજ દ્વારા સંયુક્ત રીતે અને યોજના મુજબ સંચાલિત ઉદ્યોગમાં સંપૂર્ણ પૂર્વધારણા એવા માપુસોની કરવામાં આવે છે કે જેમની શક્તિઓનો સર્વાંગી વિકાસ થયો હોય અને જેઓ ઉત્પાદનની સમગ્ર પદ્ધતિને આવરી લેવાની શક્તિ ધરાવતા હોય. એટલે, એકને કિસાન, બીજાને મોચી, ત્રીજાને કારખાનાનો કામદાર, અને ચોથાને શેરદલાલ બનાવનારા મહેનતના કે વિભાજનને થંગ પદ્ધતિએ કમજોર બનાવી દીધું છે તે તદ્દન અદૃશ્ય થઈ જશે. શિક્ષાશ તરુણ લોકો માટે ઉત્પાદનની સમગ્ર પદ્ધતિનો ઝડપથી પરિચય સાધવાનું શક્ય બનાવશે, તેમને માટે સામાજિક જરૂરિયાતો મુજબ અથવા પોતાની ઈચ્છા મુજબ ઉદ્યોગની એક શાખામાંથી બીજી શાખામાં જવાનું શક્ય બનાવશે. એટલે, મહેનતના વર્તમાન વિભાજનને સૌની ઉપર લાદેલી વિકાસની એકાંગિતાને તે નાભૂદ કરી નાખશે. એ રીતે, સામ્યવાદી રીતે સંઘટિત સમાજ તેના સભ્યોને તેમની સર્વાંગી વિકસિત શક્તિઓનો ઉપયોગ સર્વાંગી રીતે કરવાની તક પૂરી પાડશે. તેની સાથે સાથે, વિવિધ વર્ગો આવશ્યક રૂપે અદૃશ્ય થઈ જશે. એ રીતે, એક તરફ સામ્યવાદી રીતે સંઘટિત સમાજ વર્ગોના અસ્તિત્વ જોડે અસંગત છે, અને બીજી તરફ એવા સમાજનું ધડતર જ એ વર્ગભિડોને ખતમ કરી નાખવાનું સાધન પૂરું પાડે છે.

આ બધામાંથી એવું તારણ નીકળે છે કે શહેર અને ગામ વર્ચ્યેની વિષમતા પણ એવી જ રીતે અદૃશ્ય થઈ જશે. જેતીવાડી તથા ઔદ્યોગિક ઉત્પાદનનું કામ બે જુદા જુદા વર્ગોને બદલે એકના એક લોકોને હાથે થાય એ તો નિર્ભેણ ભૌતિક કારણોસર પણ સામ્યવાદી સહજીવનની આવશ્યક શરત છે. જેતીવાડીનું કામ કરતી વસતિની આખા દેશમાં વેરવિભેર હાલત, અને તેની સાથે સાથે મોટાં શહેરોમાં ઔદ્યોગિક વસતિનો ભીયોભીય જમાવ—એવી હાલત તો જેતીવાડી તથા ઉદ્યોગના કેવળ અવિકસિત તખક્કાને જ અનુરૂપ છે, સધળા અધિક વિકાસના માર્ગમાં અવરોધ છે, અને તે અત્યારથી જ ખૂબ સૃપણ બની રહ્યો છે.

ઉત્પાદક પરિબળોના સહિયારા અને આયોજિત ઉપયોગ માટે સમાજના તમામ સભ્યોનું સામાન્ય સહજીવન, સૌની જરૂરિયાતો સંતોષવા માટે પૂરનું થાય એટલા પ્રમાણમાં ઉત્પાદનનું વિસ્તરણ, કેટલાકની જરૂરિયાતો બીજાઓને

ભોગે સંતોષવામાં આવે એવી હાલતનો ખાતમો, વર્ગો તથા તેઓની વચ્ચેની વિષમતાઓની તદ્દન નાબૂદી, અને મહેનતના અત્યાર સુધી પ્રવર્તમાન વિભાજનની નાબૂદી મારફત, ઔદ્યોગિક શિક્ષણ મારફત, પ્રવૃત્તિમાં પરિવર્તન મારફત, સૌઅં પેદા કરેલી ન્યામતોમાં સૌના ભાગ મારફત, તેમ જ શહેરો તથા ગામોની એકરૂપતા મારફત સમાજના તમામ સભ્યોની શક્તિઓની સર્વાંગી ભિલવણી—આનગી માલિકીની નાબૂદીથી એવાં મુખ્ય પરિણામોની અપેક્ષા રાની શક્યા.

સવાલ ૨૧: સમાજની સામ્યવાદી વ્યવસ્થા પરિવાર ઉપર કેવી અસર પાડશે?

જવાબ: તેમાં નર અને નારી વચ્ચેના સંબંધોની બાબત કેવળ સંડેવાયેલી વિક્ષિતાઓની જ નિર્ભેણ અંગત બાબત હશે, અને સમાજ એ સંબંધોમાં મુદ્દલ દખલગીરી નહિ કરી શકે. સામ્યવાદી સમાજ વ્યવસ્થામાં એમ કરી શકાશે કારણ કે ખાનગી મિલકતને નાબૂદ કરી નાખવામાં આવશે તથા બાળકોને સમાજ તરફથી શિક્ષણ આપવામાં આવશે, અને એ રીતે અત્યાર સુધી પ્રવર્તમાન પરિવારના ખાનગી મિલકતે ખડા કરેલા બે આધારસંભોને—પતિ ઉપર પત્નીના અવલંબનને અને માબાપ ઉપર બાળકોના અવલંબનને—ખતમ કરી નાખશે. સામ્યવાદમાં ખીઓને સૌની સહિયારી બનાવી દેવામાં આવશે એમ કહીને તેની વિરુદ્ધ બરાડા પાડતા નીતિનિયમોના રખેવાળ કૂપમંડૂકોને અમારો જવાબ એવો છે. ખીઓને સૌની સહિયારી રાખવાના સામાજિક સંબંધો પૂર્ણ રૂપે મૂડીવાદી સમાજના જ છે, અને આજે વેશ્યાપ્રથાના પરિપૂર્ણ રૂપમાં હ્યાત છે. પરંતુ વેશ્યાપ્રથાનાં મૂળિયાં ખાનગી મિલકતમાં છે, અને ખાનગી મિલકતની નાબૂદીની સાથે સાથે તે ખતમ થઈ જય છે. એટલે, સામ્યવાદી સમાજ વ્યવસ્થા ખીઓને સૌની સહિયારી નહિ બનાવી દે, પરંતુ એથી ઊલંડું, એવી હાલતને ખતમ કરી નાખશે.

સવાલ ૨૨: વર્તમાન પ્રજાઓની બાબતમાં સામ્યવાદી સમાજ વ્યવસ્થાનું વલણ કેવું હશે?

— મૂળ જવાબ જેમનો તેમ.⁴⁰

સવાલ ૨૩: વર્તમાન ધર્મો પ્રત્યે તેમાં કેવું વલણ અખત્યાર કરવામાં આવશે?

— મૂળ જવાબ જેમનો તેમ.

સવાલ ૨૪: કોમ્યુનિસ્ટો સમાજવાદીઓથી કઈ રીતે જુદા પડે છે?

જવાબ: કહેવાતા સમાજવાદીઓને ત્રણ જૂથોમાં વિલાનિત કરી શકાય.

પહેલું જૂથ સામંતી તથા પિતૃશાસિત સમાજના હિમાયતીઓનું બનેલું છે. વિશાળ પાયાનો ઉદ્ઘોગ તથા વિશ્વ બજાર, તેમ જ એ બેઠાએ પેદા કરેલો મૂડીવાદી સમાજ, સામંતી તથા પિતૃશાસિત સમાજને નષ્ટ કરતાં રહ્યાં છે અને હજુ પણ દરરોજ નષ્ટ કરી રહ્યાં છે. આ જૂથ વર્તમાન સમાજનાં અનિષ્ટોમાંથી એવો નિર્ઝર્ખ તાર્યે છે કે સામંતી તથા પિતૃશાસિત સમાજ ફરી વાર સ્થાપવો જોઈએ કરાણ કે તે આ અનિષ્ટોથી મુક્ત હતો. તેમની તમામ દરખાસ્તો સીધી અથવા આડકતરી રીતે એ દિશામાં લક્ષ્યાંકિત છે. પ્રત્યાધાતી સમાજવાદીઓનું આ જ્યથ સર્વહારા વર્ગની હાડમારીઓ અંગે કહેવાતી હમદર્દી દાખવે છે અને ઊનાં આંસુ ટપકાવે છે, પરંતુ તે છતાં કોમ્યુનિસ્ટો તેમનો સખત વિરોધ કરેશે જ, કારણ કે—

૧) તેઓ કશુંક તદ્દન અશક્ય સિદ્ધ કરવાની જહેમતો કરે છે;

૨) ઉમરાવ વર્ગ, ગિલ્ડ-માસ્ટરો, તથા મેન્યુફેક્ચરરોનું અને તેઓના રસાલાના આપખુદ અથવા સામંતી રાજાઓ, અમલદારો, સિપાહીઓ, તથા પાદરીઓનું શાસન ફરી સ્થાપવાની એ સમાજવાદીઓ કોશિશ કરે છે, તેઓ એવો સમાજ ફરી સ્થાપવા માગે છે કે જે વર્તમાન સમાજની ભામીઓથી તો મુક્ત હતો, પરંતુ ખુદ પાતાનાં ઓછામાં ઓછાં એટલાં જ અનિષ્ટો ધરાવતો હતો, અને સામ્યવાદી સમાજ વ્યવસ્થા મારફત પીડિત કામદારોની મુક્તિની સંભાવના પણ નહોતો ધરાવતો;

૩) જ્યારે જ્યારે સર્વહારા વર્ગ કાંતિકારી અને સામ્યવાદી બને ત્યારે એ સમાજવાદીઓ પોતાની અસહી મુરાદો છતી કરી દે છે અને તત્કાળ સર્વહારાઓની સામે મૂડીદાર વર્ગની જોડે એકસંપી કરી લે છે.

બીજું જૂથ વર્તમાન સમાજના હિમાયતીઓનું બનેલું છે. વર્તમાન સમાજે અનિવાર્ય રૂપે પેદા કરેલાં અનિષ્ટો એ સમાજવાદીઓનાં મનમાં વર્તમાન સમાજની હયાતી અંગે ચિંતા જગાવે છે. એટલે તેઓ વર્તમાન સમાજ જોડે સંકળાયેલાં અનિષ્ટોને દૂર કરીને તેને સાબૂત રાખવાની કોશિશ કરે છે. એવે ઈરાદે તેમાંના કેટલાક જનકલ્યાણનાં વિવિધ પગલાં રંજૂ કરે છે, અને બીજા એવી અદ્ભુત સુધારા પદ્ધતિઓની હિમાયત કરે છે કે જે સમાજની મુનર્દાટનાના બહાના હેઠળ વર્તમાન સમાજના પાયાઓને જળવી રાખે, અને એ રીતે વર્તમાન સમાજને જ ટકાવી રાખે. કોમ્યુનિસ્ટોને એ મૂડીવાદી સમાજવાદીઓનો પણ સતત

વિરોધ કરવો પડ્યો, કારણ કે તેઓ કોમ્પ્યુનિસ્ટોના દુશ્મનોની કામગીરી કરે છે, અને કોમ્પ્યુનિસ્ટો જે સમાજને ખતમ કરી નાખવા માગે છે તેનો બચાવ કરે છે.

ઇલ્લે — ત્રીજું જૂથ લોકશાહીવાદી સમાજવાદીઓનું બનેલું છે. કોમ્પ્યુનિસ્ટોની જેમ જ તેઓ સંબંધિત કદમો* માંથી અમૃકનો અમલ ઈચ્છે છે ખરા, પરંતુ સામ્યવાદમાં સંકમણના ઉપાય તરીકે નહિ. તેઓ તો વર્તમાન સમાજની કંગાલિયત અને અનિષ્ટોની નાભૂદી માટે પૂરતાં કદમો તરીકે જ એ કદમોનો અમલ ઈચ્છે છે. એ લોકશાહીવાદી સમાજવાદીઓ કાં તો એવા સર્વહારાઓ છે કે જે પોતાના વર્ગની મુક્તિ માટેના સંઝેગો અંગે પૂરતા વાકેફાર નથી બન્યા, અથવા નાના મૂડીદારોના પ્રતિનિધિઓ છે. જ્યાં સુધી લોકશાહી જીતી લેવાનું અને ત્યાર પછી ઉદાવવાનાં સમાજવાદી કદમોના અમલનું કાર્ય સંદર્ભ ન થઈ જાય ત્યાં સુધી નાના મૂડીદારોનો એ વર્ગ સર્વહારા વર્ગની જોડે ધાર્યો દૃષ્ટિએ એકસરખાં હિતો ધરાવે છે. એટલે પ્રવૃત્તિની વેળાએ કોમ્પ્યુનિસ્ટોને લોકશાહીવાદી સમાજવાદીઓ જોડે સમજૂતી કરી લેવી પડ્યો, અને ઓછામાં ઓછું એવી વેળાએ તો, એ લોકશાહીવાદી સમાજવાદીઓ શાસક મૂડીદાર વર્ગના ચાકરો ન બની જાય અને કોમ્પ્યુનિસ્ટોની ઉપર પ્રાહારો ન કરે ત્યાં સુધી, કોમ્પ્યુનિસ્ટોને તેમની જોડે જ્યારે શક્ય બને ત્યારે સામાન્ય રૂપે સહિયારી નીતિ અપનાવવી પડ્યો. સ્પષ્ટ છે કે તેમની જોડેના મતબેદોની ચચને એવી સહિયારી પ્રવૃત્તિ બકાત નથી રાખતી.

સવાલ ૨૫: આપણા જમાનાની બીજી રાજકીય પાર્ટીઓ પ્રત્યે કોમ્પ્યુનિસ્ટોનું વલાશ કેવું છે?

જવાબ: એ વલાશ જુદા જુદા દેશોમાં જુદું જુદું હોય છે. મૂડીદાર વર્ગનું શાસન ધરાવતા ઈંગ્લેઝ, ફ્રાંસ, તથા બેલિન્યમમાં કોમ્પ્યુનિસ્ટો હાલ પૂરતા હજી વિવિધ લોકશાહીવાદી પાર્ટીઓ જોડે સમાન હિતો ધરાવે છે. લોકશાહીવાદીઓ હાલ દરેક ઢેકાણે જે સમાજવાદી કદમોની હિમાયત કરે છે એ કદમો કોમ્પ્યુનિસ્ટોનાં

* અહીંથીં હસ્તપ્રતમાં ખાલી જગ્યા છે. ૧૮મા સવાલનો જવાબ જુઓ. — સં.

લક્ષ્યોને જેટલાં વધારે મળતાં આવે, અર્થાત् તેઓ જેટલા વધારે સ્પષ્ટ તથા ચોક્કસ રૂપમાં સર્વહારા વર્ગનાં હિતોનું સમર્થન કરે અને સર્વહારા વર્ગ તરફ ઢો, એટલા પ્રમાણમાં હિતોની એવી એકતા વધારે સભ્ર બને. દાખલા તરીકે દંગલોં ડમાં ચાર્ટિસ્ટો બધા કામદારો છે, અને તેઓ લોકશાહીવાદી નાના મૂડીદાર અથવા કહેવાતા રેડિકલોની સરખામણીમાં, અનહદ પ્રમાણમાં કોમ્યુનિસ્ટોની નજીક છે.

અમેરિકામાં લોકશાહી બંધારણ દાખલ કરવામાં આવ્યું છે. ત્યાં કોમ્યુનિસ્ટોએ એવી પાર્ટી જેડે સમાન ધ્યેયની એકસાંપી સાધવી જોઈએ કે જે એ બંધારણને મૂડીદાર વર્ગની સામે લાગુ કરે અને સર્વહારા વર્ગના હિતમાં તેનો ઉપયોગ કરે—અર્થાત् રાષ્ટ્રીય ઝેતીજીવન સુધારકોની જેડે સમાન ધ્યેયની એકસાંપી સાધવી જોઈએ.

સ્વિટ્જરલોંડમાં રેડિકલો હજુ ખૂબ મિશ્રિત પાર્ટી છે, પરંતુ તે છતાં કોમ્યુનિસ્ટો જેની જેડે કશો સંબંધ રાખી શકે એવા લોકો માત્ર તેઓ જ છે. વળી એ રેડિકલોમાં વાઉદ તથા જિનિવા વિસ્તારોના રેડિકલો વધારેમાં વધારે પ્રગતિશીલ છે.

છેલ્લે—જર્મનીમાં મૂડીદાર વર્ગ અને આપખુદ રાજશાહી વચ્ચેનો નિર્ણયક સંઘર્ષ હજુ આવવાનો છે. પરંતુ સત્તા મૂડીદાર વર્ગના હાથમાં ન આવે ત્યાં સુધી કોમ્યુનિસ્ટો મૂડીદાર વર્ગની વિરુદ્ધ નિર્ણયક સંઘર્ષ લડી ન શકે, એટલે કોમ્યુનિસ્ટોના હિતમાં છે કે તેઓ મૂડીદાર વર્ગને બને એટલી ઝડપથી સત્તા હાંસલ કરી લેવામાં મદદ કરે, જેથી મૂડીદાર વર્ગને બને એટલો વહેલો ઉથલાવી પારી શકાય. એટલે કોમ્યુનિસ્ટોએ હંમેશાં સરકારોની વિરુદ્ધ વિભરલ મૂડીદારનો પક્ષ લેવો જોઈએ, પરંતુ સાથે સાથે કોમ્યુનિસ્ટોએ ચેતતા રહેવું જોઈએ કે તેઓ ક્યાંક મૂડીદારની આત્મવંચનામાં સહભાગી ન બની જય, અથવા મૂડીદાર વર્ગની લલચામણી જાહેરાતો માની ન લે કે તેનો વિજય સર્વહારા વર્ગ માટે લાભદાયક સુફળો પેદા કરશે. મૂડીદાર વર્ગના વિજયથી કોમ્યુનિસ્ટોને માત્ર આટલા જ ફાયદા થશે: ૧) વિવિધ દ્યૂટ્યાટો મળશે જેથી કોમ્યુનિસ્ટો માટે પોતાના સિદ્ધાંતોનો બચાવ, ચર્ચાવિચારણા, તથા પ્રસાર સરળ બનશે, અને એ રીતે સર્વહારા વર્ગને સુધાર, લડાયક, તથા સુસંગઠિત વર્ગના રૂપમાં એકતાબદ્ધ કરવાનું સરળ બનશે; અને ૨) ખાતરી ઊભી થશે કે જે દિવસે

આપખુદ સરકારોને ઉથલાવી પાડવામાં આવે તે દિવસથી મૂડીદાર અને સર્વહારાઓ વર્ચ્યેનો સંઘર્ષ શરૂ થઈ જશે. કોમ્પ્યુનિસ્ટોની પાર્ટી મૂડીદાર વર્ગનું શાસન ધરાવતા દેશોમાં જેવી નીતિ ધરાવે છે એવી જ નીતિ તે દિવસથી જર્મનીમાં અપનાવી બેશે.

૧૮૪૭ના ઓક્ટોબર-નવેંબરમાં

અંગ્રેઝ્સે લખેલી કૃતિ

પહેલી વાર અલગ

પુસ્તકા રૂપે ૧૮૧૪માં

પ્રકાશિત

જર્મન વાચનાના

અંગ્રેજ્શ અનુવાદમાંથી

કરવામાં આવેલો

ગુજરાતી અનુવાદ

- ^૧ આ નિર્દેશ ૧૮૪૮ની ફ્રાંસની ફેબ્રુઆરી કાંતિ પ્રત્યે છે. — પૃ.૮.
- ^૨ આ નિર્દેશ ૧૮૪૮ના જૂનની ૨૩-૨૬ તારીખે પેરિસના સર્વહારા વર્ગ કરેલા વિષ્વવ પ્રત્યે છે. એ વિષ્વવ ૧૮૪૮-૧૮૪૯ દરમિયાન યુરોપમાં ફેલાઈ ગયેલા કાંતિના જુવાળની ચરમ કક્ષા સમે હતો. — પૃ.૮.
- ^૩ ૧૮૭૧નું પેરિસ કોમ્યુન — ૧૮૭૧માં પેરિસમાં સર્વહારા કાંતિના પરિણામે સ્થાપવામાં આવેલી કામદાર વર્ગની કાંતિકારી સરકાર. એ જગતમાં સર્વહારા વર્ગની સરમુખત્યારોનો પ્રથમ સરકાર હતી અને જુદી દિવસો સુધી (૧૮મી માર્ચથી ૨૮મી મે) હ્યાત રહી હતી. — પૃ.૧૦.
- ^૪ એ આવૃત્તિ ૧૮૬૮માં પ્રકાશિત થઈ હતી. ૧૮૮૮ની અંગ્રેજ આવૃત્તિની પ્રસ્તાવનામાં ‘કોમ્યુનિસ્ટ જહેરનામા’ના રશિયન અનુવાદના પ્રકાશનની તારીખ પણ ગલત આપવામાં આવી છે. — પૃ.૧૧.
- ^૫ કોલોકોલ (ધાંટ) — ૧૮૫૭થી ૧૮૬૭ સુધી અલેક્સાંડર હેર્ઝન અને નિકોલાઈ ઓગારોવિ પ્રકાશિત કરેલું રશિયન કાંતિકારી-લોકશાહીવાદી અભભાર. એ લંડનમાં (૧૮૫૭—૧૮૬૫) અને ત્યાર પછી જિનિવામાં (૧૮૬૫—૧૮૬૭) છપાતું હતું. — પૃ.૧૧.
- ^૬ આ નિર્દેશ ‘નારોદનાયા વોલ્યા’ના સભ્યોએ ૧૮૮૧ના માર્ચની પહેલી તારીખે અલેક્સાંડર બીજનું ખૂન કર્યું ત્યાર પછી રશિયાની પરિસ્થિતિ પ્રત્યે છે. ‘નારોદનાયા વોલ્યા’ સંગઠન (ત્રાસવાદી નરોદનીકો) તરફથી કાંતિકારી તોફાનો અને નવાં ત્રાસવાદી કૃત્યો કરવામાં આવશે એવી બિકે નવો જાર અલેક્સાંડર ત્રીજે ગાતરિના રહેવા ચાલ્યો ગયો હતો. — પૃ.૧૨.

⁷ ડાર્વિન, ચાર્લ્સ રોબર્ટ (૧૮૦૯—૧૮૮૨) — બ્રિટિશ પ્રકૃતિવિદ, ભૌતિકવાદી જીવવિજ્ઞાનનો સંસ્થાપક. તેણે વિપુલ જીવવૈજ્ઞાનિક સામગ્રીના આધારે સજ્જવ પ્રકૃતિની ઉત્કાંતિનો સિદ્ધાંત નિરૂપિત કર્યો હતો. તેણે બતાવ્યું કે ઓર્ગનિક જગત સાદાં રૂપોમંથી જટિલ રૂપોમાં વિકાસ પામે છે, નવાં રૂપોનો ઉગમ અને પુરાણાં રૂપોનો વિનાશ પ્રાકૃતિક (ઐતિહાસિક) વિકાસનું પરિણામ છે.

ડાર્વિનના ઉત્કાંતિ સિદ્ધાંતનું સારતત્ત્વ એ છે કે જાતિઓનો ઉગમ પ્રાકૃતિક તથા કૃત્રિમ વરણીઓ મારફત થાય છે. તેણે એવું ધોરણ લીધું કે સજ્જવ પદાર્થોની ઉત્કાંતિનાં મુખ્ય ઘટકો બિનનતા અને આનુવંશિકતા છે, વનસ્પતિઓ તથા પ્રાણીઓના હ્યાતી ટકાવી રાખવાના સંધર્ષ દરમયાન તેઓમાં થતાં પરિવર્તનો નિરંતર ચાલતાં રહે છે અને તેના પરિણામે વનસ્પતિ તથા પ્રાણીની નવી જાતિઓનો ઉગમ થાય છે. ડાર્વિને પોતાનો સિદ્ધાંત ‘જાતિઓનો ઉગમ’ (૧૮૫૯) નામે કૃતિમાં નિરૂપિત કર્યો હતો.—પૃ. ૧૩.

⁸ જુઓ ટિપ્પણી નં. ૧.

⁹ પુરુષોં, પિયેર-બેસેદ (૧૮૦૯—૧૮૬૫) — ફ્રેંચ વૃત્તવિવેચક, અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, નિર્મન-મૂડીવાદી વિચારક, અરાજકતાવાદનો સંસ્થાપક. તેને નાની ખાનગી માલિકી કાયમ રાખવાની આશા હતી, અને તેણે મોટી મૂડીવાદી મિલકતની નિર્મન-મૂડીવાદી દૃષ્ટિબંદુથી ટીકા કરી હતી. તેણે એવી “લોક-બોંક” સ્થાપવાની દરખાસ્ત કરી હતી કે જે “મુક્ત ધિરાણ” કરીને કામદારોને પોતાનાં ઉત્પાદનનાં સાધનો હાંસલ કરવામાં અને હાથકારીગરો બનવામાં મદદ કરે. પુરુષોનો એક બીજો પ્રત્યાધાતી અને તરંગી ખાલ ખાસ “વિનિમય બોંકો” સ્થાપવાનો હતો કે જે કામદાર લોકોના ઉત્પાદન માટે “વાજબી” વેચાણની વ્યવસ્થા કરી આપે, અને ઉત્પાદનનાં ઓળારો તથા સાધનોની ખાનગી માલિકીને અસર ન કરે. પુરુષો સર્વહારા વર્ગની ઐતિહાસિક ભૂમિકા ન સમજી શક્યો, અને તેણે વર્ગસંધર્ષ, સર્વહારા કાંતિ, તથા સર્વહારા વર્ગની સરમુખત્યારી પ્રત્યે નકારાત્મક વલણ દાખલ્યું. તે અરાજકતાવાદી હતો એટબે તેણે રાજ્યની આવશ્યકતાને નકારી કાઢી. પ્રથમ ઈન્ટરનેશનલ ઉપર પોતાના વિચારો લાદવાના પુરુષોપંથીઓના પ્રયાસોનો માર્ક્સ અને એંગેલ્સે સતત વિરોધ કર્યો હતો. માર્ક્સો ‘હિલસુઝીની દરિદ્રતા’

નામે પોતાની કૃતિમાં પ્રુધોપંથ ઉપર સખત પ્રથારો કર્યા હતા.
— પૃ. ૧૬.

^{૧૦} લાસાલપંથીઓ — જર્મન નિર્મન-મૂડીવાદી સમાજવાદી ફર્ડિનાન્ડ લાસાલના સમર્થકો. લિપાજિગમાં ભરાયેલી કામદાર મંડળોની કોંગ્રેસમાં ૧૮૬૩માં સ્થપાયેલા જર્મન કામદારોના સામાન્ય મંડળના તેઓ સભ્યો હતા. મંડળના પ્રથમ પ્રમુખ લાસાલે તેનો કાર્યક્રમ અને કાર્યનીતિ ઘડી કાઢ્યાં. કામદાર વર્ગની વ્યાપક રાજકીય પાર્ટીની સ્થાપના જર્મન કામદાર વર્ગાય આંદોલનના વિકાસમાં આગેકદમ સહી હતી. પરંતુ લાસાલ અને તેના અનુયાયીઓએ મુખ્ય સૌભાગ્યિક તથા રાજકીય સવાલોની બાબતમાં તકવાદી ધોરણ અપનાવ્યું. તેમણે એવી માન્યતા અખત્યાર કરી કે સામાજિક સમસ્યાને ઉકેલવા માટે પ્રશિયન રાજ્યનો ઉપયોગ શક્ય છે, અને તેમણે પ્રશિયાની બિસમાર્ક સરકાર જોડે વાટાધાટો કરવાની કોશિશ કરી. કાર્લ માર્કસ અને ફ્રેડરિક અંગેલ્સે લાસાલપંથી સિદ્ધાંત, કાર્યનીતિ, તથા સંગઠન-સિદ્ધાંતોની, જર્મન કામદાર વર્ગાય આંદોલનના તકવાદી વહેણ તરીકે સખત ટીકા કરી.
— પૃ. ૧૬.

^{૧૧} ઓવેનપંથીઓ — બ્રિટિશ તરંગી સમાજવાદી રોબર્ટ ઓવેન (૧૭૭૧ — ૧૮૫૮)ના સમર્થકો અને અનુયાયીઓ.

રોબર્ટ ઓવેને મૂડીવાદી પલ્બતિની સખત ટીકા કરી પરંતુ મૂડીવાદી આંતરવિરોધોનાં મૂળ કારણો તે જાહેર ન કરી શક્યો. તેનું મંત્રય એવું હતું કે સામાજિક અસમાનતાનું મુખ્ય કારણ ઉત્પાદનની મૂડીવાદી રીત નહિ પણ અપૂરતી વાકેફગારી છે, સામાજિક અસમાનતાને શિક્ષણ તથા સામાજિક સુધારાઓ મારફત દૂર કરી શકાય એમ છે. તેણે એવા સુધારાઓનો બહેળો કાર્યક્રમ રજૂ કર્યો. ભાવિ “તર્કસંગત” સમાજનું ચિત્ર તેણે નાની સ્વશાસિત વસાહતોના સમવાયના રૂપમાં દોર્યું હતું. પરંતુ પોતાના વિચારોને અમલી રૂપ આપવાના તેના પ્રયત્નો નિષ્ફળ ગયા. (જુઓ આ પુસ્તિકાનાં પૃષ્ઠ ૭૦—૭૩.)
— પૃ. ૧૮.

^{૧૨} ફૂરિયેપંથીઓ — ફૂરિય તરંગી સમાજવાદી ચાર્લ્સ ફૂરિયેના સમર્થકો.

ફૂરિયેએ મૂડીવાદી સમાજની આકરી ટીકા કરી અને માનવીય ભાવાવેગોની

અનુભૂતિ ઉપર આધારિત ભાવિ “સંવાદી” સમાજનું ચિત્ર રજૂ કર્યું. તેણે હિંસાત્મક કાંતિના ખથાલનો વિરોધ કર્યો અને એનું ધોરણ અપનાવ્યું કે ભાવિ સમાજવાદી સમાજમાં સંકમાણ કેવળ આદર્શ ફ્લાન્સ્ટેરેસની—જ્યાં લોકો સ્વેચ્છાઓ કામ કરે અને પોતાની મહેનતમાંથી આનંદ મેળવે એવી વસાહતોની—શાંતિમય હિમાયત મારફત થઈ શકે. પરંતુ કૂરિયેઓ ખાનગી માલિકીને નાભૂદ નહોતી કરી, તેની ફ્લાન્સ્ટેરેસમાં અમીરો તથા ગરીબો બેઉ હતા. (જુઓ આ પુસ્તકાનાં પૃષ્ઠ૭૦—૭૩.) —પૃ.૧૮.

^{૧૩} કાયે, એતિયેન (૧૭૮૮—૧૮૫૬) — દ્રોય નિર્મન-મુદ્દીવાદી વૃત્તાવિવેચક, તરંગી સામ્યવાદનો મુખ્ય નિર્દ્દિપક. તે એવી માન્યતા ધરાવતો હતો કે ગુદીવાદી પદ્ધતિની ખામીઓને સમાજની શાંતિમય પુનર્દાટના વડે દૂર કરી શકાય. તેણે પોતાના વિચારો «*Voyage en Icarie*» (૧૮૪૦) નામે કૃતિમાં નિર્દ્દિપિત કર્યા, અને અમેરિકામાં સામ્યવાદી વસાહત સ્થાપીને એ વિચારોને સાકાર કરવાની કોશિશ કરી. પરંતુ તેનો અખતરો નિષ્ફળ ગયો. (જુઓ આ પુસ્તકાનાં પૃષ્ઠ૭૦—૭૩.)

વાઈટલિંગ, વિલહેલ્મ (૧૮૦૮—૧૮૭૧) — જર્મન કામદાર વર્ગાય આંદોલનના આરંભમાં તેનો મુખ્ય આગેવાન, તરંગી “સમતાવાદી” સામ્યવાદનો સિદ્ધાંતકાર. અંગેલસે લઘ્યું છે કે વાઈટલિંગના વિચારોએ જર્મન સર્વહારા વર્ગના પ્રથમ સ્વતંત્ર સૌભાગ્યિક આંદોલન તરીકે ઈષ્ટ ભૂમિકા ભજવી હતી, પરંતુ વૈજ્ઞાનિક સમાજવાદના ઉદ્ય પછી એ વિચારો સર્વહારા વર્ગની વર્ગજગ્રતિના વિકાસમાં અવરોધ બની ગયા. —પૃ.૧૮.

^{૧૪} જુઓ ટિપ્પણી નં.૭.

^{૧૫} જુઓ ટિપ્પણી નં. ૩.

^{૧૬} જુઓ ટિપ્પણી નં.૨.

^{૧૭} આ નિર્દેશ આંતરરાષ્ટ્રીય સંગઠન ‘કોમ્યુનિસ્ટ લીગ’ (૧૮૪૭-૫૨)ના ૧૧ સભ્યોની ઉપર પ્રશિયામાં ચલાવવામાં આવેલા મુક્કદમા (૪ થી ઓક્ટોબરથી ૧૨મી નવોબર, ૧૮૫૨) પ્રત્યે છે. ભયંકર રાજદ્રોહના ઉપજવી કાઢેલાં

તહોમતો મૂકીને સાત આરોપીઓને કિલ્લામાં ત્રણથી છ વરસના કારાવાસની સજ કરવામાં આવી હતી.—પૃ.૨૪.

¹⁸ જુઓ — કાર્લ માર્ક્સ, ‘અંતરરાષ્ટ્રીય કામદાર મંડળના સામાન્ય નિયમો’.
— પૃ.૨૫.

¹⁹ જુઓ ટિપ્પણી નં. ૧૩.

²⁰ કોંગ્રેસ પોલોંડ — પોલોંડના રાજ તરીકે સત્તાવાર ઓળખાતો પોલોંડનો હિસ્સો.
૧૮૧૪-૧૫ની વિયેના કોંગ્રેસના નિર્ણય મુજબ રશીયાએ તેને પોતાના પ્રદેશમાં જોડી દીધો હતો.—પૃ.૨૮.

²¹ નેપોલિયન ત્રીજે (લુઈ બોનાપાર્ટ) (૧૮૦૮-૧૮૭૩) — નેપોલિયન પહેલાનો ભત્રીજે, દ્વિતીય પ્રભસત્તાકનો પ્રમુખ (૧૮૪૮-૫૧), ફ્રેંચ સમાટ (૧૮૫૨-૭૦).

બિસ્માર્ક, ઓટો ઓડવર્ડ લિયોપોલ્ડ (૧૮૧૫-૧૮૯૮) — પ્રશિયા તથા જર્મનીનો રાજપુરુષ તથા મુત્સદ્રી. તેની ગુહ તથા વિદેશ નીતિઓએ જુંકરો તથા મોટા મૂડીદારોના વર્ગના હિતમાં કામગીરી બજવી. તેણે ધારપાડુ લડાઈઓ તથા મુત્સદ્રીની તરકીબો મારફત ૧૮૭૧માં પ્રશિયાની સરદારી હેઠળ સંયુક્ત જર્મનીની સ્થાપના કરી. તે ૧૮૭૧થી ૧૮૯૦ સુધી જર્મન સામ્રાજ્યનો ચાન્સેલર હતો.

“૧૮૪૮ની કાંતિને તેની ધારી પુરોગામી કાંતિઓ કરતાં જરાય ઓછા નહિ ઓટલા વિચિત્ર સંગાથીઓ અને અનુગામીઓ હતા. કાર્લ માર્ક્સ કહેતા તેમ જે લોકોએ તેને દબાવી દીધી હતી તે જ લોકો તેના વસિયત વહીવટીઓ બની ગયા છે. લુઈ નેપોલિયનને સ્વતંત્ર તથા સંયુક્ત ઈટાલીનું સર્જન કરવું પડ્યું, બિસ્માર્કને જર્મનીમાં કાંતિકારી પરિવર્તનો કરવાં પડ્યાં અને હંગેરિયન સ્વતંત્રતા ફરી સ્થાપવી પડી.” (ફ્રેન્ડિક એગેલ્સ, ‘દંલોંડમાં કામદાર વર્ગની સ્થિતિની પ્રસ્તાવના’) — પૃ.૨૮.

²² રશીયન સામ્રાજ્યમાં જોડી દેવામાં આવેલા પોલીશ પ્રદેશોમાં ૧૮૬૩માં શરૂ થયેલા રાષ્ટ્રીય મુક્તિ વિખ્લવ પ્રત્યે આ નિર્દેશ છે. આરશાહીના લશકરે વિખ્લવને

પાશવી રીતે દબાવી દીધો. વિખ્લવના રૂઢિયુસ્ત આગેવાનોએ પદ્ધતિમાં પુરોપિયન સરકારોની દખલગીરીની આશા રાખેલી, પરંતુ એ સરકારોએ પોતાને ડિપ્લોમેટિક કારવાઈ પૂરતી જ સીમિત રાખી અને હકીકતમાં વિખ્લવીઓને દગ્દો દીધો.—પૃ.૨૮.

^{૨૩} ૧૮૪૫માં ચુંટાયેલા પોપ પાયસ નવમાને “લિબરલ” ગણવામાં આવતો પરંતુ તે સમાજવાદ પ્રાણે નિકોલાઈ પહેલા જેટલો જ દ્રોષ ધરાવતો હતો. નિકોલાઈ પહેલાએ તો ૧૮૪૮ની કાંતિ પહેલાં જ પુરોપના સિપાહીની ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું હતું.

ઓસ્ટ્રેલીયન સામાજિકનો ચાન્સેલર અને પુરોપીય પ્રત્યાધાતનો ઉધારો આગેવાન મેટેરનિયમ એ વખતે, પ્રખ્યાત ફ્રેચ ઈતિહાસકાર તથા પ્રધાન, મોટી ધિરાળું તથા ઔદ્યોગિક મૂડીના સિદ્ધાંતકાર, અને સર્વહારા વર્ગના કટુર દુશ્મન ગીજો જેણે વિશેષ રૂપે સારા સંબંધો ધરાવતો હતો. ગીજોએ પ્રશિયન સરકારના દબાવુને વશ થઈને કાર્લ માર્ક્સને પેરિસમાંથી હટપાર કર્યા હતા. જર્મન પોલીસ કેવળ જર્મનીમાં જ નહિ પરંતુ ફ્રાંસ, બેલિન્યમ, તથા સ્વિટ્જરલ્યાંડમાં પાણ કોમ્યુનિસ્ટોની કનફરન્સ કરતી, અને તેમને પ્રચારકાર્ય કરતાં અટકાવવા માટે દરેક ઉપાય અનુમાવતી.—પૃ.૩૫.

^{૨૪} હાક્સથાઉસેન, ઓગસ્ટ (૧૭૯૨—૧૮૬૬) — પ્રશિયન ઉમરાવ. નિકોલાઈ પહેલાએ તેને રશયા આવવાની અને દેશની ઝેતીવાડી પદ્ધતિનો તેમ જ રશયન કિસાનોની નિંદગીનો અભ્યાસ કરવાની પરવાનગી આપી હતી (૧૮૪૩-૪૪). રશયામાં ઝેતીવાડીના સંબંધોમાં સામુદ્યાધિક માલિકીની પ્રથાના અવશેષો વિશે એક પુસ્તક તેણે લખ્યું હતું.—પૃ.૩૬.

^{૨૫} માઉરેર, ગેઓર્ગ લુડવિંગ (૧૭૮૦—૧૮૭૨) — જર્મન ઈતિહાસકાર, પ્રાચીન અને મધ્યયુગીન જર્મનીની સામાજિક પદ્ધતિનો અભ્યાસી. મધ્યયુગીન માર્ક બિરાદરીના ઈતિહાસના અભ્યાસમાં તેણે મોટો ફાળો આપ્યો હતો.—પૃ.૩૬.

^{૨૬} મોર્ગન, લેવિસ હેનરી (૧૮૧૮—૧૮૮૧) — અમેરિકી નૃવંશવિદ, પુરાતત્વવિદ, અને ઈતિહાસકાર. અમેરિકી ઈન્ડિયનોના જીવન તથા સામાજિક પદ્ધતિના અભ્યાસ દરમિયાન એકઠી કરેલી માનવજીત-વિકાસ સંબંધી વિસ્તૃત.

સામગ્રીના આધારે તેણે આદિમ સામુદ્રાયિક પદ્ધતિના મુખ્ય આંધાર તરીકે પરિવારના વિકાસનો પોતાનો સિદ્ધાંત ધર્યો હતો. એ ઉપરાંત તેણે વર્ગો પૂર્વના સમાજના ઈતિહાસને કુમવાર ગોઠવવાની કોશિશ કરી હતી. કાર્બ માક્સ્ તથા ફ્રેડરિક એંગેલ્સ મોર્ગનની કૃતિઓ અંગે ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. માક્સ્ મોર્ગનની કૃતિ ‘પ્રાચીન સમાજ’ (૧૮૭૭)ની વિગતવાર તારવાળી તૈયાર કરી હતી, અને એંગેલ્સે ‘પરિવાર, ખાનગી મિલકત, અને રાજ્યની ઉત્પત્તિ’ નામની પોતાની કૃતિમાં, મોર્ગને એકત્રિત કરેલી હકીકતી સામગ્રીનો ઉલ્લેખ કર્યો હતો.—પૃ.૩૬

²⁷ જેહાદો—જેક્સલેમ તથા અન્ય “પવિત્ર સ્થળો”માં મુસલમાનો પાસેથી ખ્રિસ્તી દેવળો પાછાં કબજે કરી લેવાના બહાના હેઠળ, ૧૧ મી—૧૩મી સદીઓ દરમિયાન પશ્ચિમ યુરોપના ઢાકોરો તથા સામંતી ઉમરાવોએ પૂર્વના પ્રદેશો પર કરેલી લશકરી-સંસ્થાનવાદી ચડાઈઓ.—પૃ.૪૦.

²⁸ માક્સ્ અને એંગેલ્સે પોતાની આગલી કૃતિઓમાં, “શ્રમનું મૂલ્ય” તથા “શ્રમની કિંમત” શબ્દોને બદલે “શ્રમશક્તિનું મૂલ્ય” અને “શ્રમશક્તિની કિંમત” જેવા વધારે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કર્યો છે.—પૃ.૪૪.

²⁹ આ નિર્દેશ ચૂંટણી સંબંધી સુધારા પ્રત્યે છે. ઉપ્યુક્ત બિલ હાઉસ ઓફ કોમન્સમાં ૧૮૭૧માં પાસ થયું હતું, અને તેને હાઉસ ઓફ લોડ્જમાં આખરી બહાલી ૧૮૭૨માં આપવામાં આવી હતી. એ સુધારો જમીનદાર તથા નાણુકીય ઉમરાવશાહીની રાજકીય ઈજારદારી વિરુદ્ધ લક્ષ્યાંકિત હતો, અને તેણે પાલમિન્ટને ઔદ્યોગિક મૂડીદાર વર્ગની પહોંચમાં આણી દીધી. સુધારા માટેના સંઘર્ષમાં પ્રેરક પરિબળો રહેલા સર્વહારા વર્ગ તથા નાના મૂડીદારોને લિબરલ મૂડીદાર વર્ગ દળો દીધો અને તેઓને ચૂંટણી સંબંધી અધિકારો ન આપ્યા.—પૃ.૬૨.

³⁰ ફ્રેચ લેજિટિમિસ્ટો—મોટા જમીનદાર ઉમરાવોનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતા અને ૧૮૭૦માં ઉથલાવી પાડવામાં આવેલા બોર્ડોન રાજવંશના સમર્થકો. નાણુકીય ઉમરાવશાહી તથા મોટા મૂડીદારોની ઉપર આધાર રાખતા ઓર્લિયન્સ રાજવંશની વિરુદ્ધ સંઘર્ષમાં તેમણે સામાજિક વાણીવિલાસનો

આંશરો લીધો અને મૂડીવાદી શોધણ સામે કામદાર જનતાનું રક્ષા કરતા હોવાનો દાવો કર્યો.

તરુણ ઈંગ્લોડ—ઓગાણોસમી સદીના પાંચમા દાયકામાં સ્થાપવામાં આવેલું દોરી પાર્ટીના બ્રિટિશ રાજકારણીઓ તથા લેખકોનું જથ. ‘તરુણ ઈંગ્લોડ’ના આગેવાનોએ મૂડીદાર વર્ગના વધતા જતા આર્થિક તથા રાજકીય સામર્થ્ય અંગે જમીનદાર ઉમરાવોના અસંતોષને વ્યક્ત કરવાની સાથે સાથે, કામદાર વર્ગને પોતાના પ્રભાવ હેઠળ આણવા માટે તથા મૂડીદાર વર્ગ સામેના સંઘર્ષમાં તેનો ઉપયોગ કરવા માટે, વાણીવિલાસની ચાલાકીઓનો આશરો લીધો. — પૃ.૬૩.

^{૩૧} સિસમોન્ટી, ગાં શાર્લ લેઓનાર્ડ સિમોન (૧૭૭૩—૧૮૪૨) — સિવસ અર્થશાસ્ત્રી અને ઈતિહાસકાર, નિમન-મૂડીવાદી સમાજવાદનો નિરૂપક. સિસમોન્ટી મોટા મૂડીવાદી ઉત્પાદનમાં પ્રગતિશીલ વહેણો જેઈ ન શક્યો. તેણે પુરાણી પદ્ધતિઓમાં તથા પરંપરાઓમાંથી, એવોદ્યોગિક ગિલ્ડોમાં તથા પિતુશાસિત જેતીવાડીમાંથી, એવા નમૂનાઓ શોધવાની કોશિશ કરી ને નવા આર્થિક સંઝેગોને અનુરૂપ નહોતા. — પૃ.૬૫.

^{૩૨} ગૂન, કાર્લ (૧૮૧૭—૧૮૮૭) — જર્મન નિમન-મૂડીવાદી વૃત્તવિવેચક. — પૃ.૬૮.

^{૩૩} બાબ્યોદ્, ફ્રાંસુઆ નોંદોલ (ગ્રાભ્યુસ) (૧૭૬૦—૧૭૮૭) — ફ્રેંચ કાંતિકારી, તરંગી સામ્યવાદનો પ્રખ્યાત નિરૂપક. તેણે એક ગુપ્ત મંડળ સ્થાપ્તું નાણે કાંતિકારી સરમુખત્યારી સ્થાપવા માટે તથા લોકસમુદ્દાયોનાં હિતોનો બચાવ કરવા માટે હથિયારબંધ વિખ્યાતનું કાવતર ઘડી કાઢ્યું. પરંતુ કાવતરું પકડાઈ ગયું અને ૧૭૮૭ના મે માસની ૨૭મી તારીખે બાબ્યોદ્ફની હત્યા કરી નાખવામાં આવી. — પૃ.૭૦.

^{૩૪} સોટ સાઈમન, હેનરી ફ્લોડ (૧૭૬૦—૧૮૨૫) — ફ્રેંચ તરંગી સમાજવાદી. તેણે મૂડીવાદી પદ્ધતિ ઉપર પ્રાહારો કર્યા, અને ગિલ્ડના સિલ્વાંત ઉપર આધારિત સમાજની સ્થાપનાની હાકલ કરતો કાર્યક્રમ રજૂ કર્યો. સોટ સાઈમનના મંત્ર્ય મુજબ, ભાવિ સમાજમાં સૌંદ્રે કામ કરવાનું હતું, અને સમાજમાં દરેકનું સ્થાન તેની શ્રમનિલિંગાઓના આધારે થવાનું હતું. તેણે

ઉદ્યોગ જેણે વિજ્ઞાનના એકીકરણનો અને ઉત્પાદનના કેંદ્રીકરણ તથા આયોજનનો સિદ્ધાંત આગળ ધર્યો. પરંતુ સોટ સાઈમને ખાનગી માલિકી ઉપર તથા મૂડીમાંથી ઉપજતા વ્યાજ ઉપર પ્રખારો ન કર્યા. તેણે રાજકીય સંવર્ધણ તથા કાંતિ પ્રત્યે નકારાત્મક ધોરણ અપનાવ્યું. તે સર્વહારા વર્ગની ઐતિહાસિક કામગીરી સમજ ન શક્યો. તેની માન્યતા એવી હતી કે સરકારી સુધારાઓના તથા સમાજને નવા ધર્મની ભાવનાની નૈતિક કેળવાણીના પરિણામે વર્ગવિરોધો નાબૂદ થઈ જશે.

કૂરિયે તથા ઓવેન વિશે જુઓ ટિપ્પણી નં. ૧૧ અને ૧૨.

^{૩૫} ચાર્ટર્ડ અમ — મુશ્કેલ આર્થિક હાલત અને આપખૂદ શાસને જગાવેલું બ્રિટિશ કામદારોનું વ્યાપક કાંતિકારી આંદોલન. આંદોલનનો આરંભ ઓગણીસમી સદીના ચોથા દાયકાના અંતમાં વિશાળ સભાઓ તથા દેખાવોથી થયો હતો, અને તે સમયાંતરે ચાલતું છઠ્ઠા દાયકા સુધી ચાલુ રહ્યું હતું. — પૃ.૭૩.

^{૩૬} પ્રભાસતાકની તેમ જ લોકશાહીવાદી તથા સામાજિક સુધારાઓની હિમાયત કરતા «Reforme» (૧૮૪૩થી ૧૮૫૦ સુધી પેરિસમાં પ્રકાશિત) અખભારના સમર્થકો — પૃ.૭૩.

^{૩૭} લેફ્ટ-રોલો^૧, અલેક્સાન્ડર આજિગુસ્ટ (૧૮૦૭—૧૮૭૪) — ફ્રેંચ વૃત્તાવેચક, રાજકારણી, નિમન-મૂડીવાદી લોકશાહીવાદીઓનો આગેવાન, «La Réforme» અખભારના મુખ્ય તંત્રી, ૧૮૪૮માં કામચલાઉ સરકારનો સત્ત્ય.

લુઈ બ્લાં (૧૮૧૧—૧૮૮૨) — ફ્રેંચ નિમન-મૂડીવાદી સમાજવાદી, ઐતિહાસકાર, ૧૮૪૮-૪૯ની કાંતિનો આગેવાન. તેણે મૂડીદાર વર્ગ જેણે તડાંડ કરી લેવાની કોશિશ કરી હતી. — પૃ.૭૪.

^{૩૮} ૧૮૪૬ના ફેબ્રુઆરીમાં, રાષ્ટ્રીય સ્વતંત્રતા હાંસલ કરવાના ઉદ્દેશે, પોલીશ પ્રદેશોમાં વિદ્રોહની તેયારીઓ કરવામાં આવી હતી. એ વિદ્રોહના મુખ્ય પદ્ધતિકો પોલીશ કાંતિકારી લોકશાહીવાદીઓ હતા. — પૃ.૭૫.

^{૩૯} ફ્રેડરિક ઓગેલ્સની કૃતિ ‘સામ્યવાદના સિદ્ધાંતો’ ‘કોમ્યુનિસ્ટ લીગ’ના કાર્યક્રમનો પ્રારંભિક ખરડો છે. ‘કોમ્યુનિસ્ટ લીગ’ની બીજી કોંગ્રેસે (૧૮૪૭ની રઘુમી નવોંબરથી ૮મી ડિસેંબર) કાર્લ માર્ક્સ તથા ફ્રેડરિક ઓગેલ્સને,

કાર્યક્રમ જાહેરનામા તરીકે ઘડવાની કામગીરી સોંપી. માર્ક્સિસમાં સંસ્થાપકોએ
‘કોમ્યુનિસ્ટ જાહેરનામું’ ઘડતો વેળા, ‘સામ્યવાદના સિદ્ધાંતો’માં રજૂ
કરવામાં આવેલાં કેટલાંક વિધાનોનો ઉપયોગ કર્યો હતો.— પૃ.૭૮.

⁴⁰ ૨૨ અને ૨૩ નંબરના સવાલોના જવાબોને બદલે હસ્તપ્રતમાં લખવામાં
આવ્યું છે કે “મૂળ જવાબ જેમનો તેમ”, જેનો ટેખીતો અર્થ એવો નીકળે
છે કે ‘કોમ્યુનિસ્ટ લીગ’ના કાર્યક્રમના પ્રારંભિક ખરડાઓમાંના કોઈ એકમાં
નિરૂપિત જવાબ જેમનો તેમ રાખવાનો હોય. પરંતુ કાર્યક્રમનો એવો ખરડો
મળી શક્યો નથી.— પૃ.૮૬.

વाचकोने

अમारा आ प्रकाशनना वस्तु, भाषा, रंगरूप
तथा छपाई जेवा प्रत्येक अंग विशे आपना अभिप्रायो
मेणवतां अमने अत्यांत आनंद थશે. નવां પ્રકાશનો
વિશે આપनાં સલાહસૂચનોનું અમારા કાર્યાલયમાં સાભાર
સ્વાગત થશે.

પ્રગતિ પ્રકાશન

૨૧ જુબોદ્દકી બુલવાર,
મોરકો (સોવિયેન સંધ)

Редактор М. ТАРВЕРДОВА
Художественный редактор В. КОЛГАНОВ
Технические редакторы Т. ВОСКРЕСЕНСКАЯ
и Е. ГОЦ

Подписано к печати 3.VII.1974. Формат 84×108¹/₃₂.
Бум. л. 1¹/₄. Печ. л. 5,88+0,31 п. л. вклеек.
Уч.-изд. л. 7,21. Изд. № 17856. Заказ 950.
Цена 22 к. Тираж 7000.

Издательство «Прогресс»
Государственного Комитета
Совета Министров СССР по делам издательств,
полиграфии и книжной торговли
Москва, Г-21, Зубовский бульвар, 21.

Ордена Трудового Красного Знамени
московская типография № 7 «Искра революции»
«Союзполиграфпрома» при Государственном
комитете Совета Министров СССР по делам
издательств, полиграфии и книжной торговли.
Москва, Г-19, пер. Аксакова, 13.

К. МАРКС и Ф. ЭНГЕЛЬС
МАНИФЕСТ КОММУНИСТИЧЕСКОЙ ПАРТИИ
на языке гуджарати